

સૌરાષ્ટ્રના રબારી સંતો , ભક્તો અને સતિઓ.

યુ.જી.સી.માન્ય  
માઈનોર રીસર્ચ પ્રોજેક્ટ

### -: શોધકર્તા :-

## પ્ર.ડૉ.ખીમાભાઈ હાજાભાઈ કરમટા

સ્વ.શ્રી. એન.આર. બોરિયા એજયુકેશન

ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ,મેંડરડા.

ପ୍ରକାଶକ

ઈ.સ. ૨૦૧૪.

## સૌરાષ્ટ્રની રબારી જ્ઞાતિની ઉત્પત્તિ અને ઐતિહાસિકતા

સૌરાષ્ટ્રના અલગ પ્રાંતમાં વસ્તા રબારીઓ દરેક પ્રાંતમાં અલગ અલગ નામથી ઓળખ ધરાવે છે. દા.ત. પોરબંદરથી ઉના અને જૂનાગઢ સુધીના પંથકમાં વસ્તા રબારીઓનો સમૂહ સોરઠીયા રબારી તરીકે ઓળખાયછે. રાજકોટ મોરબી પંથકમાં વસ્તા રબારીઓ 'વિશોયા' રબારી તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તા રબારીઓ જાલવાડી રબારી તરીકે ઓળખાય છે. તો ભાવનગર અને અમરેલીપંથકના રબારી ઓ બહુદ્યા'ગુજરાતીરબારી' તરીકે, તો દ્વારકા પંથકમાં વસ્તા રબારાઓ 'ભોપા' તરીકે ઓળખાયછે. રબારીઓની અંશી ઓળખ પ્રાંતભેદનાકારણે ઉભી થઈ છે જે પ્રદેશમાં વસ્તા એ પ્રદેશનું નામ લાગ્યું દા.ત.સોરઠમાં વસ્તા 'સોરઠી યા રબારી' અહીં રૂપાંશી એ કરવાની કે, ભાવનગર અને અમરેલી પંથકમાં વસ્તારબારીઓ 'ગુજરાતી રબારી' તરીકે શામાટે ઓળખાય છે? એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય, પરંતુ તેનો ઉત્તર અસાંપદે છે કે, તે રબારીઓ ૧૭ અને ૧૮મી સદીમાં ગુજરાતમાંથી આવીને અહીં વસેલા છે. એટલે ગુજરાતનીમૂળ ધાપથી જ ઓળખાય છે.

'રબારો' શબ્દનો અર્થ : સામાન્ય રીતે રબારી જ્ઞાતિની ઉત્પત્તિ અંગે સંખ્યાબંધ વિજ્ઞાનોએપોત પોતાની રીતે તારણો આપવાનો પ્રયાસ કર્યો છે. એ ચર્ચા આરંભતાં પહેલાં 'રબારી' શબ્દ કેવી રીતે અસ્તિત્વ માં આવ્યો તે સંદર્ભે થોડોવિચાર કરીએ. તો ભારતના અન્યભાગોમાં પણ આ જ્ઞાતિ વસે છે. રાજસ્થાનમાં 'રબારી'દેવાં સી તો ગુજરાતમાં 'રાયક' દસ્તાઈ તો કેટલાક રાજ્યોમાં ગડરિયાં, પાલ, વગેરે શબ્દોથી ઓળખાય છે. જામનગર ગેજેટ પણ આ સંદર્ભે નોંધે છે કે, રબારીઓ મૂળ રાજ્યૂત હતા. પણ એમાંનો એક પુરુષ રાજ્યૂત કન્યાસાથે ન પરણ્યો તે થી તેના વંશજો હવે રાજ્યૂત કન્યાને પરણી નથી શકતા એટલે તેઓ રાહબારી—રૂઢિ—રિવાજાનુસાર ન ચાલન છે / (રસ્તો ચાલનાર) કહેવાયા.<sup>1</sup>

ઉપર્યુક્ત વિદ્યાન કરતાં સ્વામી સુધાનંદ યોગી 'રબારો' શબ્દનો અર્થ અલગારીતે આપે છે તે વિચારવા યોગ્ય છે. તે રબારીઓનો યદ્વારંશમાં સમાવેશ કરીને કહે છે. 'યદ્વારંશની એક બહુત બડીઆબાઈક ઈરો (ધનવાદે) કહા જાતા થા. પેસે કા માલીકકો હી ધની યા ધનવાન માના જાતા થા. અત પણું એક માલીક કો હી ધનીયા ધનવાન માના જાતા થાઈસ લિયે યદ્વારંશ કે જિન પરિવારો ને બકરી, લેડ, ઊંટની, ઔર ઊંનકે બચે કો અપનીઆમદની કા સાધન બનાયા વહ રબારી(પણ ધન) વાલે કહલાયે.

સોરઠમાં એક માન્યતા એવી પણ હતી કે 'રા' ની બારી સામે આવીને વસ્યા એટલે રાહ—બારી કહેવાયા તેન રબારી થયું. પરંતુ આ વાતને કોઈ રીતે સમર્થન મળી શકે તમ નથી. કારણકે રાજસ્થાન માં વસ્તાવસ્તા રબારીઓ કયાં 'રા' ની બારી સામે વસ્યા હતા..? આ બાબતે સુધાનંદ યોગીની વાત વધારે બંધ બેસ્તીહોય વ્યાજબ છે. પરંતુ એ વ્યાજબીપણાને આપણે આગળ ચર્ચામાં વણી લઈશું.

### રબારીની ઉત્પત્તિ

રબારીઓની ઉત્પત્તિ અંગે આપણા ઘણા વિજ્ઞાનોએ તર્ક—વિતર્ક કર્યો છે, તારણો પણ આપ્યા છે, પંચતુ આ બધામાં મોટાભાગના અનુમાનો માત્ર છે. કેટલાક એવું માને છે કે, રબારીઓ બહારથી આવેલીજાતિ છે ઉંમુત્રફિયા નામની એક અંગ્રેજી મહિલાના જવયિફમક્ષર ઈમયક્ષણિં – નામના પુસ્તકમાં રબારીઓનેઈ.સ પૂર્વ ૫૦૦ માં બહાર થી આવેલી જાતિ ગણે છે. રબારી લોકો ઊંટ પાળતા એટલે તાંત્રો પર્શીયન, ચીકઅને મધ્ય – એશીયાના લોકો હતા એવું તારણ આપવામાં આવ્યું છે. એ દ્રષ્ટિએ વિચારવામાં આવે તો ભારતનીમોટાભાગનીજાત ઈઓ બહારથી આવેલ હોવાનું માનવું પડે.

રબારીઓની ઉત્પત્તિ અંગે આપણે વિસ્તૃત ચર્ચા કરી શકીએ. અત્યાર સુધી થયેલા તારણોનું ખંડન મંડન પણ કરી શકીએ. પંચતુએ એક આખો સ્વતંત્ર વિષય બની શકે. આપણે અહીં રબારી જ્ઞાતીમાંસંતો ભક્તો અને સતી વિશે કેટલીક નક્કર અને આધારભૂત સાખ્રગીના આધારે ટૂંકાણમાં જ વાત કરીશું.

રબારીજ્ઞાતિ અને બારોટની માન્યતા મુજબ ભગવાન શંકરે પાર્વતીના ઊંટના રક્ષાણથે સાંબદ (શામળા)ને ઉત્પત્તિ કરેલો અને તેના લગ્નરાય નામની અપ્સરા જોડે કરવામાં આવ્યાં એટલે તના સંતાનો રાયકકહેવાયાં. પરંતુપ્રશ્ન એ ઉદભવે કે, બધા જ રબારીઓ આમાંથી જ ઉત્પન્ન થયા? ના એવું નથી, રબારીઓ મૂળકણ્ઠિય હતા.

અને મેરુ પર્વતમાં એમનો વસવાટ હતો. રબારીઓના વહીવચા બારોટ અને ભીર હતા. એમનીહસ્તપ્રતોમાં ઉદ્દેશ્ય પ્રમાણે રબારીઓ ક્ષત્રિયો જ હતા. એવું પ્રતિપાદન થયા વગર રહેતું નથી. આ બાબતનીઆપણે સ્પષ્ટપૂર્વક જ અહી ચર્ચા કરવાનો ઉપક્રમ રાખ્યો હોય અન્ય સંદર્ભો ઘણે લેતા નથી કારણકે, એ બધાંઅનુમાનો માત્ર છે.

રબારી જ્ઞાતિની ઉત્પત્તિ મેરુ પર્વતની તળેટીમાં થઈ હોવાનું કહેવાય છે. એ સમયે રાક્ષસોના ગ્રા સથી બચવા માટે જ્યાંખોએ ક્ષત્રિયોની ઉત્પત્તિ માટે યજ્ઞ કર્યો એમાંથી પરમાર, ચૌહાણ, સોલંકી જેવાક્ષત્રિયો ની ઉત્પત્તિ થઈ. આ ક્ષત્રિયોના લગ્ન સાંબડની કન્યાઓ નામલદે, પ્રેમલદે, કામલદે સાથે થયાં. એટલેરાયકા થય | એવો અંદાજ પણ બાંધવામાં આવે છે.

મૂળ અટકોનું કાળજીમે વિભાજન થતું રહ્યું પુંજા લીબડીયાની હસ્ત પ્રતોમાં ૧૪૭ અટકોરબા રીઓની બોલે છે. જ્યારે બારોટ અને જ્ઞાતિજનોની જાણકારી પ્રમાણે 'વિહોતેરનાત' એવું બોલાય છે. વિહોતર એટલે વીસ - સો - તેર એટલે ૧૩૭ અટકો રબારી જ્ઞાતિમાં છે. આ ૧૩૭ અટકોમાં ક્યાંક કેટલીકક્ષતિઓ પાઠાંતરોપણ છે. અહી મેં દશવિલી ૧૩૭ અટકો ભગવાનભાઈ ખાંબલા કાતર, તા. રાજુલા પાસેથીમળેલી અટકો નોંધેલાં. જે આ પ્રમાણે છે.

આલ, ભાંગવા, છેલાણા, અજાણા, ભરુ ચરકય, આણ, ભૂખા, ચોપડા, આમલા, ભુસલા, ચરકટા, ઈ લવા, ભુંગલીયા, ચૌહાણ, ઈહોર, ભુંભલીયા, ચોરા, ઉનાઈ, ભુંગોર, ડીસા, ઉલવા, ભોકુ, ડોડિયા, ઉમોટ, ભાંગરા, ડાન્બી, ભાર, ભારાઈ, જુગત, ધવલ, બઠ, ભુંપે, ધામા, ભારડ, ભીટ, ધારલુટીયા, બુચોત, ભોણ, દેવ, બદ્ધયા, ભેમળા, ગરચર, ભાણેશ, ભાખર, ગુર્જર, ભાટ્યા, ચાવડા, ગંભીર, ગોહિલ, લવતગા, શીલોર, ગુરગીયા, લંઘર, શોખા, ધાંધોળ, લલુતરા, સાંબડા, ધાટીયા, મોરણ, સાવધરિયા, ધેંધવા, માંગર, શેલાર, હૂણા, મકવાણા, સિંધલ, હરણ, મોરી, સાંગાવાડીયા, હુચોલ, ભરકટા, સોલંકી, જાદવ, મછાણ, વાતમા, જીડ, મારુ, વાંગલ, જોગણા માણસુંદા, વાધડા, કરમટા, મયરા, વેરાણા, કટારા, યાનાર, વરછર, કોડિયાતર, નાંગેસ, વસા, કોલા, પરમાર, વાવા, કાલોર, પઢિયાર વઈ, કેડ પસવાળા, વાઢેર, કાછેલા, પાનકટા, વાઢેલા, કોડ, પરમટા, જોર, લો, પાટવાળ, જોગણા, કલોતરા, પુંછલા, ખર, પંડત, ભાડકા, આંબડા, પવાર, માયડાવ, ખટાણા, પઢે રીયા, સાવધોર, ખારોડ, રોજ્યા, મોરી, ખારવાડીયા, રોજ, દેસાઈ

ઉપરોક્ત અટકોમાં પણ યાદી તૂટે છે. ૧૪૭ અટકોની યાદી પણ અહી આપી શકાય પરંતુ સ્થળસંકે ચને કારણે આપણે એ યાદી જોતા નથી. પરંતુ ટૂંકમાં આ બધા અટકો ક્ષત્રિયોની અટકોનું વિભાજન માત્રાં. એ બધતના સ્પષ્ટીકરણ માટે આપણે કેટલાક ઉદાહરણ સાથે ચર્ચા કરવાનો ઉપક્રમ રાખ્યો છે.

દા.ત. કરમટા અટકની ઐતિહાસિકતા અને પૂર્વજીવના નામ તપાસીએ તો મરુપર્વતમાં પરમાર અટકહતી ત્યાંથી રાજસ્થાન આવ્યા. અને પરમારો બધા જ રાજ્ય કરી શકે નહીં. રાજમાં મોટો પૂત્ર રાજ્યદિકારીગણાતો પછીના તેના નાના ભાઈઓનો પરિવાર રાજ્યપૂત ગણાતો હોવાં છતાં પોતાનો વ્યવસાય કરવો પડતોએટલે એ સ મયે કૃષિ અને પશુપાલન મુખ્ય વ્યવસાય હતા. એમાંથી કેટલાક ક્ષત્રિઓ પશુપાલનનો વ્યવસાયખૂબ જ સમૃદ્ધ હતો. આ પશુપાલકો પાસેથી એક ઉટ કર સ્વરૂપે લેવામાં આવતું એ વખતે—નીમો—જેતો—જુજુણ—જગમાલ—માલશામ ણાનીદિકરી વાનુને પરણેલો જગમાલનો વજ્યો એમણે રાજસ્થાનમાં પશુપાલક પર લેવાતો કર એકલાઅ ભરીને કરમટાડીયો ત્યારથી પરમારમાંથી કરમટા અટક પડી.

## છેલાણા /ભારાઈ

મૂળ મહિડા રાજ્યપૂતો હતા. માનગઢથી મારવાડ આવ્યાં ત્યાં પાંચ પેઢી રહ્યા. તેના મૂળ પૂરુષનાં ના મ જોઈએ તો રૈયામલ મહિડો—માનસંગજી—શત્રુસલ્ય—વણવીર — દેવાંગ — જોલો—જગમાલ—આભેરાજ—એભલ—જ શોઆ જશાથી રબારી શબ્દ લાગુ થયો. આ લોકો વિસ્થાપિત થતાં માનગઢથી કરણગઢ કચ્છ થઈ સાલેમાળ કુંગર આવ્યાત્યારે બોડોછેલાણા(જશાથી છેલાણા અટક પડેલી.) મુખ્યાર હતો. એનો એક દંડો મળે છે.

" સાંઘયુને સાલેમાર , બળતીયું બોળાતણું  
ત્યાં દુજબો દુકાળ , છોરુ નાભાવ્યા ચારણતણા" "

છેલાણામાંથી ભારાઈ અટક કઈ રીતેપડી તેનો પણ ઈતિહાસ છે. લાખા ફુલાણીનું લશકર સૌરાષ્ટ્રમાં આ વેલું ત્યારે બોડા છેલાણાના દિકરા મેંદરા છેલાણાએ જમાડયું એના દુહા પણ મળે છે.

" માથ ભરાવે મેંદરો , કટક આડો જાય ,  
આણ છે લાખા ફુલાણીની જે વણ પીધે ધેર જાય" "

લશકર અને ધોડાને સાલેમાળના દુંગરમાં મેંદરે છેલાણે સાચવ્યા એટલે કહેવાયું કે

" લાખે ભારાઈ થાપીયા ,  
એક ગુર્જર બંડ ગયા.  
બીજા સોરઠ ધરસારી" "

લાખા ફુલાણી મેંદરા છેલાણાની સમૃદ્ધિ અને ઉદારતા જોઈ ભારે નો ઈલ્કાબ આપે છે. આ ભારેનું ભારાઈ થયું

## કલોતરા

કલોતરા રબારીનો ઈતિહાસ ખૂબ જ ટૂંકો છે, કલોતરા રબારી ક્ષત્રિય માંથી નહિ પંતુ બ્રામ્ણ માંથી આવેલા છે, વડનગરના બ્રામ્ણા ભૂદરજી વટલાણા એમના વંશજો આ પ્રમાણે છે ભૂદરજી-મોરાર-મકન-ભાવો-જેદવ-હરશંકર-પરભુજી-ભાવોહરિભાઈ-પિતાંબર - આત્મારામ - કરશનજી-ગોવિદજી-ભૂદરજી-જશોધર ર ભૂધર અને મકન બે ભાઈઓ હતા, એમાં ભૂધર ના કલોતરા અને મકન ના વાગોડ થયા.

એક સ્પષ્ટતા એ કરવાની કે, કરમટા અને કલોતરા ભાઈઓ ગજાય છે તે માન્યતા ખોટી છે. કારણકે, કલોતરા મૂળ બ્રાહ્મણમાંથી આવેલા છે. જ્યારે કરમટા પરમાર રાજપૂત હતા.

## હરણા

હરણા અટક મૂળ સોલંકી રાજપૂતમાંથી પડી હરણાસા ગામ વસાવ્યું ત્યાંથી હરણા અટક પડી. હરણા અને ખટાણા હરણાસા ગામેથી આંબલા ગામે આવ્યા અને ત્યાંથી જુદા પડ્યા. એટલે બંને એક જ અટક સોલંકીમાંથી છૂટા પડેલા છે.

## વેગડ

વેગડ ખરવડા રાજપૂત હતાં. મૂળ વાલીગઢથી વેગડ થયા. વાલીગઢમાં સેજડીવાવ અને રાજાવાવ બંધાવી ત્યાંથી પેઢવાડા અને પછીથી ચરખડી ગામ વસાવ્યું.

## હાથલ :

હાથલ અટક પરમાર રાજ્યૂતોમાંથી જન્મી છે. હાથસાડી રાજ્યાની હતી. તેના નીચે ઉપ ગામ હતા. ભાવનગર જિલ્લાના રબારીઓમાં આ અટક વિશેષ છે.

## ચાહાણ :

આ રાજ્યૂતની મૂળ અટક જ છે. રાજ્યસ્થાનના માદવપુર બેટળીની બાજુમાં સેજા ચૌહાણી એમનો ઈતિહાસ મળે છે. સેજા ચૌહાણનો તેલર-અજેપાળ-સોનપાળ-બાવનદે-ભાનુ-માણકદે-હુલર-સિંધરો-લાખણસી-હુલર-પુલ- જાલો-બાલો-કરણો-વરસો વરસાથી રબારી કહેવાયા.

ઉપર્યુક્ત રબારીની અટકના મૂળ આપણે અટલા માટે તપાસ્યાં કે , રબારીઓ મૂળે રાજ્યૂત હતા . અને એમાંથી જ્ઞાતિ વિભાજનની પ્રક્રિયામાં આ ઘટના બની.

આ અટકને વિગતે તપાસી અને પ્રત્યેક અટક મૂળ રાજ્યૂતની જ અટકોમાં તેના મૂળ ધરાવે છે. બ્રાહ્મણ, વैશ્ય, ક્ષત્રિય અને શુદ્ધ આપણી વર્ણ વ્યવસ્થા હતી.તો રબારીઓ ક્ષત્રિયમાંથી આવ્યા છે . પરમારમાંથી ઉપ અટકો રબારીની પડેલ છે. તેની પણ યાદી આપી શકાય છે. આ રીતે રબારીઓની ઉત્પત્તિ મૂળે ક્ષત્રિય કૂળમાંથી થયેલ હોય હવે આપણે સૌરાષ્ટ્રમાં રબારીઓ કયારે આવ્યા અને તેની વિગતો પણ તપાસીએ.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કંચ્ચમાં વસતા રબારીઓનો ઈતિહાસ રાજ્યસ્થાન સુદી જાય છે. એટલે કે , ઈ. સ.ની ૬ ફી સદીની આસપાસ કદાચ રાજ્યસ્થાનમાંથી વિસ્થાપિત થયાં. તેનું મુખ્યકારણ રાજ્યસ્થાનના જેસલમેરના રાજાએ રબારીની દિકરી પર નજર બણાડતાં દિગ્ગાણું થયું. અને રબારીની દિકરી જાલોર જિલ્લાપાસે સતી થઈ. રબારીઓ જેસલમેરના રાજા સાથે થયેલા અણ બનાવના કારણો જેસલમેરનું પાણી હરામ કરીને ત્યાંથી ચાલી નીકળેલા. ચાલતાં ચાલતાં કંચ્ચમાં રહ્યા પછી સૌરાષ્ટ્રમાં ચોટીલા પંથક અને સાલમાળના કુંગરનીઆજુબાજુનાવિ સ્તારમાં વસવાટ કર્યો. તેના માટે એક દુહો બોલાય છે.

ઠાંગો માંગો ઢીક છે.

સરવો સાલેમાળ  
ચો-પગાં ચરે,  
આંબે નહી કાળ.

પરિબમણની આ પ્રક્રિયા પશુપાલનના વ્યવસાયને કારણે હતી. સૌરાષ્ટ્રમાં રબારીઓનું આગમન ઈ મ । સદીની આસપાસ અંદાજ શકાય. વિક્રમ સંવત એક હજારની આસપાસ જરિયાવાડામાં પૂરી સતી થયેલ. અને રા'નવદાણ ના લશકરમાં રબારીઓ સિંધમાં સૈનિકો તરીકે ગયેલા.આ બધા આધારો તપાસતાં અનેવહીવંચા બારોટના ચોપડે લખાયેલી સાલ તપાસતાં ઈ મી સદીની આસપાસ રબારીઓ સૌરાષ્ટ્રમાં આવ્યા અનેફેલાયા. એ હકી કત સ્વીકાર્ય બંને તમ છે. કેટલાક વિદ્ધાનો બારોટના ચોપડા કેટલા જૂના ? કાગળ કયારેઅસ્તિત્વમાં આવ્યું ? વગેરે અંગે પ્રશ્નો ઉલા કરે. પરંતુ બારોટના ચોપડાઓ શરૂઆતમાં ભૂર્જપત્ર ઉપર લખાયેલાહતા. અને સમયે સમયે ભાષાકીય સ્વરૂપો બદલતાં એના અનુવાદો અને નવસંસ્કરણો થતાં રહ્યાં છે. એટલેબારોટની પ્રથા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જે ઐતિહાસિકતા જળવાતી આવી છે. એમાં કયાંકઅતિશાયકિત હોય પરંતુ ઘટના ઓ અને બનાવોને આધારભૂત માનવામાં વાંદ્યો ન હોય શકે.

ઉપરોક્ત દર્શાવ્યા મુજબની ઘટનાઓ ધ્યાને લેતાં રબારીઓનો વસવાટ સાલેમાળના કુંગરમાં હતો. ત્યારે રબારીના ૫૦૦ જેટલાં કુંટુંબો હતાં. અને રબારીના મુખ્ય આગેવાનોમાં બોડો છેલાણો ભરમો કટારો , અહરો મારુ , ધારજગરચર , વકોચાવડો નેવરો મોરી , ભજનમલ ખટાણો મુખ્ય હતા. આ સમયે સોડો કરમટા ૫

જી ત્યાંજ હતો. ત્યાંથી અગિયાર ભાગમાં આ લોકો વિસ્થાપિત થયાના ઉલ્લેખો સાંપડે છે. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રમાંથી વિસ્થાપિત થયા છે. ઉપરાંત કેટલાક કચ્છમાંથી પણ ગુજરાતમાં આવ્યા તો કેટલાક મારવાડથી પણ ગજરાતમાં આવેલા હતા. દા. ત. દ્વારકા બાજુ વસતા ભોપા રબારી પાછળથી વિસ્થાપિત થયા. જામ વિભાજકર છમાંથી આવીને જામનગર વસતે છે તેની સાથે માલધારીઓને લઈ આવે છે. એટલેસોરઠીયા અને ગુજરાતી, પંચોળી કે વિણાયો રબારીઓ કરતાં તેઓ છ સો સાતસો વર્ષ પછી આવ્યા છે. તેની મૂળ કૂળદેવી વાંકોલ માતાજી મનાય છે. અને સોરઠીયા રબારીના સંપર્કમાં આવ્યા પછી એમણે પણ માતાજીના મફન અને સરજૂ વગેરે સ્વીકારી એ ઘર્ભ અપનાવ્યો. અને સોરઠીયા રબારીનું અનુકરણ કરી પાંચ મફન અને છઢી ડેરીની સ્થાપના કરી. ભોપા રબારીના માતાજીના મફન લાંબા, દ્વારકા, ગુરુગટ, દાનાણા, વિરમદદ, ડેરી – ડબાસણ આવેલા છે. અને માતાજીના છેલણ, કળશ, મંડર અને પુંજ જેવા વિદ્યી વિદ્યાનો અને ઉત્સવો થાય છે. આ સિવાય ભોપા રબારીઓ રામદેવપીર, કૃષ્ણ વગેરેમાં પણ શ્રદ્ધા ધરાવે છે. અને મૂળમાં શીવ ઉપાસના પણ છે.

આપણે આગળ જોયું કે, ભોપા રબારી કચ્છમાંથી જામ વિભાજના સમયમાં સૌરાષ્ટ્રમાં ઉતારી આપ્યા છે. "ભોપા" શબ્દનો મૂળ અર્થ ભૂવાના સંદર્ભે બતાવવામાં આવે છે. ચોરણી કેડીયું અને માથે લાલરંગનો ફેટો બાંધે છે. એમની મૂખ્ય અટકો આ પ્રમાણે છે. નાંગેસ, મોરડાવ, પંડત, કરમટા, ભાડકા, પરમાર, ઉલવા, ખટાણા, લુણા, ખાંભલા, ગરચર, આલ, અજાણા, ભાંગરા, ભીમ લુણા ઈત્યાદિ અટકો ગુજરાતના અને સૌરાષ્ટ્રના રબારીમાં સમાવિષ્ટ થઈ જાય છે. એટલે ક, આ સમૂહ અન્ય રબારીઓ કરતાં કચ્છમાંથી પાછળથી વિસ્થાપિત થયો હોય એટલે વેશભૂષા અને અલંકારોથી થોડો અલગ પડે છે. પરંતુ રબારીથી કોઈ પણ પ્રકારે અલગ નથી. I. જૂના રીતરિવાજો પ્રમાણે વસ્ત્રો અને અલંકારો ધારણ કરે છે. ઉપરાંત સામસામા લજન, હિયરવહું અને લજન પછી પણ ત્રણ આણા સાતમનું આણું, હોળીનું આણું મહા મહિનાનું આણું ના રિવાજો છે.

ભોપા રબારીઓ વિશે એટલી સ્પષ્ટતા એટલા માટે કરવી ઉચિત માની છે કે, સોરઠીયા ગુજરાતી વીજો યા અને ઝાલાવાડી રબારીઓ કરતાં મૂળ અલગ પ્રજા કોઈ ગણી ન બેસે.

સૌરાષ્ટ્રના રબારીઓનો મૂખ્ય વ્યવસાય પશુપાલનનો હતો. એ સમયમાં પશુપાલનનો વ્યવસાય ખૂબ જ સમૃદ્ધ ગણાતો કારણકે એ સમયે રબારી લોકો સમાજ નો એક સમૃદ્ધ વર્જ હતો. સાલા – સૂરાની ભક્તિ સાથે દાનની સરવાળી મેંદરા છેલાણાએ લાખા હુલાણીના લશ્કરને જમાડયું ધોડાઓને નીરણ પૂરી કરી. ભોડા છેલાણાએ સાતસો ચારણના છોકરાંઓને દુષ્કાળપાર કરાવ્યો અને શિંગડીયા ચારણની સ્થાપના કરી. આવા અનેક ઉદાહરણો મળે છે. પશુદ્ધન આ લોકોની મોટી સંપત્તિ હતી. અને દુષ્કાળના વર્ષોમાં સ્થળાંતર કરી પોતાના પશુઓને બચાવી લેતાં અને સમૃદ્ધ જળવાય રહેતી એટલે તો કચ્છમાંથી સાલમાળ ત્યાંથી સિંદ્ધ ત્યાંથી બરડામાં, ગીરમાં આલેચમાં થઈ સતત પરિભ્રમણ કરતાં રહ્યાં.

મૂળમાં ક્ષત્રિયત્વના લક્ષણો હોવાથી આ જ્ઞાતિ નીડર અને બહાદુર પણ છે. જ મધ્યયુગમાંથી પણ એના અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. રાંનવધણના લશ્કર માં જોડાયેલા અને સુમરા રાજા સાથ લડતાંકોડિયાત ર અટકના રબારીઓ લુણ અને કરણના વંશજોને નવધણે ગરાસ આપેલો કરણના વંશજો ને જૂનાગઢની આજબાજુન ા. આઠ ગામ અને લુણના વંશરાજોને બાલાગામ કોડવાવ અને ઓડદર ગરાસમાં આપેલાં. લુણના વંશજોએ ખૂટીમેરી ની દિકરી સાથે લજન કર્યા એના વંશજો ઓડેદરા મેર તરીકે ઓળખાય છે.

પોરબંદરના રાણાસાહેબના લશ્કરમાં પણ રબારીઓ અને મેરલોકો જોડાયેલા અને જામનગર સાથ ના યુધમાં વિજય આપેલો. એની ખુશીમાં રાણાસાહેબે આ બંને જ્ઞાતિઓને જેટલા ગામના તોરણ બાંધી શકે એટલા ગામ એના. સમય માત્ર એક રાત્રિનો આપેલ મેર જ્ઞાતિના લોકોએ ધણા ગામના તોરણ બાંધેલ પરંતુ રબારી જ્ઞાતિના લોકો એ સમયે પશુદ્ધનની વિપુલ સમૃદ્ધિ ધરાવતા હતા. એટલે માત્ર શુકન માટે બે જ ગામના તોરણ બાંધેલાએ ગામ કોલીખડા અને રાંધાઉ હતા. માંડા હુલાણી દાતારી કે વેલા ભારાઈની બહાદુરીપણ નોંધપાત્ર છે. તો વકાચાવડાનું વૈદ પરોણકારી ગણાય. વકાચાવડાએ વૈદુ કરીને બાદશાહની બેગમને ઠીક્કરેલ એટલ બાદશાહ ખુશ થઈવકાચાવડાને ઈનામ માગવા કહેલું ત્યારે વકાચાવડાએ સમગ્ર સમાજના હિતનેદ્યાનમાં રાખીને બાદશાહ પાસે એવું માણ્યું કે હાલમાં માનવ મૃત્યુ પામે છે. એના શબન ઉલ્લું રાખીનેસણગાવવાનો જ રીવાજ છે તે દૂર કરો. અને શબને આણું સુવડાવી અભિન સંસ્કાર આપવામાં આવે તેવીવ્યવસ્થા કરો અ મારું ઈનામ છે. તો સો

મનાથ ભાંગવા મહમદગજની આવેલો ત્યારે બંધી બનાવીને એક રબારીને વેરાવળથી દિલ્હી લઈ ગયેલો એ ર બારીને મુસિલમ બનાવ્યો અને મલેકખુશરુ નામ આપ્યું એ બાદશાહનો અંગત વિશ્વાસુ માણસ બન્યો. અને આખરે બાદશાહે તેને સુલતાન બનાવ્યો. અને એક દિવસ બાદશાહનો વદ્ય કરીને દિલ્હીનો સુલતાન બનેલો. એટલે આરી તે રબારીવિલક્ષણ બુધ્ય અને બહાદુરીથી દિલ્હીની ગાડી ઉપર પણ બેસલો. આ ઘટના શંખુ પ્રસાદ દેસાઈના સૌરાષ્ટ્રનાઈટિહાસમાં વિગતે નોંધાયેલી હોય વધ્યારે ચર્ચા કરતાં નથી.

આ રીતે સૌરાષ્ટ્રની રબારી શાતિ ખંમીરવંત, સમૃદ્ધ, ઉદાર અને પરોપજીવીના લક્ષણ ધરાવતીએક નોંધપાત્ર શાતિ ગણી શકાય. કોઈ અણસમજુ લેખક એના મૂળ તપાસ્યા વગર બર્બર કે ભૂત જેવી સંજ્ઞાઓએનાયત કરે તે વાત ક્ષમ્ય નથી. આજાદી પછીના સમયગાળા દરમ્યાન આ શાતિનું પતન થયું એવી ધારણાએટલા માટે બાંધી શકાય કે, જેતીનો પ્રચાર વધતાં ચરિયાણો નાખુંથી વાલાંથી જેને કારણે પશુદ્યન ઘટવાંલાંથી અને બદલાતા સમય સંદલ શિક્ષણ પણ પ્રાપ્ત ન કરી શકાય. અને નવો વ્યવસાય અપનાવી ન શકાય. જેના કારણે એક સમયે સમૃદ્ધ અને ખમીવંતી ગણાતી કોમ દીમે દીમે ગરીબ અને પછાત ગણાવા લાગી. અનેસરવાળે ધાણ વિસ્તારમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં પણ આ લોકો આવી ગયા. આજે ગીર, બરડા અનેઆવેચના વિસ્તારમાંથી વિસ્થાપિત થયેલા રબારીઓને અનુસુચિત જનજાતિના લાભો સરકારે આપ્યા છતાંપણ આ દરજાનો લાભ આપવામાં અધિકારીઓની નીતિઓનો સામનો કરી રહ્યા છે. શિક્ષણ દીમે દીમેવથ્યું છે. અને પશુપાલનતો નહિંવત્ત રહ્યું છે. બાકીના લોકો શહેરી વિસ્તારમાં વાહનો ચલાવવાનો વ્યવસાયકરે છે.

સૌરાષ્ટ્રની રબારી શાતિનો અત્રે ટૂંકમાં પરિચય મેળવ્યો વાસ્તવમાં આ પરિચયનું ફલક વિસ્તરી પણ શકે પરંતુ આપણો વિષય અહીં સૌરાષ્ટ્રના રબારી સંતો ભક્તો અને શાતિઓના સંદર્ભે આગળ વાત કરીએ.

## સંદર્ભે

1. સૌરાષ્ટ્રના રબારી શાતિમાં લગ્ન ગીતો ખીમાભાઈ કરમટા
2. વહીવંશા બારોટ બઢુક લોઅેજ રૂ.૫૫
2. કાનજી બારોટ જુનાગઢ રૂ.૭૦
3. કાનજીબારોટ ઉલેટા રૂ.૫
4. ભૂવાશ્રી ભોજાઆતા રૂ.૫૦
5. દાસાભાઈ ચાવડા કેશોદ રૂ.૫૦
- પુંજા લીબડીના હસ્તપ્રતો માંગરોળ
- ઈસા લીબડીયા બળેજ પોરબંદર
- રૂભરૂ મુલાકાત

## રબારીની શક્તિ ઉપાસના અને ભક્તો

સૌરાષ્ટ્રના રબારીઓમાં ખાસ કરીને શક્તિ ઉપાસના સોરઠીયા રબારીઓ કરે છે. કેટ લાક સંશોધકો ભોપારબારીની સરજૂ એવું પણ કહે છે. પરંતુ ભોપા રબારી તો પાછળથી આ ઉપાસના સ્વીકારે છે. સોરઠીયા રબારીનો મુખ્યધર્મ જ માતાજીનો છે. આ માતાજી ને કેટલાક લોકો મોમાઈ માતાજી એવું નામ અપે છે. પરતુ સાંદરી ઉપર સવાર મોમાઈ માતાજી તો ગુજરાતમાં ઘણી બદ્ધી જ્ઞાતિઓનાં કૂળદેવી તરીકે પૂજાય છે. એ મોમાઈ માતાજી આ રબારીઓની શક્તિ ઉપાસનાની માતાજી નથી. પરંતુ એની વાસ્તવિકતા શું છે? વગેરે બાબતો લખાણના વિસ્તાર ભયને અવગણીને પણ અહી પ્રસ્તુત કરવાનો ઉપક્રમ સેવવામા આવ્યો છે. તેનું કારણ એ છે કે, આ બાબતનું પૂર્વસંશોધકો દ્વારા પૂરું સ્પષ્ટીકરણ થયું નથી.

વિકમની ૧ ઉમ્મી સદીના બીજા વર્ષની આ વાત છે. વિ.સં.ની ૧૨મી સદીમાં માંગરોળ તાલુકાના શીલ અને સાંગાવાડા ગામની વચ્ચે જે જગ્યા ડેરી તરીકે ઓળખાય છે ત્યાં અંદાજે ૧૫૦ જેટલા રબારીના નેસ હતા. એમાં વાઢેર છેલાણા મુખ્ય હતા. એ સમયે આ નેસ વસવાટનો મુખી છાંધો વાઢેર હતો. તે સમયે રબારીઓ ચાંવડમાતાજીએ ને શીવ-શક્તિની ઉપાસના કરતા. તે વખતે એક દિવસે શીવ અને શક્તિ સાંદુના વેશમાં પરિબ્રમણકરતાં ત્યાંઆવ છે. ચડયાં. આ સાધને જોઈ રબારીનાં બાળકોને બીક લાગી અને ભાગવા લાગ્યાં. એમાં દોડતાં-દોડતાં શામળા રબારીનો એક છોકરો પડી ગયો અને માથું પથર સાથે ટકરાતાં મૃત્યુ પામ્યો. આ દશ્ય જોઈને શીવને શક્તિએ કહ્યું. પ્રભુ આ બાળક આપણા સાંદુવેશને જોઈ બીકથી ભાગ્યો અને મૃત્યુ પામ્યો. આપણાદર્શનથી આ ઘટના બની એ ટલેએ બાળકને સજીવન કરો. ત્યારે શીવજીએ કહ્યું. આ બાળક સાત જન્મોથી આ રીતેનાની ઉમરમાં મૃત્યુ પામે છે. એ ને સજીવન કરી શકાશે નહીં. પરંતુ હવે પછી આ બાળક બાજુના ગામ જરિયાવાડામાં જન્મ લેશે. એ જન્મમાં અનો ઉદ્ધાર થશે.

ઉપરોક્ત ઘટના બન્યા પછી જરિયાવાડા ગામના વંશસુધાર પરખોતમને ગંગામાતાજીને ત્યાં બહુ મોટી ઉમરે સંતાન પ્રાપ્તિ થઈ. એનું નામ જાલાણ રાખવામાં આવ્યું. જાલાણ નાનો હતો એ સમયે કોઈ સંતો અ પુરખ તાતેને કહેલું કે, તારા પુત્ર ઉપર મૃત્યુની ઘાત છે. પુરખોતમે ઉપાય પછ્યો! ત્યારે યોગી એ કહ્યુંકે, આ છોકરા ને અડસઠ તીર્થની યાત્રા કરાવવામાં આવેતો કદાચ તેનો ઘાતમાંથી બચાવ થાય. બાળક જાલાણને જોળીમાં લઈ પૂરુષોતમ અડસઠ તીર્થની યાત્રાએ નીકળી પડે છે. પુરુષોતમ પગે ચાલીને પુત્રના સાપના નિવારણ અર્થે પરિબ્રમણ કરી અડસઠ તીર્થની યાત્રા કરાવે છે. યાત્રાપૂર્ણ કર્યો પછી પણ સંત પદ્ધાર્યાં અને કહ્યા કે, હજુ એક તીર્થ બહાર રહી ગયું છે. ત્યાં જાલાણ મોટો થતાં એ તીર્થમાં જશે અને તેના સાપનું નિવારણ થશે.

જાલાણની ઉમર અગિયાર વર્ષની થઈ ત્યારે તેણે માનસરોવર માતાજીની યાત્રા કરવાનો સંકલ્પ કર્યો. એને કોઈનું માનવું એવું છે કે, માતાજીએ સ્વખનમાં આવીને જાલાણને માનસરોવરની વાટ બતાવી. પરંતુ સરજૂમાં આવતા ઉલ્લેખ મુજબ ગુરુ ગોરખનાથે જાલિયાને માનસરોવરનો રસ્તો બતાવ્યો. એ વાત થોડી વધારે બ્યાજબી લાગે છે કારણકે, એ સમયે ગોરખમણી અને માધ્યપુર ગોરખનાથના ધૂણાઓ હતા. અને એ વસ્તીમાં પરિબ્રમણ કરતા. જાલિયો માનસરોવરનો રસ્તો મળતાં માત્ર ૧૧ વર્ષની નાની ઉમરે માતાજીની યાત્રાએ ઉપડી જાય છે.

ઘણાં સંદર્ભો અને મનોમંથનો કરતો જાલાણ આખરે માનસરોવરો પહોંચે છે. ત્યાં એ થાકી અને માતાજીના મંદિરના દ્વાર પાસે ઉધો જાય છે. અ સમયે અર્થર્વરાવ, સાલેરાવ અને ભોલેરાવ માતાજીના પુજક હતા. એમાંથી સાલરાવને આ બાબરતની જાણ થઈ એટલે એમણે ભોલેરાવ અને અર્થરવારાવને કહ્યુંકે, આપણા મંદિરના દ્વારે કોઈ મૃત્યુ લોકોનો માનવી આવેલ છે. સૌની સંહમતિથી જાલાણને જગાડીને અંદર લઈ આવે છે. જાલાણને આવવાનું કારણ પૂછે છે. ત્યારે જાલાણ જણાવે છે કે, હું અહી માતાજીના દર્શન અને પૂજન કરવા આવ્યો છું. જાલાણને આ વાતન ૧૨જા મળે છે. અને સાલેરાવને ગુરુ બનાવી જાલાણ માતાજીની સરજૂઓ શીખવા માಡે છે. આ રીતે જાલાણને સાલેરાવ, માતાજીની સરજૂનું સૌ પ્રથમ જ્ઞાન આપે છે. માતાજીને કમળની પાતરી ચડતીરોજ કમળ લાવીને જાલણમાતાજીની પૂજા કરતો. એક સમયે સાલેરાવે જાલાણને સૂચના આપી કે, અહીથીથોડે દૂર તળાવમાં લાલ રંગનું ૨૪ પાંખડીનું કમળ છે. તે ફૂલને અટકવું નહીં. કારણકે, તે ફૂલની ચોકી વાસુકીનાગ કરે છે.

જાલણ ભોલેરાવ દ્વારા પ્રાપ્ત કરેલી સરજૂના આધારે માતાજીની ભક્તિ અને સેવા પૂજા કરે છે. અને માતાજી પરત્વ ભક્તિનો અનહદભાવ એના મનમાં ઉત્પન્ન થયો છે. પરંતુ પોતના ગુરુ સાલેરાવ દ્વારાઆપવામાં આવેલી સૂચના એમનામાં કૈતુક જગાડે છે. અને જાલણ સંકલ્પ કરે છે. કે , ૨૪ પાંખડીનું લાલ કમળ માતાજીને ચ ડાવવુછે. જાલણએ પુષ્પને શોદ્ધી કાઢે છે અને ફૂલ તોડવાનો પ્રયાસ કરે છે. અટલે વાસુકીનાગ પ્રગટ થાય છે અને જાલણને સમજાવે છે કે હે ! બાળક એ ફૂલને અડતો નહીં , નહીં તો તારા પ્રાણ હરી લઈશ. પરંતુ જાલણ વાસુકી | નાગની વાત કાને ધર્યા વગર ફૂલ તોડવા આગળ વધ છે. આખરે વાસુકી નાગ જાલણને દંશ દે છે અને જાલણ મૃત્યુ પામે છે. આ ઘટનાથી અર્થવરાવ , ભોલેરાવ અને સાલેરાવ , દુઃખ અને મુંજવણ અનુભવે છે. આખરે માત ઇજ પ્રસન્ન થઈને જાલણને જીવતો કરે છે. જાલણ જીવતો થઈ માતાજીના સાક્ષાત્ દર્શન કરે છે. વંદન કર છે. અને માતાજીની ભક્તિ માંગે છે. આ દશ્ય જોઈ ભોલેરાવ , સાલેરાવ અર્થરાવ માતાજીને ફરિયાદ કરતાં કહે છે . કે , હે માતાજી અમે તમારી યુગોથી સેવા પૂજા કરીએ છીએ તો પણ અમને દર્શન આપ્યા નહીં. અને આ મૃત્યુ લોકનો માનવી હમણાં આવ્યો તો પણ તમે તેની સામે સાક્ષાત્ સ્વરૂપે પ્રગટ થયાં ? ત્યારે માતાજીએ કહ્યું કે , તમે આટલા યુગો સેવા કરી પરંતુ ૨૪ પાંખડીનું લાલ કમળ લેવાની હિંમત કરી ન હતી. આ બાળક ભલે હમણાં આદ્યો હોય પરંતુ એમણે પોતાના જીવનનીપરવા કર્યા વગર આ ભક્તિમય સાહસ કર્યું એથી હું અને પ્રસન્ન થઈ છું.

જાલણ લગભગ અંદાજે ૧૨ વર્ષ સુધી માનસરોવરમાં રહીન માતાજીની સેવા પૂજા અને તપ આ રાધના કરે છે. આખર જાલિયાને પોતાનો દેશ સાંભળે છે. અને માતાજીને કહે છે. આટલા વર્ષોમે અહીં વિતાવ્ય | હવે મને મારો દેશ સાંભળ્યો છે. હું મારા દેશ જવા માગું છું ત્યારે માતાજી જાલણને રજા આપે છે. પરંતુ જાલ ણ માતાજીને વિનંતિ કરતાં કહે છે કે , તમે મારી સાથે આવો ત્યાં જઈને હું કોની સેવા કરું ! માતાજીએકહ્યું તું મને રહેવા દે મારા નિયમોનું તું પાલન કરી શકીશ નહીં. છતાં જાલણ માતાજીને મનાવવા જઈયાંનું રાખી આખરે માતાજીએ સંમતિ આપી સેવા પૂજા માટે કેટલાંક પ્રતીકો જાલણને સાથે લેવાનું કહ્યું હંસ , મોર અને શંખ એક કરં દિયામાં લઈ જાલણ જરિયાવાડાની વાટ પકડે છે. કહેવાય છે કે , શંખોદ્વાર બેટ થઈ પોરબંદર થઈ રેરી ( સંગાવાડા ) પહોંચે છે. આ સમય સરજૂમાં બતાવ્યા મુજબ તેમજ જાલણના વહીવંચા બારોટના ચોપડે નોંધ આયા મુજબ વિં.સં. ૧૨૦૨ના શ્રાવણ વદી તેરસ અને શુક્રવારનો મનાય છે.

જાલણ જરિયાવાડા જવા માટે સંગાવાડાના દરિયા ડિનારે ઉત્થો. એ જે હોડીમાં ઉત્થો એ હોડ | પથ્થર બની ગઈ એવી લોકમાન્યતા છે. આજે પણ શ્રાવણવદ અમાસના દિવસે એ સ્થળે માતાજીની ધજા ધ મારવા ડેરીથી જાય છે. જાલણ દરીયાઈ મુસાફરી કરીને આવેલો તેથી થાક અને તરસ ખૂબ લાગેલા એટલે કે એ તે રી પાસે આવેલી વાવમાં પાણી પીવા અને સ્નાન કરવા માટે જાય છે ત્યાં એક ગોરડનું ઝાડ હત. એઝાડ ઉપર માતા જી એ આપેલા પ્રતીકોનો કરંડિયો લટકાવીને જાલણ પગથિયા વાળી વાવમાં ઉત્થો એવાવ આજે પણ મોજુદ છે. એ સમય ત્યાં રબારીનો નેસ હતો અને આ નેસમાં ૧૫૦ જેટલા કુંઠુંબોનો વસવાત હતો. આ બધાનો મુખી છ ાંધો વાઢેર હતો. એ સમયે જાલણ વાવમાં ઉત્થો ત્યારે શામળા , ચાવડા , છેલાણા અને ઉલ્વા શાખના રબારીઓ ના છોકરાઓ ત્યાં રમતા હતા. જાલને એમણે કરંડિયો લટકાવતાં અને વાવમાં ઉત્રતાં જોયો એટલે આ છોકરાઓ ને કૌતુક થયું કે , આ બાવાના કરંડિયો જોવાનો એમણે પ્રયત્ન કર્યો પરંતુ જે ડાળીએ કરંડિયો લટકાવેલો હતો. એ ડાળીએ આ છોકરાઓ પહોંચી શકતા ન હતા. ત્યાં એક ગરચર શાખનોરબારી આવ્યો અને છોકરાને ખંબે બેસાડી કરંડિયો ઉતારવાનોપ્રયત્ન કર્યો. કરંડિયો નીચે ઉતારતાં મોર ઉડીગયા. હંસને કૂતરાંએ મારી નાખ્યા અને શંખ ને છોકરાંએ ભાંગી નાખ્યાં. જાલણ વાવમાંથી બહાર આવીને આ દશ્ય જૂએ છે. અને બહુ આધાત અનુભવે છે. મન મન ખૂબ પસ્તાવો થયો. પોતે કરેલી માતાજીની આરાધના નિષ્ફળ ગઈ એવું લાગતાંએ ત્યાં ઉપવાસ ઉપર બેસ | જાય છે. રબારી આગેવાનો જાલણને સમજાવવા પ્રયત્ન કરે છે. જાલણ કોઈ વાત માનવા તૈયારી નથી. બ ધા રબારીઓ એકઠા થઈ જાલણનેમનાવવા પ્રયત્ન કર્યા પરંતુ બધાજ પ્રયત્નો નિષ્ફળ નીવડયા. આખરે છાંય | રબારીના નેતૃત્વ નીચે બધાજ રબારીઓ ભેગા થયા. અને ઉપવાસ કરતાં જાલણની સાથે બારારો ( બારારો એટલે બધાએ અન્નજનનો ત્યાગ કરવો. નાનાં બાળકને ઘવડાવવાં નહીં. એવી રીતે પશુઓને ધાસચારો આપવો ન હી ચરવા દેવાં નથી. વાછરડાં પણ ઘવડાવવાં નહીં ટૂકમાં બાળકથી માંડી વૃદ્ધ સુધાના હયાત જીવોએ અન્ન જીળનો ત્યાગ કરવો. ) નાખી ભગવાન શીવ અને માતા ચામુંડાની આરાધના કરવા લાગ્યા. એ સમયે રબા

રીઓની કુળદેવી ચાંવડ ( માતા ચામુંડા ) હતી. સાડા ત્રણ દિવસ સુધી આ બારારો ચાલેલો , આખરે ચાંવડ માતાજી પ્રગટ થયાં અને મરેલા મોરને સજીવન કર્યા. શંખને પણ એકનિત કરી જાલાણને આપ્યાં.

ઉપરોક્ત ઘટના બન્યા પછી જાલાણે કહ્યું કે , માતાજીએ માનસરોવરથી અહી આવતી વખતે મારી સાથે શરત કરેલી કે , જે જગ્યાએ પૃથ્વી ઉપર મને મૂકવામાં આવશે તે જ જગ્યાએ મારી સ્થાપના થશે. ત્યાંનાગળ નહી વધ એટલે હવે માતાજીની સ્થાપના અહી જ થશે. આખરે ગોરક્ષનાથની હાજરીમાં ડેરી (સાંગાવાડા) માતાજીની સ્થાપના કરવામાં આવી. ત્યાં જાલાણે માતાજીની ૨૧ પુંજ કરી રબારીઓને આ ધર્મથી દિક્ષિત કરી. અને આખરે રબ રીઓને આ ધર્મ સોપી તેમણે વિદાય લીધી. પછી જાલાણના જીવનના ઉલ્લેખો પ્રાપ્ત થતા નથી.

જાલાણ માતાજીના ધર્મની ગતિવિધા અને યમ નિયમ સમજાવી વિદાય થયા પછી ૧૨૫ વર્ષ સુધી છાંયા રબારીઓએ માતાજીની પૂજા કરી. ત્યાર પછી ભોગા શામળા નામના રબારીને માતાજી પ્રસન્ન થયાં. ચાર શંખમાંથી એક શંખ લઈને ભોગો શામળો જુજારપુર ગામ ગયા. તે સમ વિં. સે ૧ ત ત ત નો હતો. ત્યાર પછી વિં. સ. ૧૫૭૫માં માતાજીના ભૂવા દેવદાન શામળા જુજારપુરથી ચોરવાડ આવી માતાજીના મફની સ્થાપના કરી અને પુંજ કરેલો. ત્યાર પછી ચાવડા શાખના રબારી સાંગાવાડા ડેરીથી એક શંખ લઈને સિડોકર ગયા. અને ત્યાં માતાજીની સ્થાપના કરી મફબાંથ્યો. છેલાણા શાખના રબારી એક શંખ લઈને છેલાણું ગામ ગયા ત્યાંથી પરત આવી વિં. સ. ૧૫૦૮માં લોઅેજ માતાજીના મફની સ્થાપના કરી. સાંગાવાડા ડેરીથી ઉલવા શાખજા રબારી શંખ લઈને બામણવાડા આવ્યા. ત્યાં એક રાત રોકાયા પછી ચિત્રાકોડા ગયા અને બાજુમાં દૂદ્ધિનેસ આવલ હતો. ત્યાં માતાજીની સ્થાપના કરી. અને મકાલુવાએ પુંજ કરી. ત્યારબાદ બળેજ મફબંધાયો. આ રીતે જાલાણ જે ચારશંખ લઈ આવેલો તેના ચાર જગ્યાએ સ્થાપન થયા અને ચાર મફબંધાય. પાંચમો મફબોડરદરનો બંધાયો તેની ઐતિહાસિક વાત એવી છે કે , બળેજ પુંજમાં પેઢો (તાકાત પ્રદર્શન) લેવામાં સામસામે વાંધા ઉભા થયા. અને માતાજી પ્રસન્ન થયા. અને આખરે ઓડદરના મફની સ્થાપના થઈ આ રીતેપાંચ મફબોડરદરનો બંધાયો તેની ઓડદરની સ્થાપના થઈએ ડેરીએ મૂળ જાલાણની સ્થાપનાહતી. એટલે રબારીઓમાં પાંચમફબ અને છઠી ડેરીન માતા કહેવાંતાં આ બધાં સ્થાનકો પોરબંદરથી વેરાવળ સુધીના દરિયા કિનારાના વિસ્તારમાં આવેલાં છે. ત્યારબાદ અનેક સ્થળોએ માતાજીની સ્થાપનાઓ થયેલી છે. ડારી , વિસાવાડા , શાશા વાકીયાના હુંગરમાં , ઉના દેલવાડાં ગણ્ણોડ , કૃતિયાણ માંગરોળ , સત્તાપર ઓરડી ઈત્યાદિ ઉપરાંત દ્વારકા પંથકના ભોપારબારીઓએ પણ પાંચ મફબ અને છઠી ડેરીને માતાજીની સ્થાપના કરેલી છે.

માતાજીના ધર્મની વિધિ સંદર્ભે કેટલીક સ્પષ્ટતાઓ કરીએ તો માતાજીની આરાધના સરજૂ દ્વારા થાય છે. અને સરજૂની આ પરંપરા ગુપ્ત છે. આપણા ગુજરાતી સાહિત્યના વિદ્ધાનો પભાશંકર તેરૈયા , ખોડિદા સ પરમાર , નરોતમ પલાણ , ડો. હુસ યાણ્ણિક વગેરેએ આ સરજૂગાનને શામવેદનું ગાન કહ્યું છે. પરંતુ એની મૂળ સુધી કોઈ જઈ શક્યા નથી, એ એની ગુપ્તતાને કારણે. સરજૂ કોઈને ન કહેવાય એવી ધાર્મિક માન્યતા અને સામાજિક બંધન પણ છે. આપણા સંશોધકો પણ આ વિશે માત્ર કથનાત્મક વાતો કરીએ અટકી ગયા છે. આ સરજૂ મધ્યયુગીન આખ્યાન સ્વરૂપના માળખાને લગતું નાનું કાબ્ય છે. એમાં મુખ બંધ , ઢાળ , વલાણ વગેરે છે. મફબયુગના જાલાણ પછી રબારી ભક્તોએ માતાજીની ઉપાસના અર્થે આ સરજૂની રચના કરેલી છે.

સરજૂના સ્વરૂપ અને પ્રકાર વિશ ઉડાણપૂર્વક વાત શક્ય નથી. પરંતુ સ્વરૂપની દાઢિએ જોઈએ તો એ મધ્યયુગીન કાબ્ય છે. ઢાળ , વલાણ , પેટાણ વગેરે ધટકતત્ત્વો એમાં એવા મળે છે. પાંચદસ પંક્તિતથી માંડી ૪૦ – ૫૦ પંક્તિઓની સરજૂ મળે છે. એમાં વિષયની દાઢિએ જોઈએ તો માતાજીની ઉપાસનાની સરજૂ , આગમવાણી સરજૂ , છેલાણ કળશ વગેરે પ્રસંગે ગવાતી સરજૂ , આરતીની સરજૂ , ઓતારની સરજૂ , જન્માષ્ટમી પ્રસંગે ગવાતી કૃષ્ણ વિષયક સરજૂ લાનપ્રસંગે ગવાતી 'વિવાડો'ની સરજૂ , સાપનું ઝેર ઉતારવાની સરજૂ , ભક્તો સંતોના જીવનચરિત્રને બ્યક્ત કરતી સરજૂ , રામાયણ મહાભારતના પાત્રો પ્રસંગો આધારિત સરજૂ , આન્બજ્ઞાનની સરજૂ , યંગાભ્યાસને બ્યક્ત કરતી સરજૂ , જાલારટાણાની સરજૂ , પ્રભાતની સરજૂ , વેદના મંત્રો બ્યક્ત કરતી સરજૂ , સંદ્રિણી ઉત્પત્તિ પહેલાની ધંધકારની સરજૂ , સુષ્ટિની ઉત્પત્તિની સરજૂ આ રીતે કુલ ઉડોપ્રકારની સરજૂ બોલાય છે. સરજૂ નો પ્રારંભ 'વાણ' નાખવાથી થાય છે. સરજૂની અભિવ્યક્તિનું માધ્યમ નાદ છે. અને તે સમૂહમાં ગવાતું ગાન છે. 'વાણ' નાખવાથી સરદનો પ્રારંભ થાય છે. બસેલા સમૂહમાંથી કોઈ એક બ્યક્તિને 'વાણ' નાખવાનું કહેવામાં

આવે અને એ સરદ ઉપાડે હો.....ઓ.....હા.....હા.....મ—ઓ. (રામ) અને પછી સાથે રહેલું વૃંદ આ સરજુ ગાવા લાગે છે. જેવી રીતે ભજનમાં બેકળી, ચારકળી, એવો અવાજઅભિવ્યક્ત કરવામાં આવે છે. તેવી રતે સરજૂમાં પણ ઉચી 'વાણ' નખાય તો પાછળ એટલું ઉચું ન બોલીશકનારાને ગાવામાં મુશ્કેલી પણ થાય છે. સરજૂ ગાતી વખતે શરણાઈ અને ઝાંઝવગાડવામાં આવે છે. આ સરજૂ તેના યોગ્ય સમયે રજૂ થાય છે. જેવી રીતે ભજન ગણપતિ સ્થાપનાથી છેલ્લે પ્રભાતી સુધી ગવાય છે. એમ સરજૂ પણ સમયે પ્રસંગે પ્રસંગે અલગ અલગ બોલાય છે.

આ સરજૂનું જ્ઞાન મેળવવા એના અધિકારી થવું પડે છે. રબારી જ્ઞાતિમાં પુત્રનો જન્મ થાય ત્યારે જન્મ પછી પથમ પૂજુ થાય ત્યારે અ બાળકને માતાજીની દીક્ષા આપે છે. આ વિધીમાં બાળકને નવડાવીને વસ્ત્રવિહોન સ્થિતિમાં પદ્ધિયાર પાસે લઈ જવામાં આવે છે. અને પદ્ધિયાર એના કાનમાં સરજૂના મંત્ર દ્વારા ગુરુમંત્ર આપે છે. આ પ્રક્રિયાને રબારી સમાજમાં મોઢ ઉત્તરવાની અથવા મઠ લાવવાન પ્રક્રિયા કહેવાય છે. આ દિક્ષા મળવા પછી રબારી છેલાણ અને સરજૂ શીખવાનો અધિકારી બને છે.

માતાજીના ધાર્મિક ઉત્સવવિધી જોઈએતો છેલાણ સવાસો છેલાણ, કળશ, પૂજ મુખ્ય છે. તેનો આ છો પરિચય મેળવી એ તો છેલાણ એ પાંચ છેલાણ પાવામાં આવે છે. આ પાંચ છેલાણમાં એક શક્તિનો, એક ચાંદવડનો, શીવનો એવી રીતે પાંચ છેલાણ પાયા ગણાય છે. તેમાં રબારી ભાણો ભજતી અન્ય જ્ઞાતિઓ પણ છેલાણ પાય છે. જે માતાજીની કૃપા મેળવવા અથવા માનતા હોવાથી પાય છે. ઉત્તરાં સોરઠીયા રબારી સમાજમાં વર્ષ માતાજીનાપાંચ છેલાણ પરિવાર દીઠ પાવામાં આવે છે. ત્યારે જોક છેલાણ કહેવાય છે. આ જોકછેલાણ માટે જોક એક ત્રિત થઈ માતાજીના મઠ જાય અને ભૂવાઆતાને રજુઆત કરે અને માતાજીની રજા લઈ તારીખ વાર નક્કી કરી તે પ્રમાણે છેલાણ પાવામાં આવે છે.

સવાસો છેલાણ મોટાભાગે કોઈએ પોતાના કાર્ય સિદ્ધ માટે માતાજીની માનતા કરી હોય ત્યારે પોતાનું કાર્ય સિદ્ધ થઈ જતાં આ છેલાણ પાવા માટે જોકમાં જાહેરાત કરે જોકના આગેવાનો મળે અને નક્કી કરી માતાજીના મઠે જાય અને માતાજી રજા આપે ત્યારે આ છેલાણ પાવામાં આવે છે. જોક નોતરું આપવા જાય અને નોતરું જે તારીખનું જ્ઞાન ત્યાં સુધી દરરોજ માતાજીની સરજૂ બોલવામાં આવે છે. અને છેલાણને બોજન, સાકર અને ચાપણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ છેલાણ વ્યક્તિત અથવા પારિવારિક હોય છે. એમાં જોકનો સહકાર લેવામાં આવે છે. છેલાણના દિવસે માતાજીના ભૂવા આવે છે અને પાટ ચડે છે. અને માતાજીના આર્શિવાદ આપે છે.

કળશનો ઉત્સવ પણ માતાજીનો ધાર્મિક ઉત્સવ છે. કળશ પણ મોટે ભાગે માનતાનો હોય છે. કયા રેક ખુશીનો પણ હોય છે. આ કળશમાં અનો સેવાઓ છેલાણમાં મહત્વનો તફાવત હોયતો એ છે કે, સવાસો છેલાણમાં ભૂવાઆતા સવારે આવે અને ચોકો કરી પાટ ચડી વિધી પૂરો કરે છે. અને મોટા ભાગે આ છેલાણમાં સગા સંબંધો અને જોક ને જ નિમંત્રણ હોય છે. જ્યારે કળશમાં ભૂવાઆતા સાંજે આવ છે. અને માતાજીની સ્થાપના કરવામાં આવે છે. માતાજીનો પાટ ભરવામાં આવે છે. અને જ્યોતિ પ્રગટ કરવામાં આવે છે. રાતભર આંદં જ્યોત પ્રગટી રહે છે. અને છેલાણ સરજૂ બોલતા રહે છે. સવારે નવ દસ વાગ્યે કળશ ભરવામાં આવે છે. અને ત્યાર પછી કળશ ભરનારના ધરનીસ્તીઓ કળશ અને ઘજા વધાવે છે. પછીથી ભૂવાઆતા પાટચડી માતાજીના આર્શિવાદ અપ છે. આ કળશમાં પોતાના સગાસંબંધો અને આજુબાજુની જોકમાં વિધિવતામંત્રણ આપવામાં આવે છે. વિધી પૂરો થયા પછી અને પહેલાં જમણવાર હોય છે. આ વિધીમાં અંદાજે બેઅઢીલાખનો ખર્ચ થાય છે.

પુંજાએ માતાજીનો સૌથી મોટો ધાર્મિક મહોસ્ત્વ છે. પુંજનો ઉત્સવ નવરાત્રિમાં ઉજવાય છે. પરંતુ પુંજ દર નવરાત્રિએ માતાજીના દરેક મઠમાં થાય જ એવું નથી. આ માટે દરેક મઠમાં શીખ માગવામાં આવે છે. આ શીખ માગવા માટે દરેક મઠના દિવસો નક્કી હોય છે. દા.ત. ભાદરવા વદ તેરસના દિવસે તેરી શીખ મગાય છે. ચૌદુશના રોજ ચોરવાડ અને સિડોકર શીખ મગાય છે. તો અમાસના દિવસે લોએજ અને આસો સુદાએકમના દિવસે બળેજ અને ઓડદર શીખ માગવામાં આવે છે. આ શીખ માગવા માટે સોરઠીયા રબારીઓમાંગામે ગામથી પુરુષ વર્ગમાતાજીના મઠે એકત્રિત થાય છે. અને સરજૂ દ્વારા માતાજીની આરાધના કરે છે. ત્યારબાદ ભૂવાઆતા, પદ્ધિયાર અને ન્યાતના આગેવાનો સમય થતાં માતાજીની શીખ માગે છે. પુંજ માટે રજા મગાય છે. જો એક સાથે ૨૧ વખત નાદાણા માગ્યા મુજબની જુવારા માતાજી આપે તો પુંજ થઈ ગણાય. પુંજ થાય તો મોટા ભાગના શીખ માગવા

ગયેલા અને નહીં ગયેલા માતાજીની ધામમાં જવાની તૈયારી કરે છે. પુંજ થતાંમાતાજીની પાંચ ધજા નિકળે છે. દૂર્ઘયો, હાલારલો, નાધરી બરાડાઈ અને ગઢવેલી આ પાંચ ધજાઓ નિકળે છે. અક ધજામાં ૫૦૦થી હજાર યુવાનો, બાળકો વૃદ્ધ્યો જોડાય છે. ધજાનો મુખી પીછીધર કહેવાય છે. અને ધજામાંજોડાનાર પુરુષો સમરભિયા કહેવાય છે. પુંજ થથા પછી આ ધજાઓને માતાજીના ગીત અને સરજૂ દ્વારા ધજા ધમથી વળાવવામાં આવે છે. પછીથી આ ધજામાં અલગ અલગ વિસ્તારમાં પગપાળા ફરે છે અને દરેક ગામમાં જ્યાં રબારીની વસ્તી હોય ત્યાં આ ધજાનું સ્વાગત કરવામાં આવે છે. વધાવવામાં આવે છે. સમરભિયાને દૂધ દહી પાવામાં આવે છે. અને લોજન પણ કરાવાય છે. આ ધજા માં જનારવ્યક્તિ એ કેટલાક કડક નિયમોનું પાલન કરવાનું હોય છે. એક અઠવાડિયા સુધી પગપાળા જ ગામેગામ પરિભ્રમણકરવાનું, કોઈ પણ ગામમાં રાત રોકાવાની નહીં. ખાટલે બેસવું નહીં. હજામત કરાવવી નહીં. વગેરે નિયમો પાળવાના હોય છે. આઠમા દિવસે માતાજીનો હવન હોય છે. તે દિવસે જૂની ધજા પાણીમાં દૂદું બાડી દેવામાં આવે છે. અને નવ દિવસે દરમ્યાન એકત્રિત કરેલા મોર પીછમાંથી નવી ધજા બનાવવામાં આવે છે. અને બધા સમરભિયા નાહીંધોઈ અને પોતાના વસ્ત્રો શુલાલ વડે લાલ બનાવીને દોડતાં દોડતાં સાંજે પુંજમાં પહોંચી જાય છે. પુંજના દિવસે હજારોની સંખ્યામાં સરોઠિયા રબારી સમાજનો સમૂહ એકત્રિત થાય છે. અને સમગ્ર વાતાવરણ હરિ ઊંન ના નાદથી ગુંજુ ઉઠે છે. રાતભર સરજૂ અને ગીત દ્વારા માતાજીની આરાધના થતી રહે છે. અને સવાર પડતાં આ ધજાઓનું સમૈયું કરવામાં આવે છે. એમાં બરડા ધજાનું સામૈયું ભૂઆઆતા ઘોડા પર બેસ ને સામેજરીને કરે છે. સવારે ભૂવાઆતાપાટ ચડે છે. અને સમગ્ર શ્રાતિને માતાજીના આર્ત્થિવાદ પાડવે છે. ત્યારબાદ જમણવાર શરૂથાય અને જમીને લોકો પોતપોતાના ગામ જવા લાગે છે. આ જમણવાર ચોખાના ભાત, મગ, દી અને ગોળનું હોય છે. એક રાત્રિના પુંજ ઉત્સવમાં અંદાજે ૫૦૦ થી ૬૦૦ ડલ્બા ચોખું ધોવપરાય છે. પુંજના ખર્ચને પહોંચીવળવા માટેપરગણા (પથારી) પ્રમાણે ધ્રેડો નિમવામાં આવે છે.

## માહિતીદાતા

૧. વંશ સુથારના બારોટ હિતેશભાઈ, ચંદુભાઈ સોલંકી ધોરાજ  
ઉ.વ. ઉદ્ય યજમાન વૃત્તિ.
૨. ભૂવાઆતા ડેરીમદ્દ(મેરામણભાઈ ઉ.વ. ૫૦)
૩. ભૂવા ભોજા આતા(ચોરવાડમદ્દ) ઉ.વ. ૫૧
૪. રામભાઈ રાડા જુનાગઢ ઉ.૫૦
૫. રામભાઈ રાડા બાંટવા ઉ.૩૫
૬. ગણપત મોરી બાંટવા ઉ.૪૦

## વિરો શામળો

સોરઠીયા રબારી સમાજમાં માતાજીના ઉપાસક વીરા ભગત ત્રણ થયા. વીરોશામળો, વીરો ગોસીયો (કોડિયાતર) અને વીરો ગાંડો. ચોથો વીરોભગત ભોપા રબારીમાં દ્વારકામા થયો. એમાંથી વીરો શામળો અંદાજે ૨૫૦ વર્ષ પહેલા ગણોદમાં થયો હોવાનું મનાય છે.

વીરો શામળો માતાજીનો ઉપાસક હતો. અને સરજુ દ્વારા માતાજીની સતત આરાધના કરતો. સમ ગ્ર સોરઠીયા રબારી સમાજ માં વીરા ભગતની માતાજી ની પરમઉપાસક તરીકેની છાપ હતી. આજેપણ છે. માતાજી ની અસંખ્યસરજુ એમણે કંદસ્થ હતી. એટલું જ નહીં પરંતુ સિદ્ધાપણ હતી.

વીરા ભગત નાં જીવનપરચા અંગે માત્રાએક ઘટના ભક્તજનો પાસેથી પ્રાપ્ત થાય છે કે, સરજુગાવા માટે વીરા ભગત એક વખત ચિત્રાકેડા ગયેલા, અને મુંધીનું અવસાન થયું. (મુંધી કોણ હતી એ સંદર્ભ ભક્તજન માં સ્પસ્ટતા નથી.) મુંધી વીરાભગતની દીકરી હતી. એવું સામાન્ય રીતે માનવામા આવે છે. માણસો ચિત્રાકેડા મોકલી વીરાભગત ને જાણ કરવામાં આવી કે મુંધીનું અવસાન થયું છે. આ સમાચાર મળતાંવીરા ભગત ચિત્રાકેડાથી પાછા ફરે છે. રસ્તામાં એક ગાય મરેલી પડી હતી, વીરા ભગત પોતાની સરજુની આરાધના દ્વારા ગયને સજીવન કરે છે. ત્યાર પછી આવી ને મુંધીને સજીવન કરે છે. સજીવન થયા પછી મુંધી વીરાભગત પાસેથી સરજુનો અલ્યાસ કરે છે. અને માતાજીની આરાધના કરે છે. ધારા ચારવાનો વ્યવસાય કરતાઅને સતત માતાજીની ઉપાસનામાં મળન રહેતા. એમણે પોતાની સરજુ શક્તિના બળે માતમજીની સરજુ ઉપાસના કરી છે. અને મુંધી પણ સરજુની રચના કરે છે. વીરાભગતની સરજુ સજીવન મંત્ર આગમવાણીના સંદર્ભ હતી. આજે પણ મુંધી અને વીરા ભગતની સરજુ સોરઠીયા રબારી સમાજમાં બોલાય છે. મુંધી અને વીરાભગતના જીવનસં દર્ભે અન્ય વીગતો પ્રાપ્ત થઈ નથી. માત્રાએમની રચનાઓથી ભક્તવર્ગમાં જાણીતા છે. મુંધી નીસમાંથી બળેજની બાજુમાં ચિત્રાકેડા ગામે આવેલી હોવાનું કહેવાય છે.

### માહિતીદાતા

- (૧) કાનજી ડિરજી બારોટ જુનાગઢ ૩.વ. ૭૫
- (૨) રામભાઈ રાડા જુનાગઢ ૩.વ. ૫૫

## વીરાભગત (વીરોગોસીયો)

પોરબંદર તાલુકાના ગોસા ગામમાં અંદાજે ૨૦૦ વર્ષો પહેલાં વીરાભગત ગોસીયોનો જન્મ થયેલો, એમની અટક કોડીયાતર હતી. બાલ્યકાળથી જ પશુપાલનના વ્યવસાયમાં તે સામેલ થઈ ગયેલા પરંતુ પૂર્વભવનાભક્તિ ત સંસ્કારો એમનામાં ચાલ્યા આવતા હતા. ગામના રબારી ભક્તો માતાજીની સરજૂ બોલતા એ સૌની સાથે વીરાભગત પણ માતાજીની આરાધના કરતા. એમ કરતાં કરતાં વીરાભગત યુવાવસ્થાએ પહોંચે છે. ત્યાર સુધીમાંતો એમને ભક્તિનો રંગ સોણે કળાએ લાગી ચૂક્યો હતો.

વીરાભગતને માલઠોરમાં બકરાં હતાં. બકરા ચરાવતા ચરાવતા સતત માતાજીની આરાધનામાં રત રહેત હૈ. એક સમયે વરસાદની ઋષ્ટુ હતી. અને વીરાભગત બકરા ચરાવતા ચરાવતા ઓડદર ગામની પૂર્વ દિશામાં ગામથી છે—સાત કિમીનાં અંતરે ચિરોડાની ઘાર તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે. ત્યાં જઈ ચડયા, અને પુષ્કળ વરસાદ પડતાં ઘારની ફરતે ખુબ પાણી ભરાઈ ગયું પોતાના બકરા સાથે એ પાણીની વચ્ચે આવી ગયા (આજે પણ સારો વરસાદ પડતા ત્યાં પાણી ભરાઈ જાય છે. પરંતુ પુલ બાંધવામાં આવ્યો હોવાથી નીકળી શકાય છે.) બહાર નીકળી શકાય તેમ ન હતું. રાત પસાર કરી બીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો. વીરાભગત સરજુ દ્વારા માતાજીની સતત આરાધના કરતા રહ્યા. સતત બે દિવસથી ભુખ્યા ભગતની આરાધના સાંભળી માતાજી વીરા ભગતને ભાત લઈને જમાડવા માટે પ્રગટ થાય છે. કંસાના ભાણામાં માતાજી પોતાના હાથે વીરાભગતને સાત કોળીયા જમાડે છે. આ સાત કોળીયા ભોજન કરતા વીરા ભગતને પોતાના સાત અવતારનું જ્ઞાન થઈ ગયું એને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. વીરાભગત ચિરોડાની ઘારથી કમળ લઈને માતાજીની પૂજા માટે ઓડદર ગયા. પરંતુ એ સમયના ભૂવા આતાએ વીરાભગતને પૂજા કરવાની ના પાડી ત્યારે ભગતે કહ્યું કે, તમે મને પૂજા કરવ નીના; પાડો છો પરંતુ માતાજી મને ચિરોડાની ઘારે જમાડવા આવેલા, અને જે કંસાનું ભાણું લઈને વીરાભગત જમાડેલા તે ભાણું વીરાભગતને ભૂવાઆતાને આપ્યું એટલું જ નહીં પરંતુ માતાજીના દર્શન પણ ભૂવા આતાને કરાયા. પછીથી વીરાભગત ભક્તિ અર્થે બરડા કુંગરમાં ઉત્તરી પડેલા.

વીરાભગત એરડા પાદરીયા ઘેડમાંથી ભાગાને બિલેશ્વર આવ્યા. ત્યાંથી કિલેશ્વરની બાજુમાં આવેલ પ્રાંસ યા તળાવ આવ્યા ; ત્યાંથી વાંસની એક લાકડી કાપી. (આ સમયે સમાજમાં મરકીનો રોગ જોશભેર વ્યાપી વળેલો , એ લાકડી લઈને ભગત રાણપર ગયા. ત્યાંથી બગવદર પાસે આવેલા મજ્જ્યાવાણ ગયા. ત્યાંથી એમણે જેઠા ભરવાડ ને સાથે લીધા. અને કુણવદર ગયા. એ વખતે એક શામળા રબારી સેવા માટે આવેલો. એમને કહ્યું કે, એક પાણીઓ ઘડ કે ભરી લાવો, અને એક કાચનો મોટો સીસો લઈ આવો. એ વસ્તુ આવી ગયા પછી બીજા ભક્તોને વીરાભગત કહ્યું તમે સૌ જતા રહો. અનિન્ધ્ય પ્રગટ થાય અને શાંત થઈ જાય ત્યારે સેવા માટે આવજો એવું કહીનેસૌને વિદાય કર્યા, અને વીર ભગત ઉનનો ઘાબળો પાથરી સરજુના મંત્રો ચાલુ કર્યા અઠયાસી હજાર મંત્રો બોલ્યાપછી મરકો ઉપર કાબુ મેળવી શકયા. મરકીને વાચા થઈ. હું ભવિષ્યમાં મુક્ત થાઉં. એવો જામીન આપો. વીરાભગતે જામીન આપવાની ના પાડી દીધી, અને મરકીને સીસામાં પુરી દીધી. આ કાર્ય માતાજીની કૃપાથી થયું એવી મનોમન વિનમ્રતા પ્રગટ કરી. અને તેની જાણ સૌ ભક્તોને પણ કરી. આ કાર્ય પછી વીરાભગતે ભવિષ્ય કથન કર્યું કે આ જગ્યા ઉપર ગા મનો ટીબો બંધાશે. અને ત્રીજી પેઢીએ અહીં એક જ્ઞાની પુરુષનો જન્મ થશે. વીરાભગતની ભવિષ્યવાણી સાચી ઠરી તે જગ્યા ઉપર કુણદર ગામનો ટીબો બંધાયો, અને ત્રીજી પેઢીએ ગામમાં ત્રિકમાચાર્યનો જન્મ થયો. ત્રિકમચાર્ય બરડા કુંગરમાં ફરી ભજન કર્યું અને ત્રણ હજાર વર્ષ સુધીની ભવિષ્યવાણી કરી. એનું પુસ્તક 'જ્ઞાન પ્રકાશન' માં આ જોવા મળે છે.)

વીરાભગતે પ્રાંસીયા તળાવ પાસથી કાપેલી વાંસની લાકડી અભિમંત્રિત કરી જેઠા ભરવાડને આપી અને કહ્યું કે, હાલમાં જયાં માતાજી હજાર હોય ત્યાં આ લાકડી મુક્તી. આ સાંભળી જેઠા ભરવાડે પૂછ્યું કે, ભગત આ બાબ તની ખાતરી કઈ રીતે કરવી ? વીરાભગતે કહ્યું, પગમાં પગરખા સાથે દરેક મઢમાં માતાજીને પગે લાગવુંજ્યાં પગમાંથી એની મેળે પગરખા નીકળી જાય ત્યાં આ લાકડી મુક્તી દેવી. વીરાભગતની વાત સ્વીકારી જેઠોભરવાડ એક પછી એક માતાજીના મફે પગે લાગતાં લાગતાં આગળ વધે છે. તેઓ ચોરવાડ પહોંચતા મફ

ના દરવાજે જેઠા ભરવાડના પગમાંથી પગરખા નીકળી ગયાં. એટલે જેઠા ભરવાડ ચોરવાડના મફલમાં લાકડી મુકી (અ જે પણ ચોરવાડ મફલમાં આ લાકડી મોજુદ છે. જે મે જોઈ પણ છે.)

ઉપરોક્ત ઘટના પછી વીરાભગત કુણવદરની ધરતી ઉપરથી પ્રસ્થાન કરતાં કરતાં ભાણવડના દુધાળા ગામે આવે છે ,ત્યાં થોડો સમય રોકાઈને કપુરીને નેસ આવ્યા, અને ત્યાં સાધના કરી અને ભગત તેરમી સ્થિતિ મેળવી હો વાનું કહેવાય છે. ત્યાંથી કેદારેશ્વરનું મંદિર જે રામા અવતારનાં સમયનું મનાય છે. તેની બાજુમાંગંગેશ્વર તળા વ આવેલું છે. ત્યાં આહૃતિઓ આપી. અને તરસાઈ પાસેના કંબીયા તળાવ ગયા ; ત્યાં ટીડોમોરી અને વીરાભગતન શિષ્ય હતો. અને જ્યારે વીરાભગત મળે ત્યારે વારંવાર કહ્યા કરતો કે, ભગત આપણે ગંગાજીસનાન કરવા માટે જવું છે. આ વખતે વીરાભગતે ગંગા જવાની હા પાડી અને વીરાભગત અને તેના શિષ્ય ટીડા મોરી બંને જણા નકકી કરીને ચાલતા થયા, અને જોજરી પહોંચ્યા. અને ત્યાં પાણીના ધુનામાં બંને જણા નાહવા પડ્યા. તે સમય દરમિયાન ટીડા મોરીનું મનસસંસારની માયાજાળમાં ફસાયેલું હતું અનેક તર્ક વિતર્ક એના માનસમાચાલ તા હતા. આ સુશ્રમ ગતિવિધિ ભગત પારખી ગયા. અને વીરાભગત અદશ્ય થઈ ગયા. અદશ્ય થતી વખતે વીરાભગત કહું જો જરી ટીડો મોરી એ બાજુ જુએ ત્યાં વીરાભગત અદશ્ય થઈ ગયા. આ ઘટનાથી ટીડો મોરી ખુબદુઃખ થઈ ગયા. અને ઉપ્યોગ સરજૂના પાઠ કર્યા એટલે વીરાભગતની આકાશવાણી સંભળાય કે, એ સમય જતો રહ્યોહવે માત્ર તારી સમાધી પૂજાશે. વીરાભગતન કહ્યા પ્રમાણે ટીડા મોરીની સમાધી વાંસજાળીયા પાસે પૂજાય છે, એવું કહેવાય છે, કે વીરાભગત ત્યાંથી નારાયણ સરોવર ગયો ત્યાંથી કપીલા ગાયનું દૂધ લઈ હરદ્વાર ગયા ; ત્યાં શિવપૂજા કરી, શિવ પ્રસન્ન થયા પછી તેઓ અમર સરોવર ગયા. ભક્તોમાં વીરાભગતની કથા અહીં સુધી પ્રાપ્ત થાયછે. એમની ભવિષ્યવાણી છે , કે ભવિષ્યમાં માતાજીના ૨૧ મઠ થશે અને આ બધા જ મફલમાં એક સાથે ૨૧ પૂજથશે એ પૂજ ઉત્સવમાં હું સદેહ આવીશ ઓળખની નિશાની આપત એમણે કહ્યું કે , ડોકમાં પાથડીનો આંટો હશે કપાળમાં ત્રિશુલનું નિશાન હશે અને જમણ હાથમાં પલ્લ હશે.

વીરાભગતની આગમવાણી મુજબ આજે સોરઠીયા રબારીમાં પૂજાતા માતાજીના મફલની સંખ્યા વધી રહી છે.

#### માહિતીદાતા

- (૧) બીજલભગત કપુરીનો નેસ.તા.ભાણવડ ઉ.વ.૫૦
- (૨) રામભાઈ રાડા જુનાગઢ ઉ.વ.૫૮
- (૩) ગોગનભાઈ કોડીયાતર હાલ ચિરોડાધાર ઉ.વ.૭૨

## શક્તિ ઉપાસક સાંગાભગત—ગીદડીયાનેશ (સાસણગીર)

સાંસાણગીથી ૧૦—૧૨ કિમીનાં અંતરે સાંગાંદ્રા ગામ આવેલું છે. ગામની પણિમ દિશામાં ગીદડીયાનેશા વેલો છેં ત્યાં સાંગાભગતની સમાધી આવેલી છે.

સાંગાભગતના પિતાનું નામ દેવાભાઈ અને માતાનું નામ અમરીબેન હતું. તેઓ સિંઘલ અટકના રબારી હતા . સાંગાભગત બાલ્યકાળથી જ પોતાના પરંપરાગત પશુપાલનના વ્યવસાયમાં જોડાયેલા. પશુપાલન કરતાકરતા માતાજીની સરજૂની ઉપાસના એમણે શરૂ કરી, ધીમે ધીમે આ સરજૂની ઉપાસના એમણે પૂર્ણ રીતે સ્થિષ્યકરેલી. નોરતા માં ગીરના જંગલમાં એ માતાજીની સરજૂદ્વારા સતત ઉપાસના કર્યા કરતા આ ઉપાસના નોરતાનાન્વ દિવસ એ પૂરી આત્મવિશ્વાસથી કરતા ત્યારે માતાજીની કૂપાથી એમના ચરણોમાં નાગદેવતા વાસ કરતા અને પગનો અંગૂઠો મોઢ માં લઈ નાગ દેવતા આનંદ કરતા.

સાંગાભગતના જીવનના ઘણા પ્રસંગો છે. એમાં એક વખત બરડા કુંગરના નાભકાના નેસની બાજુમાંથી પસાર થતા હતા. ત્યારે એક ખાખરાના ઝડ નીચે વિસામો લીધેલો. એમના સાથીદારોએ ભગતને કહ્યું કે, આ ખાખરાના ઝડ નીચે માતાજીનું નાનકડુ મંદિર બનાવવામાં આવે છે.

ભગત પાસે દિવ્ય દૃષ્ટિ પણ હતી. તેઓ જીવતા હતા. ત્યારે પણ લોકો માનતા લઈને આવતા. બહારથી કોઈ મહેમાન આવવાના હોય તો ભગત એમના ઘરનાને જગ્ઘાવી દેતા કે, ફેલાણા ગામથી એટલામહેમાન ઓ આજે આવવાના છે. બપોર થતા સુધીમાં પહોંચી જશે માટે જમવાનું તૈયાર રાખજો.

સાસણથી જુનાગઢ રોડ ઉપર કરશનગઢ ગામ આવેલું છે. તે ગામનાં દરબાર લખુભાઈને બે દીકરાઅપણ ગ હતા. એમણે ભગતની માનતા કરી લખુભાઈ દરબારના બંન્ને દીકરા ચીનાભાઈ અને રાણીગાભાઈપોલીયાન । રોગમાંથી મૂકૃત થઈ ગયેલાં આ બંન્ને ભાઈઓ આજે પણ ભગતની સમાધીએ દર્શન કરવા માટે અવાર નવાર આવે છે. કોઈ ઢોર ઢોહવા ન દેતું હોય અથવા કોઈને સર્પદંશ થયો હોય તો ભગતની માનતાથીસારુ થઈ જાય છે એવી લોકમાનયતા છે.

ભગત સમાધીસ્થ થયા પછી પણ પરચા આપતા રહે છે. સંગોદ્રા ગામના બ્રાહ્મણ જાદવગોરને રાત્રે પરચો આપેલ ગોર પાસેથી દુધ પીધુ અને પછી અદશ્ય થઈ ગયા.

ભગતના જીવનની અનેક ચમત્કારીક ઘટનાઓ છે. ગીદીયાનેસ વસવાટ કર્યો એ પહેલા દુધાળા રહેતા ત્યાં એમને તેના ભાઈ વેજાભાઈ સાથે જગડો થયેલો. ત્યારે વેજાભાઈએ સાંગા ભગતને મારેલા પરંતુ મારની અસર ભગત ને થયેલી નહીં મારનારને જ થયેલો.

ભગત હયાત હતા ત્યારે નેસમાં એક ભેસને સપદંશ થયેલો અને ભેસ ગુજરી જતાં માલિકના ઘરના સૌલોપાત કરતાં હતાં, ત્યારે ભગતની યાદ આવતાં ભેસનો માલિક ભગત પાસે દોડી જાય છે. અને ભગતને રજુઆત કરે છે ભગત ત્યાં જઈ માતાજીની આરાધના કરી ભેસને જીવિત કરે છે.

ભગતની સાથે એક ગઢવી સાથી હતો. એક દિવસ ગઢવીની દાનત બગડે છે. અને ભગતના ઘરમાંથી ચોર કરીને ધીનો ડબ્બો વેચી નાખવાનો એને વિચાર આવે છે. ગઢવી ધીનો ડબ્બો ઉપાડવા જાય છે. ત્યાં આંધળો થઈ જાય છે. સવારે ભગત પાસ કબુલાત કરે છે ત્યારે દૃષ્ટિ પન:પ્રાપ્ત થાય છે. એક ગઢવીએ ભગતના માથા ઉપર નારીયેળ વધેરવાની માનતા માનેલી એ માનતા પુરી કરવા ભગત પાસે આવે છે ત્યારે વાત કરીશકતા નથી. પરંતુ ભગત સ્થિતિ પામી જાય છે. ગઢવીને કહે છે કે નારીયેળનો છૂટો ધા કર ગઢવી તેમ કરે છે ત્યારે ભગતના માથા સુધી પહોંચતા પહેલા નારીયેળ તુટી જાય છે. જંગલમાં ભગતને ડફેર સાથે સંધર્ષ થયેલો દુધાળાથી સાસણ જતાં રસ તામાં આ ઘટના બનેલી ડફેર બંધુક વડે ભગતને ભડકે દેવા તૈયાર થયેલો. પરંતુ બંધુક કુટેલી જ નહીં. જંગલમાં વસવાટ દરમિયાન હિસ્ક પ્રાણીઓ સાથે પણ ભગતને સંધર્ષ થયેલો. એક વખત બંધારાપાસે સુતા હતા. ત્યારે મગર સાથે સંધર્ષ થયેલો. એક વખત ખડનેસમાં ભગત હતા. ત્યારે સાતેક સાવજનું ટોળું ભેસોના શિકાર માટે આવી ચહેલું ત્યારે ભગતે પોતાના માથા ઉપરનું મેલખોરીયું સાવજને મોઢામાં પકડાવી દેતાં સાવજો ત્યાંથી ભાગી છૂટેલાં.

ભગત એક વખત બળેજ મઠની દુધિયો ધજામાં ગયેલા ત્યારે ભગતની સાથે એક કૂતરો પણ આવતો હતો. એ વખતે ધજાના પીછીધર પરબતા આતાઓ કહેલું ભગત આ કૂતરો કેમ સાથે આવે છે? આપણે કેટલાગામડા ફર્યા તો પણ આ કૂતરો સાથેને સાથે જ છે. ત્યારે ભગતે કહ્યું કે, એમને ગયા જનમની ધજામાં જવાનીમાનાતા અધુરી રહી ગઈ છે એટલે એ સાથે સાથે આવે છે. છેલ્લા દિવસે ધજા માતાજીના મફને પરત ફરી અને ગલાલનો શાશગાર ચડ્યો પછી કૂતરો અદશ્ય થઈ ગયેલો.

ભગતે પોતાનું મોટાભાગનું જીવન દુધાળા નેસમાં પસાર કરેલું અને એમને સમાધી પણ ત્યાં જઆપ વામાં આવેલી પરંતુ જંગલમખાતાના હસ્તક્ષેપને કારણ હાલમાં સમાધી સ્થાન સાંગોદ્રાની બાજુમાંગિદીયાન । નેસમાં બનાવવામાં આવ્યું છે. ભગતના પરિવારમાં આજે એમના પત્નિ કારીબેન પુત્રો નારણભાઈ અને કરશનભાઈ ગીદીયાનેસ રહે છે. અને ભગતની સમાધીની સેવા પૂજા કરે છે સાથે સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે.

માહિતી દાતા

- (૧) નારણભાઈ સંગાલ્બાઈ સિંઘલ ઉ.વ.૩૫ ધંધો પશુપાલન સાસણ
- (૨) આલાભાઈ ડાયાભાઈ ગઢવી ઉ.વ.૩૬ ધંધો પશુપાલન ગીડીયા
- (૩) કારીબેન રાજભાઈ ઉ.વ.૮૦ નિવૃત્તિ ગીડીયા

## પુંજાભગત ચાવડા

પુંજા ભગત ચાવડા શાખનાં રબારી હતા એમની જન્મસાલ મળતી નથી પરંતુ અંદાજે ૧૩૦ વર્ષ પૂર્વે થઈ ગયા હોવાનું મનાય છે. પુંજા ભગત માતાજીના પરમ ઉપાસક હતા. અને સરજૂ દ્વારા માતાજીનીએ ઉપાસના કરતા હતા. કુતિયાણામાં માતાજીના મઠની સામે એમનું નિવાસ સ્થાન હતું.

સોરઠિયા રબારી કોમભાં જન્મેલા પુંજા ભગતને માતાજીની ઉપાસના પરંપરાગત વારસામાં મળેલી હતી. એ ઉપાસના પદ્ધતિમાં રત રહિને સમાજ અને આજુબાજુના પંથકમાં એમની ભગતની છાપ ઉત્પન્ન થયેલી અને સૌ કોઈ એમને પુંજાભગતના નામે ઓળખાતા.

પુંજાભગત ગાયો ચારતા અને પશુ પાલનનો વ્યવસાય કરતા. એમાં એક વખત એમનો ગાયો એ સમ થના દેશી રાજ્યના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી ગઈ હશે. એટલે રાજ્યના હવાલદારોએ ગાયોને ડબ્બામાં પુરી દીધે લી. ભગત પાસે આર્થિક વ્યવસ્થા હતી નહીં કે, દંડ ભરીને ગાયોને છેડાવી શકે. એટલે એમણે જ્યાં પોતાની શ્રદ્ધા હતી. ત્યાં બળેજની માતાજીના પાંચ છેલણ પાવાની માનતા માની અને આખરે એની ગાયો છૂટી ગયેલી.

ભગતનું ગાયો છોડાવવાનું કાર્ય પૂર્ણ થઈ જતા પોતાની માનતા પૂર્ણ કરવા માટે સંકલ્પ કર્યો. તે વખતે ભગત કુતિયાણાની સીમભાં 'ઉલ્લીધાર' તરીકે ઓળખાતી સીમભાં રહેતા, ભગતને ખબર પડી કે, ગામભાં બળેજના ભુવા આતા ધુંધાઆતા ધુપેડા માટે આવેલ છે. તો માતાજીના છેલણમાં ભુવાઆતાને નિમંત્રણ આપવુ. એટલે એમણે કુતિયાણા જરૂર ધુંધાઆતાન. છેલણા જમવા માટે રોકવા પ્રાર્થના કરી. ધુંધાઆતાએ પ્રાર્થનાનો સ્વીકાર કર્યોભગત છેલણા જ માડવા માટે વસ્તુઓની ખરીદી માટે ગયા. પરંતુ ભગત ખરીદી કરીને પરત ફરતા ઘણી વાર લાગી. આખરે ધુંધાઅતા કંટાળીને ભગત આવે તે પહેલા ધુપેડાના કામે શેરગસ (કુતિયાણાનો વિસ્તાર) જતારહા. ભગત ખરીદી કરી પરત ફરતાં ખબર પડી કે, ધુંધાઅતા તો કંટાળીને જતા રહા. આ જાણતા જ ભગતનો કોષ ભભૂકી ઉઠ્યો; અને એ ના મુખમાંથી સાપ રૂપે શબ્દો સરી પડ્યા, "કરડયો જતો રહ્યો ?" એ સમય ધુંધાઅતા શેરગસ સાંજ પડી જવાથી માતાજીને ધુપ કરતા હતા, એ ધુપેલીયામાંથી સાપ કરડયો. ધુંધાઅતા પણ માતાજીના પરમ ઉપાસક અને સિદ્ધ પુરુષ હતા. ઓળખી ગયા કે, પુંજાભગતે આ સ્થિતિ નિમાણ કરી છે. એટલે એ પણ કોષમાં બોલી ગયા" કોઢીએ કરડયો " એ શબ્દો નીકળતા પુંજા ભગતને કોઢ નીકળેલો. કોઢનીપીડા સહન ન થતાં વાંદા કોડીયાતરના કુળદેવી અને માતા જોગમાયાના મંદિરે જરૂર ત્યાં ઉભેલા વડલા ઉપર ચડી આપધાત કરવાનો પ્રયત્ન કરેલ. પુંજાભગત વડના ઝડપથી નીચે પડતું મુક્તા માતાજી પ્રસન્ન થઈ એ ઘરતી ઉપર એ પડ એ પહેલા ભગતને ઝીલી લ્યે છે. માતાજીએ પ્રગટ થઈ ભગતની પીડા જાણી, ભગતને કહું કે, તુ બળેજની પુંજામાં જશે ત્યાં ધુંધાભુવા પાસે જરૂર એક થાળી માં ભોજન લે જે. એટલે તારો કોઢ દૂર થશે. ભગતે

માતાજીની આશા માની તેમ કરતા તેનો કોઢ દૂર થયો. સાથે સાથે માતાજીએ પ્રસન્ન થઈ પુંજાભગતને વરદાન આપે લુકે,

(૧) ભગત પોતે નિવંશ જવાનું વરદાન.

(૨) કુતિયાણા માતાજીના મંદિરે અન્નક્ષેત્રે ચલાવવું અને તેમાં ઘટ ન પડે.

(૩) કુતિયાણા ૧૨ ગામ પૈકીનો કોઈ પણ રબારી કુતિયાણામાં આવેલ માતાજીના મંદિરે પગે લાગીને સમાધાન માટે જાય તો સર્ફણ થાય.

(૪) કુતિયાણા પંથકમા બાર ગામના લોકો માતાજીના મંદિરે આશિર્વાદ મેળવી શુભકાર્ય કરે તો કોઈ વિધન ન આવે.

ઉપરોક્ત ચાર વરદાન પુંજાભગતે માતાજી પ્રસન્ન થતાં માંગેલા, અને માતાએ એ વરદાન આપેલાં એમાં પુંજાભગતે પોતા માટે નહીં પરંતુ પોતાના પંથકના રબારીઓ માટે કલ્યાણ થાય એવું માગી અને પોતાનો વંશ ન રહે એવું કહવું પણ સંત જીવનને શોભે એવું વરદાન પણ માગેલું આમ ,સમાજ સેવા કરતાં કરતાં ભગત સંસારમાંથી જ વદાય થયા. ભગતની સમાધી કુતિયાણાની મીનીવાડીમાં છે. કુતિયાણા પંથકના ૧૨ ગામના રબારીઓ પોતાને ત્યાં પુનર્જીવન થતાં શ્રાવણ માસના નોમના દિવસે ભગતની સમાધી એ પેંડા ચૂડાવી પ્રસાદ વહેંચે છે. કુતિયાણા માતાજી ના મંદિર સામે એમના ઘર આવેલ છે. આજે પણ એ પંથકના લોકો માતાજી ઉપાસક પુંજાભગત અને એની ભક્તિને યાદ કરે છે.

માહિતી દાતા

(૧) સામતભાઈ દાનાભાઈ ચાવડા ૩.૧.૫૭ રે.કુતિયાણા

## લખમણભગત

લખમણ ભગતનું આખું નામ લક્ષ્મણ વરજાંગ ચાવડા તે કુક્સવાડા વતની હતા. તેઓ મૂળ સનાતની હતા. એમ ના જીવનના કેટલાક પરચા જાણવા મળ્યા છે તેનો ઉલ્લેખ કરીએ.

લખમણ ભગત એક વખત પોતાના દીકરાની સગાઈ હોવાથી ખરીદી કરીને વેરાવળથી પગપાળા આવતા હતા . ત્યાં રસ્તામાં યમદૂતો મળ્યા એમણે ભગતને કહું કે, ભગત તમે જે દીકરાની સગાઈ પ્રસંગે ખરીદી કરીને જઈ રહ્યા છો તેનું કાલે મૃત્યુ થશે. ભગતે કહું કે ખાતરી શું ? એટલે યમદૂતો એ કહું કે, અમે આજે ગામના પટેલનો દીકરો લેવા માટે જઈએ છીએ. જે તમારી સાથે જ રહે છે. ત્યાં તમે પહોંચતા રડવાનો અવાજ આવેતો માનજો ભગત ઘરે પહોંચત । તે જોવા મળ્યું અને બીજા દિવસે પોતાને ત્યાં ઘટના બની જો કે, ભગતની હયાતીમાં જાએમના ચાર દિકરાનાં અવ સાન થયેલાં. પરંતે આર્થિર્વાદથ ભગત દીકરા પણ આપતા.

બીજા એક પ્રસંગે એવો છે કે, લાડુળી ગામે એક કોળી ભગતને ત્યાં સનાતન ધર્મનો પાઠ હતો. ભગત ત્યાં જત ન હતો. તેનું અપમાન કરેલું એટલે રાત્રે પાટ ભરાયો પરંતુ જ્યોત પ્રગટેલી નહીં આખરે કોળી ભગત પસ્તાવો અને લખમણ ભગતને વિનંતિ કરી ભૂલ બદલ માઝી માગી. લખમણ ભગત આપી અને હાથથ્યાં પાણી લઈ છાંટ મારીને જ્યોત પ્રગટ કરી.

માહિતીદાતા

(૧)પુંજાભગત ચાવડા કુક્સવાડા ૩.૫૫

(૨)નથુ વીરાચાવડા ૩.૧૦૦ કુક્સવાડા

## સનાતનપંથના રબારી સંતો ભક્તો

સૌથી જુનો ધર્મ સનાતન છે. આ પરંપરામાં ધજા રબારી સંતો ભક્તો થયા છે. એ વાત કરતાં પહેલાં આપણે બહુ ટૂંકમાં સનાતનપંથની વાતા કરીએ તો યોગ્ય ગણાશે.

જગતની ઉત્પત્તિનું રહસ્ય પાર્વતીજીએ શીવને પૂછ્યું ત્યારથી સનાતન સત્યની ઉત્પત્તિ થઈ. શીવજીનાગળા માં રહેલી રૂઢમાળા જોઈ પાર્વતીજીએ પ્રશ્ન કર્યો આ કોની ખોપરીઓની માળા છે? ત્યારે શીવજીએ જજાબુંકે, (તું વ રંવાર જન્મે છે અને મૃત્યુ પામે છે, ત્યારે પાર્વતીજીને ઉપર્યુક્ત પ્રશ્ન થયો. અને તેનું રહસ્ય શીવજીસમજાવે છે.)

સનાતનની વાત સમજાવતાં શિવજી જળચર, સ્થનચર, વનચળ, ભચરની વાત કરે છે. પછીથી ના દની વાત કરે છે. નાદ બે પ્રકારના છે. 'આહત, અનાહત એક ઉત્પન્ન કરેલ અને બીજો સ્વયંબું. એમાં' આહત 'માંથી કલાઓ ઉત્પન્ન થઈ અને અનાહત 'માંથી સ્વર અને વંજન ઉત્પન્ન થયા. એમાંથી વાણી ઉત્પન્ન થઈ અને વાણી દ્વારા ભાવો અભિવ્યક્ત થયા. પછી જીવસૂષિત ઉત્પન્ન થઈ. મત્સ્ય, કશ્યપ, વરાહ, વામન ઈત્યાદિ અવતારોથયા. પછી સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓની પરંપરા આવી વેદાંત લખાયું એમાં બાર આદિત્ય, આઠવસ્તુ, અગિયારરૂદ્ધ, ઈન્ડ્રગજાપ્તિની રચના થઈ નિશિચર વંશ ઉત્પન્ન થયો.

સત્ય સનાતનના પર્યાય શબ્દો જોઈએ તો મહાપંથ, બીજધર્મ, જૂનોધર્મ, આદિધર્મ, જ્યોતિ સ્વરૂપ, બીજમાર્ગ, નિજિયાધર્મ ઈત્યાદિ શબ્દોથી ઓળખાય છે.

સત્યસનાતનનું ધર્મ સ્વરૂપ જોઈએ તો પાટ ઉપાસના દ્વારા આ ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આ પાઠના પ્રકારો પંચમિયો, દશો, વિશો, વગેરે છે. આ પાઠના દરેક યુગ પ્રમાણેની ઐતિહાસિક વાતો મળે છે.

સત્યયુગમાં રાજા પ્રહલાદ અને રત્નાવાલીએ જતિ—સતિના સ્વરૂપમાં પાઠ કરેલો અને ગુરુગાદીએ આઈ દનાથ બિરાજેલા. એ પાઠ સોનાપાઠ તરીકે ઓળખવામાં આવે છે. ત્રેતાયુગમાં યુવિષ્ટિર અને દ્રોપદીએ પાઠ કરેલ ત્યારે મછંદરનાથ ગાદિપતિ હતા. એ પાઠ ત્રાંબાના પાઠ તરીકે ઓળખાય છે. દ્વાપરયુગમાં હરિચંદ્ર અને તારામાતિએ પાઠ કરેલો એ વખતે ગુરુગાદીએ સારંગીનાથજી હતા. આ પાઠને રૂપાના પાઠ તરીકે ઓળખવામાંઆવે છે. કળયુગમાં બાળિરાજા અને વિજયાવળીએ પાઠ કરેલો ગુરુગાદીએ ગોરખનાથ હતા. આ ચારે યુગના પાઠવખતે અલગ અલગ ૮ ઘક્તિકોટવાળ તરીકે હતા. એમાં પ્રથમયુગમાં ગણપતિ બીજાયુગમાં હનુમાન ત્રીજાયુગમાંગરૂડજી ચોથા યુગમાં ભેરવ જી કોટવાળા હતા.

આ સત્યસનાતન અથવા બીજમાર્ગની પાઠ ઉપાસના ગુપ્ત હોય છે. તેમાં દિક્ષા આપતી વખતે આંખે પાટાબાંધો દિક્ષારીને અંદર લઈ આવવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે, જૂની દાઢિ ત્યજીપાઠમાં પ્રવેશતું જ્યોતિ સ્વરૂપનાં દર્શન કરતાં નવી દાઢિ પ્રાપ્ત થાય. ત્યારે પછી એમાં 'કોરી 'નું મહત્વ સમજાવવામાં આવે છે. કોરી દ્વારા પ્રાણના રહસ્યનો ખ્યાલ આપવામાં આવે છે. પંજા દ્વારા પંચમતત્વનું રહસ્ય સમજાવવામાં આવે છે. 'અદિલ' દ્વારા જણતત્વનું રહસ્ય સ્પષ્ટ કરવામાં આવે છે.

' સાત સાયર અદિલ વિસ્તારા '  
રોજે ધોડે શ્યામ અસવારા '

ઉપર્યુક્ત પંક્તિએ દ્વારા આ માનવદેહમાં રહેલાં સાત ચક્રોની વાત સમજાવવામાં આવે છે. મૂલાધાર, સ્વાદ્ધજીન, મણિપુર, અનાહદ, વિશુદ્ધ, આશા અને શહસ્રાધારા (અનાહત) કોળી પાહોળનું મહત્વ અલગ છે. તેમાં પ્રથમ યુગના હસ્તિની કોળી બીજાયુગમાં કવલી ગાયની કોળી, ત્રીજાયુગમાં રેવત (ધારી)ની કોળી, ચોથાયુગમાં અજીજા (બકરી) નું બલિદાન આપવામાં આવેલ. ચોથા યુગમાં અજીજા સજીવન થઈ શકી નહીં. જેનીસમાધો જુનાગઢ ગરનારમાં આવેલ સવરામંડપમાં આજે મોજુદ બતાવવામાં આવે છે.

આ અંગે સ્પષ્ટતા કરવાની કે, કોળીનું પ્રમાણ સ્થળ દેહના સ્વરૂપમાં નથી પરંતુ આ વાતને સંતોષે સહજતાથી સ્વીકારવાની શીખ આપી જેમ કે, હસ્તિ દ્વારા દેહાભિમાન કવલીગાય દ્વારા નઅતા તો રેવત દ્વારા મનરૂપી ધોડાને કાબમાં રાખવાની અને અજીજા દ્વારા આધીનતા રાંકપણું બતાવવામાં આવે છે.

આ માર્ગ ભક્તિમાર્ગ હોવાથી આમ આદીનતા યુક્ત સ્થિતિમાં રહીને સદ્ગુરુ અને જ્યોતિ સ્વરૂપના સાંચીન્યમાં મૂળ મહાધર્મના મર્મને સમજવા અને પામવા માટે આ દેશના ઋષિઓ અને સંતોચે પાઠ ઉપાસના દ્વારા ભક્તિમાર્ગને જાળવાની સમજણ આપી. આ મહાપંથને બીજમાર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં બારબીજ નું મહત્વ છે. આ બાર બીજ બારમહિનાની બીજ નહીં પરંતુ આધ્યાત્મિક દસ્તિએ એનું મૂલ્ય સમજાનના પ્રયત્નો થયા છે. એ દસ્તિએ જોઈએ તો

### બીજના નામ

- ૧ . કર્મબીજ
- ૨ . વચનબીજ
- ૩ . બુંદબીજ
- ૪.વાસનાબીજ
૫. ઉત્પત્તિબીજ
૬. કોરમબીજ
૭. બ્રહ્મયબીજ
- ૮.નાદબીજ
- ૯.પ્રેમબીજ
૧૦. અલિલબીજ
૧૧. રજબીજ
૧૨. ઓહકારબીજ

### દેહમાં તેનું સ્થાન

- |            |
|------------|
| મન         |
| ઉજ્જ્વાલિત |
| નિકુટી     |
| વિચાર      |
| બ્રહ્મ     |
| મૂત્રાશય   |
| ઓમકાર      |
| શબ્દ       |
| બ્રહ્માંડ  |
| નાલી       |
| યોની       |
| સમગ્રકાયા  |

આ માર્ગ શિવ શક્તિની ઉપાસનાનો માર્ગ છે. પાઠદર્શનમાં દ્વાદશ જ્યોતિલિંગનો પણ સમાવેશ કરાયો છે. આ સનાતન ધર્મ અથવા મહાપંથ વિશે આપણા વિદ્ધાનો ડો. નાથાલાલ ગોહિલ , ડૉ. નિરંજન રાજ્યગુરુ , શ્રી દલ પત પટ્ટિયાર ઈત્યાદિ લેખકો એ ઉદાશ પૂર્વકની ચર્ચા કરેલી હોય આપણો માત્ર થોડો પરિચય મેળવવાનો અહીં પ્રયત્ન કર્યો છે. હવે આ સપ્રદાયના રબારી સંતોભક્તતોની વાત કરીશું.

### માહિતીદાતા

- ૧ . નવલદાસ હરિયાણી , ભડુરી તા. માળીયા ઉ.૫૦ વ્ય.પાઠઉપાસના અને કર્મકંડ
- ૨ . ભીખારામબાપુ , જુનાગઢ ઉ.૫૦ નિવૃત્ત શિક્ષક
- ૩ . કલ્યાણદાસ મેસવાણીયા મેંડરડા ભજન ગાયક ઉ.૫૫

### સાલોસુરો

વિકલ્પ સંવત ૧૨૭૦ થી ૧૩૫૦નાં અંદાજીત સમયગાળામાં સૌરાષ્ટ્રમાં સાલોસુરો નામના બે રબારીભક્તિ થઈ ગયા અમના જીવન અને સંતત્વ વિષયક માહિતી અનેક ભક્તો સંતોની કંદસ્થ પરંપરામાંથી રબારીજ્ઞાતિના વહીવંચા બારોટ પાસેથી એકનિત કરી મુક્કવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. 'પીર સાલાશુરા તથા કુતુંબશા પ્રબોધ 'નામનું કવિનું એક આધ્યાત્મિક પ્રાપ્ત થાય છે પરંતુ આ આધ્યાત્મિક કલપના આધારિત અથવા ગેર માર્ગ દોરનાર હોય મારા આ લેખમાં એનો આધાર લેવાનું ઉચિત માન્યુ નથી. પરંતુ મારા ક્ષેત્રીયકાર્ય આધારીત

જે સામગ્રી પ્રાપ્ત થઈ અને વહીવંચા બારોટના ચોપડામાં જે આધારો છે એને આધારે સાલા—સુરાની ઘટનાઓ ઉદ્દેખવાનો નભે પ્રયાસ છે.

રાજસ્થાનથી કંચ્છ અને કંચ્છમાંથી બાબરા તાલુકાના સાલેમાળ કુંગરની આજુબાજુમાં વસવાટ અર્થે પોતા નો પશુપાલનનો વ્યવસાય કરતી ક્ષત્રિય રાજપુત જાતિ રબારીના નામથી પ્રસિદ્ધ થઈ ચુકી હતી. એમાં સિસોદિયા રાજપુત પશુપાલનનો ધંધો કરતા સોરઠમાં વસેલા. પરંતુ ભયકર દુષ્કાળ પડતાં પાલિતાણાની બાજુમાં આવેલ બોદાન નેસ તરીકે ઓળખાય છે. તેની બાજુમાં કોળાભાનેસ હતો. દુષ્કાળ ગાળવાના આશયથી ત્યાંવસવાટ કરલો પોતા ના પશુધન સાથે પાલિતાણા ના કુંગરના પડધારમાં વસવાટ રહેતા. પરંતુ એમના ધર્મ પલ્લિન આ બાબતે ખોટ ચાલ્ય કરતી.

આ સમયગાળામાં એક પ્રજાપતિ દંપતી પણ દુષ્કાળ ગાળવાના આશયથી કેળાંભાનેસ આવીન વસેલું પરંતુ થોડા સમયમાં કોઈ દંડ થતા પ્રજાપતિ પુરુષનું અવસાન થયેલું એ અનાથ સ્ત્રીને ધનપાલની પલ્લિઅ આશરો આપ્યો અને સાથે રાખી. પરંતુ ધનપાલના પલ્લિને સંતાનની ખોટ સતત ચાલ્યા કરતી એટલે એમને એવો વિચાર આ વો કે, આ અનાથ પ્રજાપતિ સ્ત્રીને મારા પતિ જોડે લગ્ન કરાવું તો કદાચ અમારા ભાગ્યમાં સંતાન હોય તો સફળતા મળે. આ વિચારનો એમણે અમલ પણ કર્યો. છતાં કોઈ સફળતા મળી નહીં.

ધનપાળ દુષ્કાળ ગાળવાના આશયથી પાલિતાણાની પડધરમાં કેળાંભાના નેસમાં વસવ ટક કરેલો. પરંતુ પોતાના પશુપાલનના વ્યવસાયને આ ભૂમિ અનુકૂળ આવતાં ત્યાં સ્થિર થઈ ગયેલા, વર્ષો પસાર થય કે. પરંતુ ધનપાલને ત્યાં સંતાન યોગ ન સર્જયો. આખરે ધનપાલની બંને પલ્લિઓ સાધુ — સંતોની સેવા કરી લોજન કરાવતી. એમાં એક સમયે આર્થુરેદિકના જાણકાર એક મહાત્મા આવી ચડયા એમને લોજન કરાયું. આખરે એ સંત આ બંને સ્ત્રીઓની મુજજવાણ જાણી અને પોતાની પાસે રહેલી ઔષધી આપજો. જેથી તમારી મનોકામના પૂર્ણ થશે.

બંને સ્ત્રીઓ સાધુ મહાત્માને લોજન કરાવી એમણે આપેલી ઔષધી ખીરમાં નાખી અને પોતાના પતિ ધનપાલને પાંડરિયા વિસ્તારમાં જયાં ઢોર ચારતા હતા ત્યાં ગઈ સાધુને જમાડતાં અને ફરી રસોઈ તૈયાર કરતાં ધ્યુ મોહુ થયેલું એટલે ધનપાલને ખુબ ખુબ પણ લાગેલી, એને તેને કારણે એ કોધાવેશમાં પણ હતો. એમાં ભાતની સાથે આવેલ ખીર જોઈને એ વધારે ગુસ્સે થયો અને તેના મનમાં સંશય પેદા થયો કે, આ ખીરમાં નકડી ઝેર કોચલા હંવા જોઈએ. આ બંને લેગી થઈને મને મારી નાખવા માંગતી લાગે છે. એટલે કોધાવેશમાંબાજુમાં આવીને ખીર ફેકી દીધી. રાફડામાં એક દર હતું. ખીર એ દરમાં ઉતરી અને રાફડામાં નાગદેવતાના મોઢામાં ગઈ, આવું સુંદર ભોજન મળતાં નાગદેવતા પ્રસન્ન થયા. અને બહાર આવ્યા. ભગત ધનપાલન અને એમની સ્ત્રીઓને જોઈ નાગદેવત ને વાચા ફૂટી બોલો તમારા ઉપર આજે પ્રસન્ન થયો છું તમારે શું જોઈએ છે? ધનપાલ અને તેની બંને પલ્લિઓએ ખોળા પાથરી નાગદેવતાને વિનંતિ કરી કે, અમારે ધરે પારાણુ બધાય અને નિઃસંતાન છીએ. આ સાંભળી નાગદેવતાએ વરદાન આપ્યુ કે, જાઓ તમારે બંનેને ખોળો એક એક પુત્ર અવતરણ માથે મોડિયા હશે. અને જગતમાં કોઈને માથું ન માવશે નહીં. અને મોટા મહાપુરુષો થશે.

ઉપરોક્ત ઘટના પછી નાગદેવતાના વચનથી ધનપાલની બંને પલ્લિઓને એક એક પુત્રનો જન્મ મોડિયા સાથે થયો ( બીજી એક માન્યતા પ્રમાણે પુત્ર જન્મ પછી મોસાળમાં નાગદેવતાએ મોળીયા આપેલા ) બંને પુત્રોબાલ્યકાળ થી જ તેજસ્વી અને પ્રતાપી હતા. કોઈને મસ્તક નમાવતા નહીં. પુરુષાર્થ અને ભાગ્ય યોગે ખુબ સમૃદ્ધ બન્યા. અને એ પતાની સમૃદ્ધિ પણ ભરપુર હતી. છતાં કોઈ અભિમાન દંબ કે ઉદ્ધતાઈ ન હતાં. સાદા સરળ અને જરૂરિયાતોવાળાને મદદરૂપ થતા. દાન પૂર્ણ કરતા. આ રીતે એમની નામન સૌરાષ્ટ્રભરમાં ફેલાવા લાગી.

સાલો —સુરો યુવાન વયમાં પહોંચતાં સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત અને આગમવાળીના ખ્યાતનામ સર્જક દેવાયતપંદિતાના સંપર્કમાં આવ્યાં. અને એમનું ગુરુપદ સ્વીકારી શિષ્ય બન્યા. લોકવાયક મુજબ દેવાયત પંડિતને સાડાસાત્થો શિષ્ય હતા. દેવાયત પંડિતના ધરમાં સ્વર્ગની અપ્સરા સતી દેવલદે હતા. શોભા જી એ દેવાયત પંડિત સાથે દેવલદે ના લગ્ન કરાવતી વખતે સતી ઉપર કોઈ પણ પ્રકારની શંકાક્યારેય રાખવી ન હી અનેજો શંકા કરવામાં આવશે તો સતી અદશ્ય થઈ જશે. એવું જણાવેલ પરંતુ દેવાયત પંડિતથી એક વખત દેવલદે ઉપર શંકા જાય છે. અને તે વખતે દેવલદે થઈ જાય! પરિણામે દેવાયત પંડિત એનોવિયોગ સહન કરી શકતા નથી. ને પોતાના મજેવડી ગામ નજીક પહોંચતાં એના ગાંડાનો ધરો ભાંગે છે. અનેસાંધવા માટે મજેવડીના દેવતાણ

ખી લુહાર પાસે જાય છે. લુહાર પણ પૂર્જી ભક્ત હતો. અમાસ હોવાને કારણે એનુંકામ બંધ હતું. દેવાતણખીએ દેવાય ત પંડિતને ધરો સાંઘવાની(એરણ ઉપર ધા મારવાની)ના પાડી. પરંતુ દેવાયતપંડિતનો દેવલદેની શોધ કરવામાં એ ટલા મળ્યા હતા કે , પોતાની રીતે ધરો સાંધી લેવાની તૈયારી દર્શાવી. દેવતણખીએ છૂટ આપી પરંતુ એરણ ઉપર ધણાનો ધા મારતા એરણ પાતાળમાં પેરી ગઈ. આ જોઈ દેવતણખીએ કહું મારા પગની પાની ઉપર ધા મારી ધરો સાંધી લ્યો. એમ કરતા ધરો સંઘાયો. પરંતુ દેવતણખીએ દેવાયત પંડિતનીબથ્થા જાણતા હતા. પરંતુ શિષ્યો બનાવવાની ભ્રમ જાળમાં દેવાયત ફસાયેલા હતા. એટલે દેવતણખીએ કહુંકે , તમે જે સત્તિ દેવલદેવને શોધવા માટે આટલા શિષ્યોની ફોજ લઈને નીકળ્યા છો એ દેવલદે પાસે મારી આનાનકડી દીકરી લિળલદે રમવા જાય છે. પરંતુ એક શરતે તમ ને એનો મેળાપ કરાવી આપુ કે , તમારા આ સાડા સાતખો શિષ્ય અનિન ઉપર સૂકે અને એ શિષ્ય ઉપર પગ મુક્તાં મુક્તાં તમે દેવલદે સુધી પહોંચી શક્ષાં આધાત સાંભળીને તમામ શિષ્યો રાત્રે જ જતાં રહ્યા. માત્ર ચારજ શિષ્યો રોકાય અને અનિન ઉપર સુતા અને દેવાયત પંડિત તેના ઉપર પગ દઈને દેવલદે સુધી પહોંચે છે. આમ દેવાયત પંડિતનો દેવલદે સાથે પુનઃમિલાપ થયો. આવા ચુરુ ભક્ત સંત તરીકેની સૌરાષ્ટ્રભરમાં સાલા—સુરાની નામના ફેલાયેલી છે.

સાલો—સુરો ભક્ત હતા. ઉપરાંત દાતા તરીકેની ઓમની નામના પણ એટલી જ નોંધપાત્ર હતી. દિલ્હીના એક શરણાઈ વાદક મીર માગતાં માગતાં સૌરાષ્ટ્રમાં ચડી આવ્યો. અને સાલા—સુરાના નિવાસથાન સાલા—સૂરાએમીરને સકોળાંબા પહોંચ્યો. ત્યાં ખુશ થઈ ગયેલો. જુંદગીભર માંગવાનું બંધ કરી સાલા—સુરાની પ્રસિદ્ધ કરવાલાંયો અને તે વાત છેક દિલ્હીના ગુલામવંશના બાદશાહ કુતુબદીન એબક પાસે પહોંચ્યો ( ઈ.સ. ૧૨૦૨ થી ૧૨૦૬ કુદુ બદીનો રાજ્યકાલીન સમય ) એટલે દિલ્હીના બાદશાહે પોતાના સૈનિકો મોકલી સાલા—સુરાને કેદ કરી લઈ આવવાન કુદુક કર્યો. સાલા—સુરા કોઈને માથું નમાવતા નહીં. એ ની જાણ બાદશાહને હતી. એટલે એમણે સાલ—સુરાના પ્રવેશ માટે દરવાજો નીચો કરાવ્યો. પરંતુ સાલો—સુરો માથું નમાવીને પ્રવેશવાને બદલે માથું પાછળ રાખી પગથી પ્રવેશ કરીને માથું નમાયું નહીં. આ જોઈને બાદશાહ વધુ ગુસ્સે થયો, અને બંન્ને ને જેલમાં પુરવામાં આવ્યાં, અને મરચા દળવ જેવી કષ્ટદાયક સજા કરી. પરંતુ આ બંન્ને સંતો રામસાગરના સથવારે હરીનું ભજન કરવા લાગ્યા. અને મરચા દળવાની ઘંટીઓ એની રીતે ફરવા લાગ્યી. ઉપરાંત બાદશાહની કુવરી હિરલબાઈને સાલા — સુરાના ભજનની પ્રગાઢ અસર થઈ. સાલા—સુરાના પરચા અને હિરલબાઈની શ્રદ્ધા ભક્તિથી બાદશાહેબન્ને સંતોને મુક્ત કર્યો અને સાથે પોતે પણ સાલા—સુરાનો પંથ સનાતન સ્વીકારી શિષ્યત્વ ધારણ કર્યું. અને હિરલબાઈ સાલા—સુરા સાથે કોળાંબાના ને સમાં આવેલાં અમે ત્યાં આજે પણ સાલા—સુરાની સાથે હિરલબાઈની સમાધી પણ બતાવવામાં આવે છે.

સાલો—સુરા મૂળ સિસોદિયા રાજ્યપુતમાંથી પશુપાલન સાથે જોડાયેલા અને સોરઠીયા રબારી તરીકે ઓળખાયેલો. આ વાતની ચર્ચા જ્ઞાતિ પરિચયના પ્રકરણમાં કરેલ હોય અને પ્રસ્તુત છે. પરંતુ રબારીમાં પણ કેટલાંક એને વીજોંયા અને ગુજરાતી રબારીમાં હોવાનું અનુમાન લગાવે છે. પરંતુ સાલા—સુરાની વિગતો સોરઠીયા રબારીના બારોટ કાનજી હીરજના ચોપડે આધારો સાથે નોંધાયેલી છે. એટલે આવી બાબતોનો અંત આવે છે. અને એટલું નિશ્વિત થાય છે કે , સાલો—સુરો સોરઠીયા રબારી હતા. અને તેનો વંશ સુરા—મોરી રબારી તરીકે ઓળખાય છે. સાલાનો વંશ પણ ખાણીયા કુંભાર તરીકે ઓળખાય છે.

પાલીતાણા કુંગર પાસે બોદાના નેસની નજીક સાલા—સુરાની સમાધીઓ આવેલી છે. અને આજે ત્યાં દુધ રેજના સાધુ સેવા પુજા કરે છે.

## માહિતીદાતા

- (૧) લખમણ સીયા ઉ.વ.૭૫ માનખેતરા સત્સગી
- (૨) બારોટ કાનજી હીરજી રે. જુનાગઢ ઉ.વ.૭૩
- (૩) કલ્યાણદાસ મેસવાણીયા રે. મેંડરડા , ભજનિક ઉ.વ. ૫૨
- (૪) નારદબાપુ રે મુંજુયાસર તા. બગસરા ઉ.વ. ૫૫ જગ્યાના મહંત

## હીરાભગત—મેખાટીબી ,તા.ઉપલેટા ,જ.રાજકોટ

રાજકોટ જલ્દીનાં ઉપલેટા તાલુકથી પશ્ચિમ દિશામાં આઈ—કિમીનાં અંતરે વેણુ નદીને કંઠે ઓક નેસ હતો. એ નેસ એ સમયમાં મેખડીના ટીબા તરીકે ઓળખવામાં આવતો. આ નેસમાં રબારી માલવધારી જ્ઞાતિનોવસવાટ હતો. આ નેસમાં રબારી જ્ઞાતિના ભારાઈ અટક ધરાવતા એક હીરા ભગત થઈ ગયા. તેઓ ત્રણ ભાઈઓહીરાભગતન । મોટાભાઈનું નામ રૂપો હતું. અને નાનાભાઈનું નામ રાણો હતું. ત્રણો ભાઈઓ આર્થિક સમૃદ્ધ હતા. બસો બેસો, ગાડ ૨, બકરા પાંસસો વિધાક જમીન અનેક નોકર ચાકર પણ હતા. હીરાભગતને આ બધામાં રસ નહોતો. પૂર્વ જન્મના પ્રતાપે એમને તો ભજન કીર્તન સાધુ સાથે સત્સંગમાં જ રસ હતો.

અક સમયે હીરાભગત વેણુ નદીના કંઠેથી પસાર થતા હતા. ત્યારે એમની દૃષ્ટિ એક સમાધિસ્થસંત ઉપર પડી. હીરાભગત ઉભા રહી ગયા. અને મનમાં થય કે, સાધુ પાસે માળા બેરખો કંશું જ નથી તો ભજનકઈ રીતે કરતાં હશે. સાધુએ સમાધી છોડી ત્યારે હીરાભગતે પોતાના મનની મુંજવણ રજુ કરી ત્યારે સાધુઅચ્યલાનંદજી જ ગિરનારમાં રહેતા અને આજુબાજુના પ્રદેશોમાં પરિબ્રમણ કરતા એમણે કંશું આ ભજન યોગના માધ્યમથી ભજન થઈ શકે છે. આ સાંભળી હીરાભગતે તો આધ્યામિકતામાં રસ હતો જ એમાં મહાત્માઅચ્યલાનંદજનો મેળાપ થતાં એ વધુ રાજુ થયા. અને એમની પાસેથી યોગવિદ્યા શીખવા પ્રયત્ન કરવા લાગ્યા. મહાત્મા અચ્યલાનંદજી હીરા ભગતે યોગક્રિયાઓનું જ્ઞાન શીખવે છે. મહાત્મા ચાર્તુમાસ ગાળી ત્યાંથી જતા રહે છે. પછીથી હીરાભગત ત્યાં કુટિર બનાવી રહે છે. અને મહાત્માએ બતાવેલ માર્ગ મુજબ યોગક્રિયાઓ અને ભજન કરે છે. ત્યારબાદ એક કુંભાર દંપતી નરેભગત અને દેવીબહેન આવે છે. અને સેવાકીય કાર્યોમાં પોતાને સામેલકરવા માટે વિનંતિ કરે છે. એ પ્રજાપતિ દંપતિને હીરાભગત અનુભૂતિ આપે છે, અને ત્યાં સંત સેવા ભુખ્યાનેઅન અને અતિથિને આશરો આપી લોકસેવાના કાર્યો શરૂ કરવામાં આવે છે.

હીરાભગત સતત ભક્તિમય પ્રવૃત્તિમાં રત રહે છે. આ સૂચિનું સંચાલન કરનાર કોઈ અગમ્ય શક્તિ હશે જ પરંતુ એની ખોજ માટે ભગત સતત આત્મખોજ કર્યા કરે છે. એમાં એક દિવસ સ્વર્જમાં ભગતને રામાપીર નો ઘોડો આકાશ માર્ગથી ઉત્તરી રહેલો દેખાયો. અને રામદેવપીરે જગ્યાએ કે, તારી ભક્તિને આગળ વધારવાં હું આવ્યો છું તું રણુજ્ઞા આવી અને મેખાટીબી લઈ આવ. હું તારી રક્ષા કરીશ.

હીરાભગતને સ્વર્જમાં રામાપીરના દર્શન થયા અને કદ્યા મુજબ રણુજ્ઞા જવાની તાલાવેલી મનમાં લાગ ।. આખરે જેઠ મહિનાના સમયગાળામાં રણુજ્ઞા જવા માટે હીરાભગત નીકળી પડે છે. રસ્તામાં કોઈ શ્રદ્ધાળુને ત્યાં જ મી લે વચ્ચે આવતાં દેવદર્શન કરતાં કરતાં રણુજ્ઞાનો પંથ કાપવા લાગ્યા. આખરે રણુજ્ઞા પહોંચીરામાપીરની સ માધીને દંડવત પ્રાણામ કરે છે. અને ત્યાં રોકાઈને સેવા સ્મરણ કરે છે. જ્યાં સુધી રામાપીર પોતાને પ્રગટ ન થાય ત્યાં સુધી ત્યાં રોકાઈને સતત સેવા કરે છે.

હીરાભગત રણુજ્ઞામાં રહીને રોજ રામાપીરની સેવા કરે છે. સ્વર્જમાં આવીને રામાપીરે કહેલી વાત ઉપર થી એમને અખૂટ શ્રદ્ધા છે. આ શ્રદ્ધાથી રામદેવપીરનું રટણ કરતાં કરતાં ત્રણ ચાર મહિના પસાર થઈ ગયાપરંતુ હીરા ભગત રામદેવપીરની શ્રદ્ધામાંથી ચલિત થતા નથી. આખરે પોતાની કાલીધેલી ભાષામાં રામદેવપીરન આરાધે છે. હું કોઈ પંડિત નથી. વિદ્ધાન નથી હું તો સામાન્ય માનવી હું તારી ભક્તિમાં મારી કોઈ ખામી રહી ગઈ હોય તો ક્ષમા કરજે. છેવટે ભગત અન્નજળનો ત્યાગ કરી રામાપીરનું ભજન કરવા લાગે છે. જ્યાં સુધીરામાપીર પ્રગટ થાય છે. અને કહે છે. ચાલ ઉઠ. હીરાભગત હું તારી સાથે મેદાટીબી આવું છું, અહીંથી એક ઘોડો લઈલે. આટલું કહી રામદેવપીર અર્દશ્ય થઈ ગયા. હીરાભગત જ્યોત અને ઘોડા લઈને ચાલતા થયા. થોડું ચાલ્યાઆખરે થાક લાગતાં પોતાની પછી પાથરીને ઉઘી આવી ગઈ. બરાબર આંખો ખોલીને જુઝે તો રાજસ્થાનથી સીધા એક રાતમાં પોતાના ગામ પહોંચી ગયેલા. ત્યાં પોતાની જગ્યામાં જઈને રામાપીરના ઘોડાની અને જ્યોતની સ્થાપના કરે છે.

રણુજ્ઞામાં તુવરા રાજપુતોન ખબર પડે છે કે, મંદિરમાં રામાપીરનો ચાંદીનો ઘોડો અને જ્યોત નથી. બધાભેગા થઈને વિચાર કરે છે કે, નક્કી કાઠિયાવાડમાંથી આવેલા ભગત આ ચોરી ગયા હોવા જોઈએ. હીરાભગતન્યાં ઘણો સમય રોકાયેલા હતા. એથી ત્યાંના અમુક લોકો હીરાભગતનું સરનામું જગતા હતા. આખરે તુવરારાજપુતોએકાઠિ

યાવાડમાં હીરાભગતના ગામ તરફ પ્રયાણ કર્યું. અહીં મેખાટીબી હીરાભગતની જગ્યામાં આવીનેજુએ તો ઘોડો અને જ્યોત દેખાયાં એટલે તુવરા રાજપુતો એ ભગતને પૂછ્યું કે , તું આ ઘોડો અને જ્યોતરાણુજામાંથી ચોરી લાંધો છે. આ સાંભળી ભગતે કહ્ય 'મારો વાલો આપો આપ અહીં આવ્યા છે.હું કંઈ ચોરીલાવ્યો નથી. તમે જ એમને પુછી જુઓ. ત્યારે તુવરા રાજપુત કહે છે. એતો ચાંદીનો ઘોડો છે.એ કંઈ થોડો બોલે.તુવરા રાજપુતોએ ઘોડાને ઉપાડવાનો પ્રયત્ન કરે છે. ઉપાડનાર ચોટી જાય છે. પણ ઘોડો ઉપડતો નથી. આખરેતુવરા રાજપુતો હીરાભગતની ભક્તિને ધન્યવાદ આપી ચાલ્યા જાય છે. પછી તો હીરાભગત ત્યાં મંદિર બંધાવેછે.અને રામદેવપીરનો મંડપ કરે છે. અને ધામધૂમથી ઉત્સવો ઉજવે છે.

મેખાટીબી રામદેવપીરનું મંદિર બનાવી હીરાભગતે સેવાનું કેન્દ્ર બનાવેલું અને ભુખ્યાને રોટલો રોગીઓની સેવા ચાકરી ભજન કીર્તન ઉપદેશ પાટ પ્રસાદીમાં પોતાનું જીવન અર્પણ કરેલું આવી પ્રવૃત્તિ કરતાં કરતાંહીરાભગત ની ઉમર એંસી વર્ષની આસપાસ પહોંચી ગયેલી એમની હાથની આંગળીઓ દર્દીની સેવા કરતાંકરતાં ખવાઈ ગયેલી છતાં એમાં એ આનંદ માનતા.આખર પોતાનો સમય પુરો થતાં એ જીવતાં સમાધી લેવાનો નિર્ણય જાહેર કરે છે. સંવંત ૧૮૮૮ના ભદ્રવા સુદુર ૧૧ ના દિવસે હીરાભગતે સમાધી લેવાનું નક્કી કર્યું અને એ પ્રમાણે તૈયારીઓ થઈ ગઈ.રબારી સમાજમાં લોકો અને આજુબાજુના ગામડાનો ભક્તવર્ગ એકત્રિત થયો.વાજતે ગાજતે હિરાભગતનું ગામમાં સામૈયું કર્યું સમાધી માટેનો ખાડો ખોદવામાં આવ્યો હીરાભગત સ્નાન કરી સફેદવસ્ત્ર પહેરી માથે લીલુ કપડુ બાંધી ખંબે તુંબડી ધારણ કરી ખાડામાં ઉભી ગયા હાજર સૌ કોઈને લોકસેવા અને રામદેવપીરની સેવા કરવાનો ઉપદેશ આપી સમાધીમાં બેસી ગયા , અને ખાડો પુરી દેવામાં આવ્યો. અને તેનીઉપાર સોડ બનાવવામાં આવી.અને હીરાભગત જીવતાં અને સમાધિસ્થ થયા પછી અનેક પરચા આપેલ હોવાથી પીર તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ એમની સમાધીની પૂજા થાય છે. અને મેખાટીબી ગામમાં બીજ પૂનમનાં ઉત્સવો થાય છે. હીરાભગતની જગ્યાને જાગ તું પીરાણું તરીકે ઓળખવામાં આવે છે.

#### માહિતીદાતા

- (૧) જાગતુ પિરાણુ હીરાભગત.લ. ગેબીદાસ વિરદાસ દેશાણી
- (૨) જશા મેધાભારાઈ મેખાટીબી ઉ.વ.૭૮
- (૩) અશોકભાઈ બાવાજી મેખાટીબી ઉ.વ.૪૫
- (૪) ગવાભાઈ બાવાજી જેતપુર ઉ.વ.૫૦
- (૫) કનુભાઈ બાવાજી મેખાટીબી ઉ.વ.૫૨

#### માંડાભગત

માંડાભગતનો જન્મ બાંટવા પાસેના ભલગામમાં થયેલો તેમની માતાનું નામ રૂડીબેન અને પિનાનું નામ રૂડાભાઈ હતું. એમનો બાલ્યકાળ પોતાના ગામમાં જ વિતેલો અને પાંચ ધોરણ સુધીનું શિક્ષણ પણ ત્યાં જ લીધેલુ. ત્યાર પછી બાંટવા આવીને વસેલા અને બાટવાના રેલ્વે ફાટકમાં ચોકીદારની નોકરી મળેલી.

રેલ્વે ફાટકમાં નોકરી કરતાં કરતાં પોતાનામાં રહેલી ધાર્મિક ભાવનાના કાર્યમાં પણ જોડાતા. બાંટવામાં આવેલા રામદેવપીરના મંદિરે દર પુનમે સાકરની પ્રસાદી લઈને મંદિરે જતા અને ભજન સત્સંગમા રસ લેતા. આ સત્સંગને કારણે સારંગ પીપળીના વિરદાસજી કાળીદાસજી મેસવાણીયા પરિચયમાં આવતા એમને ગુરુપદે ધારણ કર્યા.

માંડા ભગતના લગ્ન ગરચયર કાળાભાઈ ના દીકરી રાજીબેન સાથે થયેલા.પરિવારમાં તેને બે દીકરા મેરા મણાભાઈ અને જેઠાભાઈ અને ત્રણ દિકરીઓ ધાનીબેન ,રતીબેન અને અમરીબેન છે.

ભગત બાટવાથી બે ત્રણ કિમી દૂર આવેલા રેલ્વે ફાટકમાં નોકરી કરતા.આ સ્થળ અંતરિયાળ હોવાથી પાણી મળતું નહીં.અને વળી આ સ્થળ પાસેથી આઈ દસ ગામનો માર્ગ પસાર થતો.અને એ સમયમાં વટેમાર્ગુઓ ચાલીને જતા. ભગતે વટેમાર્ગુઓની સુવિધા માટે પાણીનું પરબ બાંધેલું પોતે દૂર કાવડથી પાણી ભરી લાવી તરસ્યાની તરસ

છીપાવી સેવાકાર્યની શરૂઆત કરી. સાથે સાથે આ સ્થળ ઉપર આવતા સાધુ સંતો ને હાથે રસોઈ બનાવી જમાડતા. કોઈ ગરીબ સાધુ આવે તો અને વસ્ત્રો પણ આપી દેતા.

માંડાભગતના સમયગાળામાં ઈન્દ્રામાં પરબના સેવક રતનમા રહેતા અને તે આયુર્વેદિક દવા બનાવતાં. ભગતને તેનો પરિચય થયો. અને દેશી દવા બનાવવાનું ભગત એમની પાસેથી શીખેલાં અને પોતાના ખર્ચ દવાભનાવી મિબમાર લોકોની સેવા કરતા. દવા બનાવવાની આ પદ્ધતિ પરબના સંત દેવીદાસબાપુના સમયથી એમના શિષ્યોમાં ઉત્તરી આવેલી. અને એ પદ્ધતિ ભગતન સાંપડેલી ભગત દર્દીને પોતાને ત્યાં રાખતા અને એની દાવા ચાકરી કરી સાજા કરી ઘરે પરત મોકલાતા.

માંડાભગત રામદેવપીરના પરમ ઉપાસક હતા. રામદેવપીરના પાઠ પ્રસાદીનું વાચક આવતા. ત્યાં અચૂક હાજરી આપાતા. અને ભજન સત્સંગ કરતા એવામાં એક દિવસ એવું બન્યું કે લલગામમાં રામદેવપીરનો પાઠહતો. ભગત ત્યાં ગેયેલા અને તે સમયે ભગતની ફાટક ઉપરની નોકરી પણ ચાલુ હતી પરંતુ પાઠનું વાચક આવતાંભગતે ત્યાં ફરજિયાત હાજરી આપવાની હતી. એટલે ભગત પાઠના વાયકનું પાલન કરવા ત્યાં ગયા. પાઠમાંજ્યોત વળે પ્રસાદ વહેંચાય પછી ગત છૂટી પડે. પરંતુ જ્યોત વળવામાં મોહુ થયુ. અને રેલ્વે ફાટકે ટ્રેન આવવાનો સમય થઈ ગયો. એ સમયે રેલ્વે બાબુ ત્યાં ચેકીંગ કરવા આવેલા. ત્યારે ભગવાને ભગતનું રૂપ લઈને ફરજનિભાવેલી. ભગત પ્રમાણિક અને નિષ્ઠાવાન હતા એટલે પોતે ફરજ ઉપર હાજર ન હતા તેની માઝી માંગવામાટે રેલ્વે બાબુ પાસે ગેયેલા. ત્યારે રેલ્વે બાબુએ જણાવેલું કે, હું ચેકીંગમાં આવેલો ત્યારે તમે ફરજ ઉપર હાજર હતા. અને આ રજીસ્ટરમાં તમારી સહી પણ છે. ત્યારે ભગતને ખાતરી થઈ કે, પોતાનું કામ ભગવાને કરેલું.

ઉપરોક્ત ઘટના પછી ભગતને સંસાર જીવનમાં બહુ રસ રહો ન હતો. આખરે કુંટુંબ પરિવારનો ત્યાગ કરી દરકા દર્શને જતી સાધુની જમાતમાં ભળી ગયા. અને ત્યાંથી પરત ફરી ગિરનારમાં ગયેલા. ત્યાં આઠ મહિના રહ્યા અને ફરી જમાત સાથે દારકાની યાત્રાએ જતા રહ્યા. ત્યારે બાંટવા ગામના મેરામણભાઈ કરમટા અને ગોવિંદ રામબાપુએ સાધુની જમાત અને ભગતને સમજાવ્યા કે ભગત સંસારી છે. એને પરિવાર છે. એમણે ભજન કરવું હોય તો સંસારમાં રહીને કરે એટલે કુંટુંબ પરિવારને પણ સાંત્વના મળે. આ સમજાવટની સાધુની જમાતે ભગતને મુક્ત કર્યા. અને ભગત પણ માની ગયા. પરંતુ જીવનભર એમણે ફરી સંસારમાં ધ્યાન આપ્યું ન હતું. ગામમાં રહી સાધુ સંતો અને રોગીઓની સેવા કરી.

માણાવદર તાલુકાના એકલેરા ગામના એક હરીજન યુવાનને રક્તપિત થતાં એમના કુંટુંબીજનોએ એનો ત્યાગ કરી દીધેલો. ભગતે તેનો સ્વીકાર કરી સેવા ચાકરી કરી સાજો કરેલો. આ રીતે લોકસેવા કરતાં કરતાં ભગત બ્રહ્મલીન થયા અને હાલમાં બાંટવાની નજીક ચારણ્યું આઈનાં મંદિરના પટાંગણમાં સમાધી આવેલી છે. ભગતના ગયા પછી પણ બાંટવાના લોકો ભગતની સમાધીની પૂજા કરે છે. અને ભગતમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે. ઈ. સ. ૧૯૮૭ માં ગુજરાતમાં લયંકર હુઝાળ પડેલો અને પાણીની તીવ્ર તંગી વર્તાતી હતી. એવા સમયે શ્રદ્ધાળુઓએ ભગતનું સમાધીની નજીક પાણીનો બોર કરાવ્યો અને રૂપ કુટ બોર કરતા પુષ્કળ પાણી આવેલું આજે પણ બાંટવા નગર પાર્ચિ લક્ષ દ્વારા એ બોરનો ઉપયોગ કરી ગામને પાણી પૂરું પાડવામાં આવે છે.

ભગતની હ્યાતીમાં એમના સત્સંગી મંડળમાં રાજીભગત વિલાસપુરવાળા, બચુભગત બાંટવાના અને દેવાયતભગત ગરચરનો સમાવેશ થતો. પોતાનું સમગ્રજ્ઞાન એમણે બચુભગતને આપેલું.

### માહિતીદાતા

- (૧) ધાનીબેન નાથાભાઈ ગરચર ઉ.વ.૫૫ બાંટવા (ભગતના દિકરી)
- (૨) રામભાઈ કાનાભાઈ રાડા ઉ.વ.૩૪ નોકરી બાંટવા
- (૩) કોડિયાતર પુંજાભાઈ સાંગાભાઈ ઉ.વ.૪૫ તલાટી મંત્રી
- (૪) રાજુભાઈ બચુભાઈ મોરી ઉ.વ.૪૦ બાંટવા રીક્ષાચાલક

## વાધાબાપુ નડાળા

પાળિયાદમાં પાતામણ બાપુ રહેતા. એમને એક સાધુ ચંદનનાથનો પરિચય થયો. પાતામણ બાપુને પુત્ર ન હતો. પરંતુ ચંદનનાથના પ્રતાપે એમને ત્યાં પુત્રનો જન્મ થયો એનું નામ વિસામણ. એ વિસામણના શિષ્ય વાધાભગત.

વાધાભગત વિસામણ ભગતના શિષ્ય થયા પછી દરરોજ સાંજ પડ્યે પાળિયાદ સત્સંગ ભજન માટે જતા. શિયા જો ઉનાળો કે ચોમાસુ કોઈ પણ ઋષુ હોય. પરંતુ વાધાબાપુ પાળિયાદ જવાનું ચુક્તા નહીં. અને એ એનુંનીમ હતું. નડાળાથી પાળિયાદ જવામાં રસ્તામાં ત્રણ નદીઓ આવતી ઉડવો, સુખ ભાડર અને ગોમા આ ત્રણેનદીઓ ભગત ને રસ્તો આપી દેતી.

વાધાભગત પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા. દેશી રજવાડાનો યુગ હતો. અને ગામમાં દરબારોનો હુક્ક મ ચાલતો, એટલે એ વખતના નડાળા ગામના ગરાસદાર દરબાર આપા લખધીરના વંશજો હુક્કમ કર્યો ક, અમારી ભેંસો દોહી ને જ ભજનમા જવાનું ત્યાં સુધી જવાનું નહીં ભગત ઘરે છે કે નહીં તેની તપાસ કરવા માટે દરબાર પોતા ના માણસને મોકલેલ તો ભગત ઘરે હતા. ભેંસો એ દોહવા દીધું નહીં દરબારે વધુ તપાસ કરી એટલે કોઈએ કહ્યું ભગત તે સમયે પાળિયાદ હતા. એટલે બીજા દિવસે સવારે દરબારે ભગતને રૂબરૂ પૂછ્યું કે, ભેંસોએ દોહવા ન દાખું ત્યારે તમે કયાં હતા? ત્યારે વાધાભગતે કહ્યું કે સમય થૈ જતાં હુતો પાળિયાદ જતો રહેલો એટલે દરબારે ભગતને કહ્યુંકે, મારી રજા વિના પાળિયાદ કેમ ગયા? અને દરબાર ગુસ્સે થઈ ગયા. અને ઘોડાની લગામના ચોકઠાના ભગતના વાંસામાં થા કર્યો. આ ઘટના ભન્યા પછી બીજા દિવસે પણ ભગત દરબારની રજાલીધા વિના પાળિયાદ ગયા. પાળિયાદ પહોંચ્યા ત્યારે આપા વિસામણે ભગતને પૂછ્યું. ભગત મારા વાંસામાં કંઈ વાગ્યું છે જુએ તો ભગતે જોયું તો વાગ્ય નાનું નિશાન હતું. આ ઘટના પછી વિસામણ બાપુએ નડાળાના દરબારને સાપ આપેલો કે, જ ગામમાં મોટો ભાગદાર છે. જેની ડેલાએ ડાયરાઓ ભરાય છે. ત્યાં કાગડા ઉડશે. મેડી અને ઝરુખા છે. ત્યાં પડીને પાદર થશે. જે ગામનો માટો ભાગદાર છે. તેને વીધો જમીન નહીં રહે. અને રસ્તે રજીષતા થઈ જશે. અને આગળ કહ્યું, કે બાપ દીકરો ઘોડા વાડ ભેગી નહીં કરે. આ પરિસ્થિતિચનું નિર્માણ થતાં આપા વિસામણ પાસે માંજી માંગી દરબારે સાપનું નિવારણ કર્યું પરંતુ એ દરબારો ગામ મૂકીને જતા રહ્યા.

એક વખત વાધાભગતને ઘરે સોનગઢના સંત આવેલા તે સમયે દુઃખાળ હતો. ભગતના ઘરે કંઈ દુઝણું પણ ન હતું. વાધાભગત વાડીએ જઈ મુળાની મોગરીઓ લઈ આવ્યા. એની ભાજી બનાવીને સંતને જમવા આપ્યું. આ જોઈ સંતે પૂછ્યું ભગત દુઝણું નથી? વાધાભગતે કહ્યું ના બાપુ નથી, ગામનું ધણ ચાંદું છું મારે ગાયો નથી. આસાંભળી સંતે ગામની પણ્ણિમ દિશામાં વાડો બાંધવા કહ્યું. ભગત કહે મારે ગાયો જ નથી તો વાડો બનાવી શું કરું? સંતે પરાણે વાડો બંધાવો, અને વાધાભગતના ઘરે ભજન રાખ્યા, સંતે સવારે ચાર વાગ્યે ભગતને કહ્યું વાડામાં ગાયો ભાંબરે છે. ત્યાં જઈને જુએ તો દુઝણી ચાર ગાયો હતી. આ પરચો આપા ગોરખાનો હતો.

કાળજીમે ભક્તિ કરતાં કરતાં વાધાભગત જીવનલીલા સંકેલી લીધી અને ભગતને ધામધૂમથી સમાધી આપ વામાં આવી એ સમાધી નડાળા ગામની પણ્ણિમ દિશામાં આવેલી છે. તેના વંશજોના ૭૦ જેટલાં કુંઠુંબો કરાડી, ન ડાળા, છૈડા અને ગોરૈયા ગામમાં વસે છે.

### માહિતીદાતા

- (૧) બહેચરભાઈ ભુરાભાઈ રોજ્યા, ઉ.વ.૪૫ નડાળા
- (૨) રણછોડભાઈ બહેચરભાઈ ઉ.વ.૨૨ નડાળા
- (૩) મેરુભાઈ થોભાણાભાઈ ઉ.વ.૨૫

## સંતશ્રી સંગ્રામબાપા

સંતશ્રી સંગ્રામબાપાનો જન્મ સાયલા તાલુકાના ચોરવીરા ગામે પિતા સુખાભાઈ અને માતા જશીબેનને ત્યાં આજ થી. કૃપ વર્ષ પૂર્વ થયેલો એમની અટક ભાંગરા છે. તેઓ બાલ્યકાળમાં થોડું ધાર્યું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાના પિતાના. યવસાય ખેતીકામમાં જોડાયા. સંગ્રામ ભગત ઉમર લાયક થતા એમનું લગ્ન વીણા બહેન સાથે થયેલુંઅં લગ્નજીવન થી એમને ત્રણ પુત્રો હીરાભાઈ, જાલાભાઈ, જગાભાઈ થયેલા. સંગ્રામભગત થોડું ધાર્યું ભણેલા એટલે ખેતી ઉપર આધાર ન રાખતા ખેતીમાં ઉપયોગમાં દેવતા ફિરીલાઈજર ખાતારની એજન્સી પણ કરેલી. આરીતે આર્થિક પગભર હતા. બાલ્યકાળથી જ સંગ્રામ ભગતનું મન રામદેવપીરની ઉપાસના તરફ વળેલું એટલેએમણે દેવપરાના જીવરા મ નામના સાધુને ગુરુ ધારણ કરેલા. અને ભક્તિ કાર્યમાં સતત મજન રહેતા. એ સમગ્રગાળામાં રામામંડળ શરૂ થયું એ મા એ રામદેવપીરનું પાત્ર ભજવતા અને આ રામામંડળમાં એમણે રર વર્ષ સુધી અભિનય કર્યો. આ અભિનયથી જ એમનામાં સંતત્વના બીજ રોપાયા એટલુ જ નહીં. પરંતુ એ પૂર્ણ ભક્તિમયબની ગયા.

તા.૦૩ –૦૩ –૧૯૯૮નાં દિવસે સંગ્રામબાપા ભર ઉધ માણી રહ્યા હતા. ત્યારે અને ગેબી અવાજ સં ભળાયો 'તુ અહી આવ, અહી આવ' ઊધમાંથી બહાર નીકળી જાય છે ત્યાં એક અવધૂત જેવા યોગ્ય દેખાયા. આ યો ગી એમને ગામની પણિબમ દિશામાં દોરી ગયા અને એક સુંદર ટેકરી બતાવી કહ્યું અહી જગ્યા બાંધી રહે, અને ભૂખ યા દૂધ્યાની સેવા કરજે, એટલુ કહી એ સાધુ અર્દશ્ય થયા. તે દિવસથી સંગ્રામબાપા ઘર છોડી ટેકરી ઉપર વસવાટ ક યો. દીમેદીમે રામદેવપીરનું સુંદર મંદિર બંધાવ્યું, બોજનશાળા બંધાવી, ગૌશાળા બંધાવી વિશાળ જગ્યા બાંધી લોકસે વાના કાર્યમાં સતત પ્રવૃત્ત થયા. આજે એમણે બાંધેલી ગૌશાળામાં દોઢસો જેટલી ગાયો છે. આ ગાયોના દુધમાંથી છાસ બનાવી આજુબાજુના ગામડાના ગરીબ લોકોને મફત આપી દે છે, પક્ષીઓને ચણ નાખે છે. કૂતરાને રોટલા ના બે છે. કીડીયારું પૂરે છે. અને આવતા જતા લોકો માટે અન્નક્ષેત્ર ચલાવે છે.

સંગ્રામ ભગતની ભક્તિ અને પ્રભુસેવા જોઈ આજુબાજુના પંથકના જુદી જુદી જ્ઞાતિના ૨૦૦ જેટલા શિઝ યો છે. આ સહુ સાથે મળી બીજ પૂનમ, રામદેવપીરના નોરતા જેવા ઉત્સવો જગ્યામાં ઊજવે છે. નિઃસતાન દંપત્તિ આ ભગતની માનતા માને છે. અને સંતાન પ્રાપ્તિ થતા ત્યાં જન્મેલા બાળકની તસ્વીર પણ જગ્યામાં મૂકે છે. એવી ત સ્વીરોથી એક આખો હોલ ભરાયેલો છે. યાત્રાળુઓની પણ આ જગ્યામાં ખુબ ભીડ રહે છે. પાંછઠ–સિતેર વર્ષની ઉ મર ધરાવતા સંગ્રામબાપાનું વ્યક્તિત્વ શાંત અને સૈચ્ય છે. ચહેરા ઉપર આનંદતિ શાંતિ સૌ કોઈને શાંતિ પમાડે એવી દૃશ્યત થાય છે. ગૌ–સેવા, અને માનવ સેવામાં પોતાનો આનંદિત સમય વિતાવે છે. ત્રણચાર કિમીના અંતરે આવે હું હોવા છતાં ગૃહત્યાગ કર્યા પછી વરે ગયા નથો. સમગ્ર વ્યક્તિત્વ સંતને શોભે તેવું છે. આખરતો કહેવાયું છે કે, શાંત પમાડે એ સંત એ સૂત્ર એમની મુલાકાત લેનારને સાર્થક થયેલું લાગ્યા વિના રહેતું નથી.

રૂબર મુલાકાત

સંતશ્રી સંગ્રામબાપા, ઊ.વ.૫૦, ચોરવીરા, તા. સાયલા, જિ.સુરેન્દ્રનગર

## જાલાભાપા, મેસરીયા

સૌરાષ્ટ્રના સુપ્રચિદ્ધ સંત જલારામબાપાના પૂર્વઅવતાર ગણાતા, આપા જાલા વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં સાંબદ્ધશાખના રબારી કુંઠુંબમાં થયેલા. બાલ્યકાળથી પરંપરાગત પશુપાલનનો વ્યવસાય તેઓ કરતા. ગામના પાદરમાં ઉદાલમુનીનો આશ્રમ હતો. ત્યાં સતસંગમાં બેસી જાય. બપોરના સમયે આંબલીના ઝડ નીચે ગોવાળો સાથે કોડીઅ રમવા લાગે. સાંજ એ કોડીઓ આંબલીના થડ નીચે દાટી દે.

જાલાભાપા યુવાન થતાં એમના લગન ચોટીલા તાલુકાના મોરસલ ગામે ખાંબલા અટકના રૂપામા સાથે થયે લા. રૂપામા પણ સંસ્કારી અને ભક્તિ પ્રદાન વ્યક્તિત્વ ધરાવતા હતાં. એટલે બંને દંપત્તિ ઉદાલકમુનિના આશ્રમે ભજન , કીર્તન અને સત્સંગ માટે જતા. જાલાભાપા રૂપામા અને જટાશંકરને રોકાઈ જવા અને સવાર થતાં જવા માટે આપા રતાએ ખૂબ સમજાવ્યા એટલે ગુરુની આજા માની જાલા ભગત અને રૂપામા રોકાઈ જવા સહમત થય ૧. પરંતુ જટાશંકર ખુબ આગ્રહ કરવા છતાં રોકવા માટે સહમત ન થયા. અને કહેવા લાગ્યા હું ગરીબ બ્રાહ્મણ વહેલી સવારે ગામમાં લોટ માંગવા માટે મારે જવું પડ, અને ત્યારે જ છોકરા રોટલા ભેગા થયા. જટાશંકર ઉક્ત મજબુરી એ ને રોકવાની ના પાડતી હતી. આખરે એ પોતાના ગામે જવા રવાના થયા.

આપા રતાના શિષ્ય જટાશંકર રાત્રે મોલડીથી મેસરીયા પરત ફરી રહ્યા હતા. ત્યારે જાલાભગતના ભાઈઓ ઝડી જાખરીમાં છુપાઈને બેઠા હતા. જાલાભગત અને રૂપામાને બદલે માત્ર જટાશંકરને આવતા જોયા. અને જાલાભગતના ભાઈઓનો કોષ પરાકાષ્ઠાએ પહોંચ્યો, જટાશંકર આવતા જોઈને એના ઉપર તૂટી પડ્યા. આ બ્રાહ્મણ પણ એની સાથે છે. એટલે ત્રણ ચાર જણ ધોકા લઈને તૂટી પડતા જટાશંકરનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું.

સવાર પડતા આપા રતાએ પોતાના શાનથી જોયું તો એમને બ્રાહ્મણનું મૃત્યુ થયાનું જણાયું એટલે આપારતા એ જાલાભગતને કહ્યું કે , તારા ભાઈઓએ બ્રહ્મ હત્યા કરી છે. એના તેના ભાઈ તરીકે બ્રહ્મ હત્યાનું પાપતને પણ લાગ્યું કહેવાય. આ સાંભળી જાલાભગત મુંજવાણ અનુભવવા લાગ્યા. આખરે આ પાપમાંથી છૂટવામાટેનો ઉપાય રતા આપાને પૂછ્યો. એટલે રતા આપાએ ઉપાય જણાવ્યો કે, આ પાપમાંથી છૂટવા માટે તારે જીવતાંસમાદી લેવી પણ કે. આ સાંભળી જાલાભગત કહેવા લાગ્યા. જીવતા સમાદી લઈ શકું એ કક્ષાએ મારી ભક્તિનીપરિપક્વતા અને સમર્થ નથી ગુરુએ કહ્યું એ હું આપીશ. પરંતુ તારે આ પાતકમાંથી ઉગરવું હોય તો સમાદી લેવી જ પડશે. આપારત એઆશીર્વાદ આપતાં જાલા ભગતમાં દિવ્ય સંચાર થયો ; અને સમાદી લેવાનો સંકલ્પ ગામમાં જાહેર કર્યો.

જાલા ભગતે સમાદી લેવાની જાહેરાત કરતાં આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ. એમના ભાઈઓને પણ ખબર પડી. એટલે પસ્તાવવાના સ્વરૂપે એ માફી માગવા આવ્યા. ગામ આખું સમાદી ન લેવા માટે વિનંતિ કરવા લઇયું. પરંતુ જાલાભગતે લીધેલો નિર્ણય અફર રાખ્યો અને સમાદીનું સ્થળ પસંદ કર્યું. સમાદી લેતી વખતે જાલાભગતે એના કુટુંબ પરિવારને સાપ આપ્યો કે , મેસરીયામાં સાંબદ અટકના રબારીઓ સુખે રહી નહીં. શકે. એક ભાઈ સાજો હશે તો એક ભાઈ ગાંડો હશે. આ વાત સાંભળી બીજા કુટુંબીજનો વિનંતિ કરવા લાગ્યા કે, અમેતો નિર્દોષ છીએ. બધાને શા માટે સાપ આપો છો ? ત્યારે આપા જાલાએ કહ્યું કે સાપ તો અપાઈ ગયો છે પરંતુમારો પૂન : જન્મ વિરપુરમાં જલારામ તરીકે થશે અને મારી વીસ વર્ષની ઉમરે ત્યાં મેળો ભરાશે એ મેળામાં તમારા સાપનું નિવારણ થશે.

જાલાભગતે પોતાની સમાદી તૈયાર કરાવી જ્યાં સમાદી લેવાની તૈયારી કરે છે , ત્યારે રૂપામા પણ પોતાનોનિર્ણય જ જણાવી દે છે કે , મારે પણ સમાદી લેવી છે. ત્યારે સૌ મુંજાયા . સમાદી માટે માત્ર એક જ ખાડો ખોદાયેલ એટલે અખરે કહ્યા પછી બંને દંપત્તિએ મેસરિયાના પાદરમાં જીવતા સમાદી લીધી.

સમાદી લીધા પછી જાલાભગતે વિરપુરમાં જલારામ તરીકે જન્મ લીધો. અને ૨૦ વર્ષની ઉમર થતા એ મસરિયા આવેલા ત્યાં જાલાભગતની સમાદી સામે ઉભા રહીને દાંત કાઢે છે. એ સમયે હાજર રહેલા સૌ લોકો વિસ્મય અનુભવે છે કે , સમાદી સ્થાને તો વંદન કરવાના હોય દાંત કાઢવાના ન હોય એટલે જલારામબાપાએ જણાયું કે , આ સમાદી મારી આગલા અવતારની છે. ત્યારે લોકો માનવા માટે તૈયાર થતાં નથી એને કહે છે કે , પ્રમાણે આપો તો તમારી વાત અમે સ્વીકારીએ ત્યારે જલારામબાપાએ કહ્યું કે, પેલું આંબલીનું ઝાડ દેખાય છે તેનાનીચે ખોદકામ કરો ત્યાં અમે બાલ્યકણમાં કોડીએ રમતા એ દાટેલી છે. ત્યાં ખોદકામ કરતાં કોડીએ નીકળી પછીબીજુ પ્રમાણ એ આખ્યું કે ગમના એક વેપારીને ત્યાં સાંઠેક રૂનું નામું આગલા જન્મનું હતું એ વેપારી પાસે જઈ ચોપડા ખોલાવી એ નામું ભર્યું. આ બંને પ્રમાણો આપી જલારામ બાપા વિરપુર જવા માટે રવાના થયા ત્યારે એમને વિદાય આપવા માટે આખું ગામ વાજતે ગાજતે વળાવવા માટે નીકળી પડેલું. વિરપુર જઈને જલારામ બાપા મેળો કરે છે ત્યારે મેસરીયા ગામના સાંબદશાખના રબારી કુટુંબો ત્યાં જાય છે. અને આગલા અવતારના સાપનું નિવારણ કરે છે, અને કહે છે કે, અહીંથી ચાલતા ઢોરા ઉપર ઘણ મળશે એ દિશામાં જશો એક પરિવાર ત્યાંથી જસદણ તરફ ગયો આ હું: ખી પરિવારને જોઈ જસદણના રાજાએ કારણ પૂછ્યું ત્યારે એમના પરિવારમાં જાલાભગત થયા. અને તેના સાપને કાર

શે દુઃખી હોવાનું જણાવ્યું. ત્યારે રાજાએ કહ્યું ,આ રીતે ભરકતાક્યા જશો. ત્યારે પેલા પરિવારે જવાબ આપ્યો હરિ લઈ જાય ત્યાં. આ સાંભળી જસદણના રાજાએ એમને આશરો આપ્યો એ પરિવાર આજે પણ જસદણ વસવાટ કરે છે. અને જાલાભગતની જગ્યાએ એમના દ્વારા ઘજા ચડે છે.

જાલાભગતની સમાધીની પૂજા શરૂઆતમાં ગામ કરતું પછીથી વડવાળા મંદિર દુધઈ દ્વારાએ જગ્યા સંભાળવામાં આવી , અને ત્યાં વીરદાસજી ગુરુ સેવાદાસજીએ જગ્યા સાંભળી એ જ પરંપરાના મનોહરદાસ બાપુ , જાણારામ બાપુ , અને હાલમાં બંસોદાસબાપુ આ જગ્યા સંભાળે છે હાલમાં આ જગ્યામાં ગૌશાળા છે. અન્નક્ષેત્રચાલે છે ઉત્સવ થાય છે. ભજનના કાર્યક્રમો થાય છે. અને જાલાભગતના દર્શનાર્થી જ્ઞાતિના ભેદભાવ વિના અનેકલોકો દર્શનાર્થી આવે છે.

માહિતીદાતા

(૧) મગનીરામ જાણારામ ઉ.વ.ઉપ જગાના કોઠારી. મેસરીયા.

## દસનામ સંપ્રદાયના રબારી સંતો.

આ સંપ્રદાયની સ્થાપના આંધગુરુ શુક્રરાચાર્ય દ્વારા કરવામાં આવી. દસનામ આ સંપ્રદાયમાં આ પ્રમાણે બાતાવવામાં આવ્યા છે. પુરી , ભારતી , સરસ્વતી , ગિરી , પર્વત અને સાગર , વન અને આશ્રમ , અરણ્યઅને તીર્થ આદસ નામ ગણાય. આપરંપરામાં શીવ પ્રથમ આવે. પછી શ્રી હરિ ( આદિનારાપણ ) પછી બ્રહ્માત્યારબાદ વશિષ્ઠ , શક્તિ , પારાશરઅહી સુદ્ધી ઋષિઓ કહેવાતા. પારાશર ઋષિ મત્સ્યકંદ્યામાં મોહિત થયા ત્યાંથી બ્રહ્મનિષ્ઠ કહેવાયા. પારાશરના વ્યાસ , વ્યાસના શુક્રદેવજી , શુક્રદેવના ગોળપાદ , ગોળપાદના ગોવિંદચાર્ય અનેતેના શિષ્ય જગદ્દુરુ શંકરાચાર્ય. એમણે બોદ્ધર્ધમં સાથે સંદર્ભ કરી સનાતન ધર્મનો દિગવિજય મેળવ્યો એટલે દસનામ કહેવાયા. પછી શંકરાચાર્યનો ચાર મઠની સ્થાપના કરી. આ બાબતોને ટુંકમાં આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ.

## દસનામ સંપ્રદાય

- |                          |                                  |
|--------------------------|----------------------------------|
| ૧. સત્યુગના સંન્યાસી     | — શીવ , બ્રહ્મ , વિષ્ણુ          |
| ૨. ત્રોતાયુગના સંન્યાસી  | — શીવશક્તિ , પારાશર              |
| ૩. દ્વાપર યુગના સંન્યાસી | — વ્યાસ શુક્રદેવજી               |
| ૪. કણ્યુગના સંન્યાસી     | — ગોડ , ગોવિંદચાર્ય , શંકરાચાર્ય |

ચાર દિશામાં આ સંપ્રદાયના ચાર મઠ સ્થપાયા.

- |           |              |
|-----------|--------------|
| ૧. પૂર્વ  | — ગોવર્ધન મઠ |
| ૨. દક્ષિણ | — શૃંગારી મઠ |
| ૩. પશ્ચિમ | — શારદા મઠ   |
| ૪. ઉત્તર  | — જોશી મઠ    |

આ ચાર મઠનો શાસ્ત્રીય પરિચય મેળવીએ.

પૂર્વમઠ	— ગોવર્ધન મઠ
વન	— અરણ્ય
સંપ્રદાય	— ભૌમવાર
દેવતા	— જનનાથ
દેવી	— વિમલા
તીર્થ	— મહોદદિ
વેદ	— ઋગ્વેદ
આચાર્ય	— પદ્મપાદ
બ્રહ્મચારી	— પ્રકાશ
ગોમ	— કશ્યપ

### ❖ દક્ષિણ શુંગોરીમઠ ,પુરી ,ભારતી ,સરસ્વતી

સંપ્રદાય	—ભૂરવાર
દેવતા	—આદિવરાહ
દેવી	—કામાક્ષી
વેદ	—યજુર્વેદ
આચાર્ય	—પૃથ્વી ધરાચાર્ય
બ્રહ્મચારી	—ચૈતન્ય
ગોત્ર	—ભુભુત

### ❖ શારદામઠ

સંપ્રદાય	—કિટવાર
દેવતા	—સિદ્ધેશ્વર
દેવી	—લપ્રકાલી
તીર્થ	—ગોમતી
વેદ	—સામવેદ
આચાર્ય	—સરૂપાચાર્ય
બ્રહ્મચારી	—પ્રકાશ
ગોત્ર	—અવિગત

### ❖ જોશીમઠ ,ગીરી ,પર્વત ,સાગર

સંપ્રદાય	—આનંદવાર
દેવતા	—નારાયણ
દેવી	—પુષ્પગીરિ
તીર્થ	—અલકનંદા
આશ્રમ	—બાદ્રિકા
વેદ	—અર્થવ
ગોત્ર	—લુગુ
બ્રહ્મચારી	—ચૈતન્ય
આચાર્ય	—નીરો તોટકાચાર્ય

આ સંપ્રદાયના ભાવાના નામ પણ બતાવવામાં આવ્યાં છે. દાત. દત્તપ્રકાશ ,સુર્યપ્રકાશ ,બેરવપ્રકાશ ,ચંદ્રપ્રકાશ ઉપરાંત ચાર ધૂણા ગોપાલ ધૂણા ,અજ્ય મેધધૂણા , દત્થધૂણા , અધર્વમુખીધૂણા તેના ચાર મહાવાક્યઅહમભ્રષ્ટ હ્યામાસ્મી , અપમહાભાગ્નિ , વત્સ્મીશ્વરિ , પ્રશ્નાનશ્વર સંન્યાસના પણ ચાર પ્રકાર છે. જેમ કે ,હંસ ,પરમહંસ , બોધક ,કુટ્ટિયર.

આ સંપ્રદાયના સાધુ અખાડાના સાધુ તરીકે પણ ઓળખાય છે. મુખ્ય સાત અખાડા છે.

૧. શ્રી પંચ દશનામ જુના અખાડા
૨. શ્રી પંચ આહવાન અખાડા
૩. શ્રી પંચ નિર્ણન અખાડા
૪. શ્રી પંચ અટલ અખાડા
૫. શ્રી પંચ આનંદ અખાડા
૬. શ્રી પંચ અર્જિન અખાડા
૭. શ્રી પંચ મહાનિવાર્ણ અખાડા

આ રીતે દસનામ સંપ્રદાયનો ટૂકો પરિચય મેળવ્યા બાદ આ પ્રસંપ્રદાયના રખારી સંતો વિશે આગળ વાત કરી એ.

## માહિતીદાતા

- ❖ મહંત શ્રી કિશોર બાપુ ,શ્રી આશાપુરા મંદિર ભવનાથ જુનાગઢ ઊ. ૬૦
- ❖ લીમગિરીબાપુ –ભવનાથ જુનાગઢ ઊ. ૬૫ અખાડાના સાધુ

## પુંજા ભગત (શંભુગીરીબાપુ –સોહમગિરી )ગાધકડા ,તા.સાવરકુંડલા

ગાધકડાની જગ્યામાં હાલ શંભુગીરી બાપુ અને સોહમગિરી માતા નાગા અખાડાના સાધુ છે. આ બંનેનીવાત કરતા પહેલા આ જગ્યાના રોમાંચક ઈતિહાસની વાત કરવી આવશ્યક જણાય છે. વિક્રમ સંવત ૧૨૭૫ આસોસુદ ૧૩ ના ત્રણ ત્રણ જીવની સાપને ખાતર આહુતિ અપાયાની આ વાત સાવરકુંડલા તાલુકાના કંટાસર ગામમાં પુંજા બાપાન ઠાકે નેસ આવેલો હતો. પુંજાબાપા મોમાઈ માતાજીના પરમ ઉપાસક હતા. શક્તિ હાજરા હાજરપુંજાબાપાની સાથે હતાં. પુંજાબાપા કોઈ વ્યવહારિક કામે બહાર ગામ જવા નિકળેલા. ઉટડી ઉપર બાપ દિકરીગાધકડા ગામે , પહોંચ્યા. ગાધકડાના પાદરમાં હુલજર નદીને કંઠે કોઈ નરાઘમ માનવીનો બેઠો થયો. અનેપુંજાબાપા પાસે દિકરી સોનલ અને એમની ઉટડીની માંગણી કરી આ સાંભળી પુંજાબાપાને રોમરોમ કાળ વ્યાપીગયો. પુંજાબાપાના મનમાં વિચાર આવ્યો કે આ નરાઘમો વધારે છે અને હું એકલો છું કદાચ ધીગાણામાં હું ખપી જાઉ તો મારી દિકરી અને ઉટડી નું શું થશે? પુંજાબાપાએ દિકરી સોનલની સામે જોયુ ત્યાં જ સોનલ પરિસ્થિતિપામી ગઈ. અને મોમાઈને યાદ કર્યા અને તરતજ જમણા પગના અંગુઠામાં અર્જિન પ્રગટ થઈ અને સોનલબા સતી થયા. પુંજાબાપાએ દૈવી શક્તિથી પોતાની ઉટડીને મોક્ષ આપ્યો. અને પછીથી પુંજાબાપાએ ભ્યાનમાંથી તલવાર કાઢી મોમાઈ માતાજીને યાદ કરી તું મહાદેવની

ગર્જના કરી પોતાનુ માથ શિવને અર્પણ કરી કમળ પૂજા કરી. અને પછી તેનુ ઘડ ધીગાણો ચડયું .કંઈનરાધમોને મોતને ઘાટ ઉતારતું ઉતારતું ઘડ હાથથી તલવાર હવામાં વિઝુંવિઝું મેવાસા ગામના પાદરે આવતાં ત્યાંના કોઈ માનવીએ જોયું કે, કોઈ શુરવીરનું ઘડ લડતું લડતું આવી રહ્યું છે. એટલે એમણે ગળી વાળો દોરો પલાળીને નાખતા ઘડ શાંત થયું

પુંજાબાપાના કુંઠુંબીભાઈ માલદોર ચરવતા હતા. તેમણે આપાના ઘડને વિનંતિ કરીને શાંત કર્યું એમ પણ કહેવાય છે. હાલમાં પુંજાબાપાના અને તેના કુંઠુંબીભાઈ કરશનબાપાના પાળીયા મેવાસાના પાદરમાં મોજુદ છે.

ઉપરોક્ત ઘટનાને વર્ષો વિતી ગયા પછી મોમાઈ માતાજીની કૃપાથી ગાધકડાના નેસમાં રહેતા રમાલાઈધગ લને આ વાતને જાગૃત કરવાનો વિચાર આવ્યો. એ પોતે પણ મોમાઈ માતાના ઉપાસક હતા. તેમના એકનાઓક દી કરા હતા. એમનું નામ સેફાભાઈ હતું. તે નાનપણથી જ મોમાઈ માતાના સેવા પૂજા કરતા ,અનેપુંજાબાપાની મસ્તકની ચેતન સમાધીએ દુધ ચડાવી ભોજન કરતા . ૧૧ વર્ષની ઉમરે તેમને મોમાઈ માતાજીનીકૃપાઅવતરેલી એમણે વિચાર્યું કે ,સંસારમાં રહીને પુંજાબાપા અને મોમાઈ માતાજીની સેવા પૂજા થશે નહીં. એટલેતે સંસાર છોડી સંત બન્યા. ગુરુશ્રી માનગિરી બાપુ પાસે દીક્ષા લીધી. અને શંભુગિરી નામ ધારણ કર્યું, એમના કુંઠુંબીભાઈશ્રી દાનાભા ઈ ધગલ નવાગામ જાંબુડાના વતની તેમના દિકરી પણ પુંજાબાપા અને મોમાઈ માતાજીના ઉપાસક હતા. એ પણ સંસાર છોડી શંભુગિરીના શિષ્ય બન્યા. આજે બાપ દિકરી મોમાઈ માતાજી અને પુંજાબાપાની સેવા કરે છે. ગધક ડામાં પ્રવેશતા આઈશ્રી મોમાઈ અને પુંજાબાપાની ચેતન સમાધી મોજુદ છે. અને ત્યાં કમળપુંજેશ્વર મહાદેવનું સુંદર મંદિરનું પણ નિર્માણ કર્યું છે.

ગધકડાના ઝાંપે આજે શંભુગિરી અને સોહમગિરીનો આશ્રમ આવેલો છે. કોઈ પણ જાતના લેદભાવ વગરલોકો ત્યાં આવે છે બાપુ દુ : ખીયા લોકોને આશીર્વાદ આપે છે. ગૌસેવા કરે છે. અને લોકસેવાના કાર્યમાં પણ વ્યસ્ત રહે છે.

સોહમગિરી માતાજીનો પરિચય પણ થોડો અત્રે આવશ્યક છે. શંભુગિરીને ગુરુપદે સ્થાપી અહીં મોમાઈ આશ્રમમાં સેવા કાર્યમાં રત રહેતા સોહમગિરીનું પૂર્વાશ્રમનું નામ શાંતિબેન હતું. તેનો જન્મ નવાગામ ના ધગલ રબારી દાનાભાઈ ભગવાનભાઈ અને માતા. સંતોકબેનને ત્યાં તા.૨૬-૦૭-૧૯૭૨નાં રોજ થયેલો. સાત ધોરણ સુધીન વાગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવેલું અને ૧૭ વર્ષની નાની વયે દેવલા તાલુકાના પાલીતાણ ગામે મોરી રબારી રામસ ભાઈ સાથે લગ્ન થયેલા. પરંતુ પોતાનું મન સંસાર જીવનમાં હતું જ નહીં, બાલ્યકાળથી જ મોમાઈ માતાજીની ઉપાસના અને સેવાજ એમને અભિપ્રેત હતા. આખરે એમણે સંસાર ત્યાગ કરી તા.૦૧-૦૧-૨૦૦૧ થી શંભુગિરી બાપુનું શિષ્યત્વ સ્વીકારી વૈરાગ્ય ધારણ કરી લીધો. અને આજે આશ્રમમાં રહી સેવા પૂજા અને લક્ષ્મિતમાં લીન રહે છે.

## માહિતીદાતા

- (૧) શંભુગિરી બાપુ ગાધકડા ઉ.વ.૫૫
- (૨) સોહમગિરી માતાજી ગાધકડા ઉ.વ.૩૫

## રૂડા ભગત સમઢીયાળા

રૂડાભગતનું મૂળગામ પાળિયાદ પાસે ઉમરાળા રૂડાભગતનાં પિતા આપા ભાડકા અન માતા સમજુબા. તેઓ પશુપાલનનો વ્યવસાય કરતા. અને આ કારણે સમઢીયાળા આવીને વસેલા રૂડાભગત પણ બાલ્યકાળથી જ પશુપાલન ના વ્યવસાયમાં જોડાયેલા. રૂડાભગતના માતૃશ્રી રામેશ્વર મહારજના શિષ્ય હતા. અને મહાદેવના ઉપાસક હતા. એટલે રૂડાભગતની શ્રદ્ધા બાલ્યકાળથી જ શિવભક્તિ તરફ દૃઢ થયેલી. રૂડાભગત ગંગાજળ વાંઢ ચારવા ગયા ત્યાં

બાજુમાં જોગયો દુંગર હતો. અને ત્યાં જાગેશ્વર મહાદેવની સ્થાપના હતી. પરંતુ મંદિર ન હતું ગુફા હતી ત્યાં રૂડાભગત દિવસે પોતાના માલઠોર ચારતા હતા ત્યાં એમણે ભૌયરાની બાજુમાં જમીનમાં માણસના પગલા જોયા. એટલે એમ ષે વિચાર્યુ કે, અહી કોઈ માણસ રહેતો હોવો જોઈએ. અહી તો બીજુ કોણ હોય કોઈ સાધુ સંત હશે. ઘરેઆવી માલઠોર દોહી દુધ લઈ રાત્રે જોગીયા દુંગર પાસે આવેલા ભૌયરા પાસે બેસી ગયા. મોડી રાત્રે ભૌયરામાંથી સાધુ બહાર આવ્યા. રૂડા રબારીએ સાધુને પ્રણામ કર્યા અને સાધુએ પૂછ્યું. તુ કોણ છે? હું રૂડોરબારી છું. અને મહાદેવનો ભક્ત છું, આ પના માટે દુધ લાય્યો છું. અને જો આપ રજા આપો તો હું આપને દરરોજ દુધ આપવા માટે આવું. બાપુએ રૂડાભગત ને સંમિત આપી એટલે રૂડાભગત દરરોજ દુધ લઈને આવવા લાગ્યા અને આ રીતે બાપુ સાથે સત્સંગ શરૂ થયો. એક દિવસ રૂડાભગતે રામેશ્વર બાપુને પ્રશ્ન પૂછ્યો, બાપુ મારે સાધુ થવું છે. આ સાંભળી રામેશ્વર બાપુએ પુછ્ય, તારે કુંઠુંભમાં કોણ છે? રૂડાભગતે કહ્યું કે મારા બા અને દિકરા છે. જાણી બાપુએ કહ્યું કે સંસારમાં રહીને બાની સેવા કર! સાધુ થવામાં સાર નથી. આ વાત થયા પછી રામેશ્વર બાપુ પરિભ્રમણથ૰થી બહાર જતા રહ્યા.

રામેશ્વર બાપુ બહારગામ ગયા હોવાં છતાં રૂડાભગતે રોજનો ક્રમ જાળવી રાખ્યો. એક સમયે ત્યાં નાગ પ્રગટ થયો. રૂડાભગતને બીક લાગી એ ગામમાં જતા રહ્યા. રામેશ્વર બાપુ પરિભ્રમણ કરીને પરત આવ્યા. ત્યારે રૂડાભગત તે વાત કરી. આ વાત જાણી રામેશ્વર બાપુએ રૂડાભગતને ઠપકો આપ્યો. નાગ ન હતા. પરંતુ શીવ હતા. આગળ રામેશ્વર બાપુએ કહ્યું કે, તારા માટે એ દર્શનની પળ હતી એ જતી રહી. આ ઘટના પછી રૂડાભગતને પ્રસ્તાવો થયો. અને એ, પલોછી વાળીને શીવસ્મરણમાં બેસી ગયા. અને ફરીથી ઘટનાનું પુનરાવર્તન થયું. અને નાગપ્રગટ થયા. આ વખતે કોઈ પણ પ્રકારની બીક રાખ્યા વગર ભગત બેઠા રહ્યા. નાગ શરીર ઉપર ચડ્યા. રૂડાભગતની જીબ સાથે જીબ અડાડી. આ પ્રસંગ બનતા રૂડાભગતને બ્રહ્મજ્ઞાન થયું. પછી સમદીયાળા આવ્યા અને લોકોમાં પ્રસિદ્ધિપાદ્યા.

ઉપરોક્ત ઘટના પછી ભગત ગામમાં આવ્યા પરંતુ એમનું મન સંસાર જગતમાં સ્થિર થતું ન હતું. થોડાસમયમાં પોતાના બંને પુત્રોના લગ્ન કરી અને ઘર છોડ્યું, ગામના પાદરમા મહાદેવડીધાર હતી. ત્યાં જઈ ધાસની ઝંપડી બાંધી રહેવા લાગ્યા અને પોતાનું મન શિવભક્તિમાં સ્થિર કર્યું.

સમદ્ધિયાળામાં એ સમયે ગરાસદાર તરીકે આભબાપુ ગઢવી હતા. એમની પાસે રૂડાભગતે શિવ મંદિર માટે જમીનની માંગણી કરી. પરંતુ એ માંગણી આભબાપુ ગઢવીએ મંજુર ન રાખી. ત્યારે રૂડાભગત પૂછ્યું શા માટેત્મે મંદિરની જગ્યા માટે ના પાડો છો? આ ઘટનાના અમુક દિવસો બાદ રૂડાભગત સવારમાં ચલમ પીતા હતા. આભબાપુ ને શંકા પડી એટલે તરત જ ઘોડી પાછી વાળી પાછા મહાદેવની ધારે આવ્યા. ત્યાં આવીને જુઓ તો રૂડાભગત ચલ મ પીતા ફરી દેખાયા. એટલે આ ઘટનાથો આભબાપુને ખાતરી થઈ કે, ચમત્કારીક ભગત છે. તેઓ રૂડાભગત પાસે ગયા. અને મંદિર માટે જમીન આપવાની મંજુરી આપી. ત્યાં રૂડાભગત મંદિર બનાવ્યું. આજે ખુબ સગવડતાવાળી વિશાળ જગ્યા છે.

મંદિર નિર્માણ પછીના થોડા સમયમાં દુઃખાળની સ્થિતિનું નિર્માણ થયું. ઉભો પાક સુકાવા લાગ્યો. ગામ લોકો રૂડાભગત પાસે ગયા, અને વરસાદ માટે વિનંતિ કરી, ત્યારે રૂડાભગતે કહ્યું મંદિરની ફરતે પત્થરની દિવાલ નથી. દિવાલ બાંધી આપો એટલ વરસાદ થશે. ગામ આખું ભગતની વાત સાંભળી મંદિર ફરતે દિવાલ બાંધી દીધી દિવાલનું કામ પુરું થતાં. રૂડાભગતે લોકોને કહેલું ઘરે જાઓ ત્યાં સુધીમાં વરસાદ આવશે. અને લોકોએ ઘરેપહોંચી વાળું પાણી કર્યા ત્યાં જ વરસાદ પડેલો.

માલાભાઈ સાંભડાના માતૃશ્રી નાથીબેન પણ સમદ્ધિયાળાના રબારી હતા. એ પણ રૂડાભગત પાસે સત્સંગ કરતા. અને નાથી બહેનને એવ નીમ હતું. કે, દરરોજ રોટલા માગી કુતરાને નાખી વાળું કરતાં. એવું નીમ દસવર્ષ સુધી રાખેલું. બીજા દસ વર્ષ રોટલા ઘડી કુતરાને નાખે અને એક ટાણું કરતા. આખરે નાથી બહેનના પતિશાર્દૂળ ભગતે નીમ પડતું મુકવા માટે કહ્યું ત્યારે નાથી બેને પોતે સપ્તાહ ન કરે ત્યાં સુધી આ નીમ ચાલું રાખવાનું જણાવ્યું ત્યારે તેના પતિએ કહ્યું આપણું ઘર સપ્તાહનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી. તો નાથી બહેનજણાવ્યું કે, તો પછી ક્રત કરવા દો. આ વાતની ખબર રૂડા ભગતને પડતાં શાર્દૂળ ભગતને રૂડાભગતે ઘારેશ્વર મહાદેવના મંદિરે બોલાવ્યા. અને સપ્તાહનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી. રૂડાભગતે આ વાત સાંભળી મદદ કરવામાટે કથ અને મદદની ખાતરી મળતા શાર્દૂળ ભગતે સાત દિવસેની સપ્તાહ કરી. અને આ સપ્તાહમાં સાત દિવસશાક રોટલાનું બોજન આપતા. છેલ્લા દિવસે

મિષ્યાન જમાડયું. એમાં સાચા ઘાનો શિરો બનાવેલો. આ પ્રસંગમાં સગા સંબંધી મદદરૂપ થતાં. રૂડાભગતે નાથી બહે નને કહેલું કે, તમે અને હું સૌથી છેલ્લે જમીશું.

મહેમાનો અને ગામ જમી લીધા પછી છેલ્લે નેસડાની બહેનો બાકી હતી. એ સૌને જમવા બેસાડી ઠામડા મૂકા યા ત્યાં રસોડામાં શીરો ખલાસ થઈ ગયો. કોઈ કે જઈને કહું કે બૈરાને જમવા બેસાડી દીધા છે. અને શીરો ખલાસ છે. આ સાંભળી રૂડાભગતે કહું તમે રસોડામાં જુઓ પીરસનારા એ કહું અમે રસોડામાં જોઈને જ કહીએછીએ. રૂડા ભગતે કહું ફરીથી જુઓ. ફરીથી પીરસનારા ત્યાં જઈને જુએ છે તો શીરાની ગોળી ભરેલી હતી. આ ભગતનુંપ્રમણ હતું. આજે સમદીયાળા ગામના પાદરે સુંદરમંદિર ઉલું છે. વિશાળ જગ્યા છે. ત્યાં રૂડાભગતનીપ્રતિમા પણ મુકવા માં આવી છે.

### માહિતીદાતા

- (૧) ઉકાભાઈ રૂડાભાઈ ભાડકા ઉ.વ.૮૫ સમદીયાળા
- (૨) માલાભાઈ શાર્દુલભાઈ શામળા ઉ.વ.૯૫ સમદીયાળા

## કરમણભગત—ભવનાથ ,જુનાગઢ

કરમણ ભગતના પિતા મૂળ ખલીલપુર ગામમાં રહેતા પ૦ વર્ષ પૂર્વે તેઓ વિસ્થાપિત થઈને ભવનાથ રહેવા આવ્યા. કરમણભગતનો જન્મ અને ઉછેર ભવનાથ માંજ થયેલો. તેમના પિતાનું નામ સુદાભાઈ અને માતાનું નામ સુંદરબેન છે. કરમણભગત ઉમરલાયક થતાં એમના લગ્ન સરગવાડા ગામના ડાયાભાઈ ભારાઈની પુત્રી લક્ષ્મી બેન સાથે થયેલાં. એમને સંતાનોમાં બે પુત્રો દેવાભાઈ અને ભગવાનભાઈ અને પુત્રી માનસી એમત્રજી સતતાનો છે. કરમણ ભગત છેલ્લા પાંચેક વર્ષથી સંસાર ત્યાગ કરી ભવનાથમાં મંદિર બનાવી લંબે હનુમાનની સામેની બાજુ રહે છે. એનો પરિવાર તેના ભાઈ વિસાભાઈ જોડે રહે છે.

કરમણભગત બાલ્યકાળમાં જ ગિરનાર ભવનાથક્ષેત્રમાં વસવાટ કરતા હોવાથી એમનામાં ભક્તિના સંસ્કારો પ્રગટેલા. શરૂઆતમાં ચાની હોટલ ચલાવતા પરંતુ એમાંથી કશો નફો કરતા ન હતા. દુધ અને ખાંડ ચાનાપૈસ । વસુલ થઈ જતાં એ બાકી વધેલા નફાના પૈસા સાધુ સંતોને ચા પાણી પાવામાં ખર્ચી નાખતા. આ રીતે સાધુ સત્સંગ થતો રહેતો. એમાં એમને કાંદબરી બાપુનો પરિચય થતાં એમણે કાંદબરી બાપુને ગુરુપદે સ્થાપેલા. ગુરુ કાંદબરી બાપુ એ કરમણ ભગતને દત્તૌપાસના કરવાનું અને ગિરનારની પરિક્રમા કરવાનું કહું. ગુરુવચનોનો એમણે શ્રદ્ધાથી અમલ શરૂ કર્યો અને તા. ૧૫-૦૬-૧૯૮૮ થી દર અગિયારસ અને પુનમે પરિક્રમાં શરૂ કરેલી આજે પણ આ પ્રક્રિયા ચાલુ છે. જો કે એમના ગુરુએટો માત્ર ૧૦૮ પરિક્રમા કરવાનું કહેલું પરંતુ ભગતે પોતાની નિષ્ઠાથી આ પ્રક્રિયા ચાલુ રાખી છે.

ભવનાથ તળેટીમાં લંબે હનુમાનથી કાશિમરી બાપુ તરફ જતાં રસ્તા ઉપર ઈ.સ. ૧૯૮૭માં શિવ મંદિરની પ્રતિષ્ઠા કરી ઈ.સ. ૨૦૦૮માં દત્તમહારાજાનું મંદિર ભનાવ્યું. દત્તમંદિરનાં નિર્માણ માટે ભગતે સંકલ્પ કરેલો કે જ્યાંમુદી દત્ત મંદિરની પ્રતિષ્ઠા ન થાય ત્યાં સુધી દરરોજ ગિરનાર ઉપર દત્તાત્રેયના દર્શન કરવા જવું. આ રીતે સતતબે વર્ષ સુધી દર્શન કરવાની પ્રક્રિયા ચાલું રાખતા આખરે દત્તભગવાનની કૃપાથી ભગતનો સંકલ્પ પાર પડેલો અને શિવમંદિરની પાછળ દત્તભગવાનની પ્રતિમાનું સ્થાપન કરેલું. અને મંદિરની સામે ધૂષો બનાવી ઉપાસનાકરે છે આ મંદિરની બનાવ્યા પછી દત્તભગવાનના દર્શન કરવા ગિરનાર ઉપર જતા નથી. પરંતુ પોતાના બનાવેલા મંદિરમાં જ સેવા પૂજા દર્શન કરે છે પરંતુ ગિરનારની પરિક્રમાનો ક્રમ તો આજે પણ ચાલુ જ રાખ્યો છે. માત્ર ૪ કલાકમાં ગિરનારની પરિક્રમાં પૂર્ણ કરે છે. પરિક્રમામાં ભગત પૂનમ અને અગિયારસના દિવસે પોતાના આત્મકલ્યાણ અર્થે કરે છે. અને આડાઈ દવસે લોકકલ્યાણ અને ભારતમાં કોઈ સૈનિક શહીદ થયો હોય તો તેના આત્માનાં કલ્યાણ અર્થે કરે છે.

ભગતે દત્યક્ષ પણ કરેલો અને તે વખતે સૌરાષ્ટ્રનું સંતમંડળ બોલાવેલું અને ખૂબ માનવ મહેરામણ પણ ઉમટી પડેલો અને ત્યારથી કરમણ ભગતનો સંતોષે ભગતકોટિનો ગિરનાર મંડળમાં સમાવેશ કરેલો. આજે પણ આજે પણ આવતાં જતાં અભ્યાગતોને પોતાને હાથે ચા પાણી રસોઈ બનાવી જમાડે છે અને પરિક્રમા તેમજ શિવરાત્રિના મેળા દરમ્યાન અન્નસ્કેત્ર પણ ચલાવે છે.

માહિતીદાતા કરમણ ભગતની રૂબરૂ મુલાકાત. ઉ.વ.૫૦ ભવનાથ જુનાગઢ

## કાનદાસબાપુ — ખલીલપુરવાળા

કાનદાસબાપુ પૂર્વજીવન વિષયક માહિતી બહુધા ઉપલબ્ધ બનતી નથી. પરંતુ તેઓ ફક્કડ સાધુ હતા. સાધુ થયા પછી અવાર નવાર સતત પરિભ્રમણ કરતા રહ્યા. એમના ગુરુનો ઉલ્લેખ પણ સાંપડતો નથી પરંતુ રાજા ભગતના ખાસ અંતેવાસી હતા. કાનાકુવા અવાર નવાર આવતા રહેતા. યોગ, સાધના, તપ દ્વારા એમણે પોતાની સાધુતા સિદ્ધ કરી હતી. તેઓ ભારાઈ શાખના રખારીમાંથી સાધુ થયેલા એવી જાણકારી પ્રાપ્ત થાય છે.

કાનદાસબાપુ ભગવા વસ્ત્રો ધારણ કરતાં દાઢી અને જછાં પણ રાખતા. પૂર્ણ ખાખી સાધુ તરીકે રહેતા સમયની ઈચ્છીએ તેઓ રાજાભગતના સમકાળીન હતા એમના કોઈ શિષ્યવર્ગ કે પરિવારજનો અંગે વિશેષ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ કાનાકુવા ખાતે રાજાભગતની વાડીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ પસારકરેલ. અને રાજાભગતના પુત્ર સુકાભગતને એમણે કહેલું કે, 'મારે' બારપોરો 'પાઠ ઉત્સવ, અને ભાગવત સપ્તાહકરવી છે. કાનદાસબાપુની આ વાત સુકાભગતે કાનદાસબાપુના અવસાન પછી પુરી કરેલી. કાનદાસબાપુ સાધુ અવસ્થામાં ભારત બ્રમણ કરી આખરે કાનાકુવા (કૃતિયાણા) આવી અને શેષ જીવન પુરું કરે છે, અને મુત્યુબાદ પોતાની સમાધી ત્યાં જ અપાય એવી ઈચ્છા વ્યક્ત કરેલી તેમનું અવસાન, ફાગણ વદ-૧૦ને સોમવાર તા. ૦૪-૦૪-૨૦૦૫નાં રોજ થયેલાં અને તે જ દિવસે ત્યાં એમને સમાધી આપવામાં આવી છે આજે સમાધી ઉપર નાનકડી ડેરી બાંધી. કાનદાસબાપુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

કાનદાસબાપુએ જીવનભર પ્રભુસ્મરણ કરી અને પોતાની શ્રદ્ધા જ્યાં ઠેરાણી તે જ્યાં એ આયખું પુરું કર્યું એમના જીવનની વિશેષ વિગતો ઉપલબ્ધ થતી નથી.

માહિતીદાતા

- (૧) સુકાભગત કૃતિયાણા ઉ.વ. ૫૦
- (૨) બારોટ કાનજી હિરજી ઉ.વ. ૭૫ જુનાગઢ

## નારણદાસ

નારણદાસ જુનાગઢના માખીયાણા ગામે જન્મેલા જીવનમાં ધાર્મિક સંસ્કાર બાલ્યકાળથી જ હતા. ગામનાંએ એ સમયે અવાર — નવાર સાધુ—સંતોની જમાત ઉત્તરી આવતી. એ જમાતની સેવા સાકરી કરી. અને ગામમાંઅન્નાની ઝોળી ફેરવતા કારણકે, પોતાની ભાવના ભૂખ્યા અને અભ્યાગતોને જમાડયાની હતી. પરંતુ એટલીસગવડતા પતા પાસે ઉપલબ્ધ ન હોવાથી ગામમાં ઝોળી ફેરવી ગામના ઝાંપે આવેલા સાધુ, સંતો અને અભ્યાગતોને ભોજન આપતાં.

નારણદાસ મકવાણા શાખના રબારી હતા. સંત સેવકાર્ય કરતાં કરતાં નારણ યુવાવસ્થામાં પ્રવેશતાં એમનાલગ્ન જામદ્રોળના ભારાઈ પરિવારમાં થયેલા. પરંતુ પોતાના જીવનના રંગઢંગ તો સંતસેવા અને પરોપકારના હતા. સંસારને નિભાવવો અને સંત સેવા કરવી એ ખૂબજ અધરી બાબત છે. આ બાબતને કારણે પત્નિ સાથે અવાર-નવાર જગ્ઘાઓ થવા માંડયાં. આખરે નારણે પત્નિનો ત્યાગ કરી સાધુ થવાનો સંકલ્પ કર્યો. નારણનો આ સંકલ્પ એમના કાકા કીસાભાઈને પસંદ ન હતો. કીસાભાઈ મકવાણા કલાણા ગામે રહેતા, એણે નારણને સાધુ થતાં રોકવા માટે ખૂબજ પ્રયત્ન કરેલો. પ્રથમ સમજાવટના પ્રયત્નો ખૂબજ કરેલાં છતાં નારણમાં સેવા અને ત્યાગની ભાવનાના સંસ્કારો પહેલેથી હતા. અને પત્નિએ સહકાર યુક્ત વલણ ન દાખવતાં આખરે એનો આતમરામ સંસારમાં રહેવાનીનાં પડતો હતો. એટલે એને સાધુ થતાં રોકી શકાય તેમ ન હતું. કીસાભાઈએ આખરે માર્કુટ પણ કરેલી. આખરે નારણ કોઈથી રોકાણો નહીં. કીસાભાઈની માર્કૂટથી આખર નારણનું સંત લદ્ય દ્રવી ઉઠ્યું અને કાકાને શાપ આપી દિધો કે, "તારું મૃત્યુ અહીં થશે નહીં ગાંડો થઈ રખડી રખડીને મૃત્યુ પામીશ એ પ્રમાણે જ થયેલું.

ઉપર્યુક્ત ઘટનાબાદ નારણ પોતાનું ગામ-પત્નિ બધુજ ત્યાગી અને ભવનાથમાં આવેલી લંબે હનુમાનની જગ્યામાં રહેતા ઉત્તમદાસ પાસે પહોંચેલાં. એમને ગુરુપદે સ્થાયી સાધુ થયા. બાખી પંથ સ્વીકાર્યો. પરંતુ નારણદાસસ્વભાવે બધુ કોધી અને બીજાની વાત બહુ સ્વીકારતા નહીં. પોતાને લાઘેલું સત્ય જ સ્વીકારતા આ બાબતને કારણે આખરે એમણે લંબે હનુમાનની જગ્યા પણ છોડી અને પરિબ્રમણ અર્થે નીકળી પડેલા. એમ કહેવાય છે કે, નારણદાસ લંબે હનુમાનની જગ્યા છોડી ઉજૈન ગયેલા. અને ત્યાંથી પરત ફરી અમદાવાદ પાસે પીપળી ગામે જગ્યા બાંધેલી. એ સમયમાં અરણી ગામના પટેલ જેરામદાસ પણ સાધુ થયેલા આ બંને સાધુઓ પીપળી ગામે જગ્યા બાંધીને સાથે રહેતા.

નારણદાસ સાધુ થયા પછી પ્રથમ વખત પોતાના ગામ માખીયાળા આવેલા. પરંતુ સાધુ ના વેશમાંનારણદાસને ગામ લોકો કે પરિવારજનો ઓળખી શક્યા નહીં. એટલે નારણદાસ ઉદાસ થઈને ત્યાંથી વડાલ ગયા. વડાલ થઈને સરગવાડા ગયા. અને આખરે મહાદેવની જગ્યામાં એની ઓળખાણ થતાં ત્યાં ગામલોકો સામૈયુ કરી અને નારણદાસને તોડી લાવેલ, ત્યારે નાગા અખાડાના સાધુઓની જમાત સહિત પોતાના ગામના પાદરે એકઅઠવાડિય રોકાયેલા.

નારણદાસ પોતાનું મોટાભાગનું જીવન અમદાવાદના પીપળી ગામે વિતાવેલું એટલે એમના વતન અને પરિવારમાંથી એના તપ અને ત્યાગની કે લોકસેવાની વધુ વિગતો પ્રાપ્ત થતી નથી, પરંતુ એના પરિવારજનો પાસે એક વિગત પ્રાપ્ત થાય છે કે, નારણદાસ સિદ્ધ સંત હતા. એક વખત નારણદાસ પોતાના ગામમાં આવેલાત્યારે માખીયાળા ગામના પટેલ વીરડીયા મણીબેન નાથાભાઈને તાવ આવેલો અને તેણીએ નારણદાસ બાપુએમાત્ર મણીબેનના માથાના એક જ ટપલી મારી ત્યારે તરત જ તાવ ઉત્તરી ગયેલો. અને મણીબેન જીવ્યા ત્યાં સુધી તાવ આવેલો નહીં. એમ કહેવાય છે.

સંત નારણદાસ બ્રમશીલ સાધુ હોવાથી અને તેનો આશ્રમ અમદાવાદ પાસેના પીપળી ગામે હોવાથી સૌરાષ્ટ્રમાંથી માત્ર થોડી ઘટનાઓ એમના પરિવારજનો અને બારોટ પાસેથી મળેલ તેનો ઉલ્લેખ અહીં કર્યો છે.

#### માહિતીદાતા

- (૧) કાનજી હીરજી બારોટ, ઉ.વ. ૭૫, રે. જુનાગઢ.
- (૨) વીસાભાઈ મકવાણા માખીયાળા ઉ.વ. ૫૧
- (૩) હમીરભાઈ બનુભાઈ ભારાઈ ઉ.વ. ૨૮ માખીયાળા

## દુધરેજ અને દુધઈ પરંપરાના સંતો

સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગરથી ઘાંગાઢા રોડની બાજુમા બહુજ નજીક ત્રણ—ચાર કિ.મી. ના અંતરે દુધરેજ ગા મ આવેલું છે. ત્યાં સુપ્રસિદ્ધ એવું વડવાળા દેવનું મંદિર આવેલું છે. આ ગામ અને જગ્યાનો સુંદર ઈતિહાસ છે. એટલું જ નહીં પરંતુ એક ઉજ્જવળ જ્ઞાનમાર્ગી સંતોની પરંપરાનો ઈતિહાસ છે.

પદ્મનાભ સ્વામી ના શિષ્ય નીલકંઠ સ્વામી શુંગેરી મઠથી નિકળી પરિબ્રમણ કરતાંકરતાં સૌરાષ્ટ્રનીસરહ દે આવેલા ઝંઝાવટ ( ઝીજુવાડ ૧ ) ગામે આવી પહોંચા. આ ગામનું નામ પાટણના મહારાજ સિદ્ધરાજ નીજન્ભલુભિ મનાય છે. ઝીજા નામના રબારી ની યુક્તિથી સિદ્ધરાજનો જન્મ થયેલો. એટલે ઝીજા ના નામ ઉપરથીઝાંજુવાડા નામ રાખ્યું હોવાના અનુમાન સાંપડે છે.

નીલકંઠ સ્વામી સૌરાષ્ટ્રભ્રમણ કરતાં સુરેન્દ્રનગર નીબાજુમાં એક સરોવરને કંઠે આવી ચડયા. અને તેના શિષ્ય રધુનાથ સ્વામીને કહ્યું, આ જગ્યાએ આશ્રમ બાંધીને રહેવામાં આવેતો અહીં પશુપાલકો વસવાટ કરશે. અને અહીં ૧ ગામ બાંધશે ; એવું કહી નીલકંઠ સ્વામી કાશી ગયા. અને પોતાનો જીવનકાળ સમાપ્ત થવાની તૈયારીજોઈ એમણે રધુનાથ સ્વામી ને કહ્યું, અહીંથી ઝીજુવાળા જઈ. ત્યાં તને એક બ્રાહ્મણ મળશે. તને ઉપદેશ આપીદુધરેજ જઈ જગ્યા બાધી શિષ્ય પરંપરા ઉલ્લી કરજે ને તે પરંપરા આગળ વધશે.

### દુધરેજ આશ્રમના સ્થાપક (રધુનાથ સ્વામી (ગાદીસ્થ સમય વિ.સ. ૧૫૮૫))

નીલકંઠ સ્વામીના દેહત્યાગ પછી રધુનાથ સ્વામી સૌરાષ્ટ્રમાં આવ્યા. ઝીજુવાડા ગામે આવતાં, એમને મોઢશાંત ના બ્રાહ્મણયાદવનો ભેટો થયો અને તોણે રધુનાથ સ્વામીને ગુરુ ધારણ કર્યા. પ્રથમ નીલકંઠ સ્વામી એકહેવા પ્રમાણે દુધરેજ આવી પર્શ્વકૃતિર બનાવી ભજન કરવા લાગ્યાં. આ સમયે આ વિસ્તાર ઝલા રાજવીઓનીહદમાં આવતી હતો. અને રાજવીઓ પણ અવારનવાર રધુનાથ સ્વામી ના દર્શને આવતાં અને સત્સંગ નો લાભ લેતા.

રધુનાથ સ્વામી આશ્રમ બાંધીને દુધરેજ રહેવા લાગ્યા. આજુબાજુ પશુપાલકો એ આવી નેસ બાંધી પડા વ નાખ્યો. ધીમે ધીમે જગ્યાની વાત ફેલાવા લાગી. એવામાં એક સમયે સાધુ સંતોની મંડળી આવી પહોંચી. ત્યાં સૌ ને વ્યવસ્થા કરી દેવામાં આવી. ત્યાંજ અખાદસુદ પુનમ ( ગુરુપુરિષ્ઠમા ) નો દિવસ આવી પહોંચ્યો. બરાબર તે જ દિવસે સૌ સાધુ સંતોઅ દુધપાકની માગણી કરી. આ વાત સાંભળી કોઠારી મુંઝવણ અનુભવવા લાગ્યાં. પરંતુ અગાઉથી જાણ થઈ હોયતો વ્યવસ્થા થઈ શકે. પરંતુ સમય ઉપર દુધ કયાંથી લાવવું? રધુનાથસ્વામી ને આ વાતન ૧ જાણ થતાં કહ્યું કે, 'આ સરોવરનું જળ દુધ સમાન છે. એનું જળ લઈ આવીને દુધપાક બનાવોંએને તેમ કરવામાં આવતાં દુધપાક સારો થયો. અને જમનાર સૌને આ વાતની નવાઈ લાગી.

રધુનાથ સ્વામીના હાથે સ્થપાયેલ દુધરેજ આશ્રમની વિકાસ તરફ ની ગતિ વધવા માંડી હતી. આ સમયચાર્તુ માસનો હતો. એટલે સૌ લોકો કથા શ્રવણ કરે એવી રધુનાથ સ્વામીની ઈચ્છા હતી. યાદવ સ્વામી ગુરુનીઈચ્છાને માન આપી તૈયારીમા લાગી ગયા. તૈયારી પૂર્ણ થતાં રધુનાથ સ્વામી વ્યાસપીઠ ઉપર બિરાજ્યા અનેસૌ સંતો ભક્તો એ કથાનું શ્રવણપાન કર્યું. અને કથા પુરીથતાં સૌ સંતોઅ વિદ્યા લીધા પછી રધુનાથ સ્વામીએઆશ્રમની વ્યવસ્થા ગોઠવી થોડો સમય ઝીજુવાડામાં રહી કાશી તરફ પ્રયાણ કર્યું. કાશીમાં થોડો સમય ભજનકર્યા બાદ વિ.સ. ૧૫૮૫માં રધુનાથ સ્વામીએ દેહ ત્યાગ કર્યો.

## સંત શ્રી રધુવરદાસજી

ગાદી સમય વિનિયોગ નિયમ વિનિયોગ વિનિયોગ

તેમનો જન્મ વિનિયોગ સં. ૧૮૮૮ના શ્રાવણ વદ આઠમના દિવસે થયેલો. અને માત્ર પાંચ વર્ષની નાની ઉભરેએ મને ગૂરુ ગોવિંદરામજી દ્વારા દિક્ષા આપવામાં આવી હતી. એમને અભ્યાસ માટે મૂકવામાં આવતાં હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ ઉપરંત સંગીતમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

સંત રધુવરદાસજીના સમયમાં દૂધરેજના પટા આશ્રમોની સ્થાપના સારા પ્રમાણમાં થયેલી. તેઓ સતતપરિ ભમણ કરતાં એને કારણે ધ્રાગધા, ભાવનગર જૂનાગઢ વગેરેના રાજાઓ સાથે સંબંધો કેળવી આશ્રમો સ્થાપીવડવાળા આશ્રમની પ્રતિષ્ઠા સારા પ્રમાણમાં વધારી હતો. ઉપરંત એમનાં શિષ્યોને અન્ય જગ્યાએ સ્થાપેલા આશ્રમોનું સંચાલન કરવા નિયુક્તિ કરેલી. એમના દ્વારા ધણા આશ્રમો સ્થાપવામાં આવ્યા. અને યાત્રા પ્રવાસ સારા પ્રમાણમાં થયેલા. સ્થળસંકોચને કારણે આપણે અહીં એ વિગતોમાં જઈ શકતાં નથી. પરંતુ આ સંત પરંપરાના રધુવરદાસજી એક કાંતિકારી બુધ્યમાન અને વિકાસશિલ સંત હતાં. એમ અવશ્ય કહી શકાય વિનિયોગ સં. ૧૮૮૭ના રોજ એમણે દેહત્યાગ કર્યો.

## સંતશ્રી જીવરામદાસજી

ગાદી સમયે વિનિયોગ સમય વિનિયોગ

આ સંતનો જન્મ રાવળિયાવદર ગામે પિતા જેઠાભાઈ અને માતા સોનબાને ત્યાં થયેલો અને રધુવરદાસજી પછી વિનિયોગ સમયમાં ગાદીએ આવેલા. તેઓ શાંત, ગંભીર અત્યંત વ્યવહારુ, બુધ્યમાન અને શ્રી રામમાં અન્ય શ્રદ્ધા ધરાવનાર સંત હતાં. એમણે સ્કુલશિક્ષણ ઉપરંત જામનગરના પંડિત રામપ્રસાદ પાસેથી વેદ ઉપનિસદ્ધ પુરાણો આદિનો અભ્યાસ પણ કરેલો.

સંત જીવરામદાસજી માત્ર શાસ્ત્રજ્ઞાતાજ નહીં પરંતુ ખરા અર્થમાં લોકસંવેદનાના સંત હતા. વિનિયોગ સ. ૧૮૮૮ના અતિવરસાદના કારણે સજયિલી મુશ્કેલીમાં લોકો માટે આશ્રમના દરવાજા ખુલ્લા મૂડી દીઘા હતા. આ સંત ભારત અને ગુજરાતના અનેક પ્રદેશોમાં ફરી અને ધર્મની જ્યોતના અજવાળાને પ્રસ્તારવાનું વિસ્તૃત કાર્ય કરે છે. એમના જીવનમાં ચમત્કારની વાતી પણ સંકળાયેલી છે. દા.ત. આંધ્રા સાંધળીને દેખતી કરવી, ગોગા મહારાજાના દર્શન દેવાં વગેરે પરંતુ આપણે એ વિસ્તૃતામાં પડ્યા વગર એટલું અવશ્યકરી શકીએ કે દૂધરેજ આશ્રમના પાયાના સંતોની હરોળમાં આવી શકે તેવું પરોપકારી એમનું જીવન હતું. વિનિયોગ સ. ૧૮૮૭ના એમની જીવનતીલા સંકેલાઈ.

## સંતશ્રી ; ગોમતીદાસજી

ગાદી સ્થ વિનિયોગ સમય વિનિયોગ

રબારી પરિવારમાં અખાઢ સુદ-૨ વિનિયોગ સ. ૧૮૭૪ના રોજ કાગાદી ગામે થયેલો. એમણે અભ્યાસ કરી વેદાન્તાચાર્યની પદવી પાપિત કરેલી. સ્વભાવે મીતભાષી અને ઉત્તમ વૈચારિકસૂચિનીએ મૌલિકતા દેશ પરાધીન તાની બેડીમાં જકડાયેલો હતો. ત્યારે એમણે સત્ય, અહિસા અને બ્રહ્મચાર્યને આચારમાં ઉત્તરવા માટે હિમાયત કરતા.

દૂધરેજની ગાદી પરંપરામાંના આ સંત સામાજિક રીતે પણ કાંતિકારી વિચાર ધરાવતા હતાં. એટલે એમણે સમાજમાં રૂઢિયો અને માન્યતાઓનો વિરોધ કર્યો એનો પ્રતિસાદ પણ સારો પડ્યો, પરંતુ રૂઢિવાદી ઓને આવાત મંજૂર ન હતી. એટલે એમણે મેદાને પડી સંધર્ષ કર્યો. અને આખરે વિનિયોગ સ. ૨૦૧૮ ફાગણ વદ-૫ના દિવસે શહાદત વહોરી લીધા.

## સંતશ્રી ; કલ્યાણાદાસજી

જન્મ સમય ; વિનિષ્પાત્ર નંબર ૧૯૮૦ મહાસુદભીજગાદી સમય વિનિષ્પાત્ર નંબર ૨૦૧૮ ફાગણવદ-૭  
સમાધી ; વિનિષ્પાત્ર નંબર ૨૦૫૮ ફાગણસુદ-૨ ,

સંતશ્રી કલ્યાણાદાસબાપુનો જન્મ વિનિષ્પાત્ર નંબર ૧૯૮૦ના મહાસુદભીજગાદી દિવસે અમદાવાદ પાસેના ઉપારસદ ગામે થયેલો એમણે દિક્ષા ગ્રાપ્ત કર્યા પછી અભ્યાસ કરેલો ગુજરાતી , હિન્દી , સંસ્કૃત અને ખપ પૂર્તું અંગેજી પણ જાણતા . ગોમતીદાસજી મહારાજ બ્રહ્મલીન થતાં વડવાળના જગ્યાનો વહીવટ ચલાવવાનું એમના ભાગે આવી પડ્યું હતું. એ સમયે સંસ્થાનું વાતાવરણ જોઈને તેવું નિર્ભળ ન હતું. પરંતુ સંત-કલ્યાણાદાસ બાપુએ પોતાના ધર્મ અને કુનેહથી વાતાવર સરખું કરી સ્થિરતા સ્થાપી હતી.

કલ્યાણાદાસજીએ ગાદીનો વહીહટ સંભાળ્યો ત્યારે જગ્યામાં પ્રથમ પણ પાણીનો હતો. એમણે કોલાદવાળા રામભાઈ દૂધરેજ આવતાં આ વાત સમજાવી રામભાઈએ જગ્યા માટે પોતાના ખર્ચે વોટરવર્ક્સકરી પાણીની સુગમતા કરીઆપી. કલ્યાણાદાસબાપુએ દૂધરેજ વડવાળા આશ્રમના વિકાસમાં સારો એવો પરિશ્રમક્રોં ; સમગ્ર ગુજરાતના રબારીઓ વડીવાળાના નેજા હેઠળ એકિત્ર થાય એમાટે એમણ સતત પ્રયાસો અનેપરિબ્રમણ કર્યું . શિક્ષણ માટે છાત્રાલય અને સ્કુલની વ્યવસ્થા ઉભી કરી. શિક્ષણ સમાજમાં વિસ્તરે એ માટેનાપૂરતા પ્રયત્નો કર્યું . એમણે દૂધરેજની જગ્યામાં પણ સંતો મહંતોને રહેવા માટે બાંધકામ કરાયું જુનાગઢમાંમંદિરનું સમાર કામ પણ એમણે કરાવ્યું. રામાયણી મોરારીદાસબાપુની રામકથાનું આયોજન કર્યું.

સંતશ્રી ; કલ્યાણાદાસબાપુ સ્વભાવે શાંત અને આર્થદધ્યા હતા. એમના સમયમાં ' વડવાળા મંદિર દૂધરેજનો સારો એવો વિકાસ થયો એટલું 'જ નહીં' પરંતુ સાથે સાથે સમાજ જાગૃતિ અને શિક્ષણક્ષેત્રે પણ બહુ મુલ્યવાન કાર્ય એમના સમયકાળ દરમ્યાન થયાં. પોતાની હાજરીમાં એમના ૭૫ જેટલા શિષ્યોમાંથી શ્રી કનીરામજીબાપુને લઘમહંત અને વનરાવનદાસજીને કોઠરી તરીકેની નિર્યુક્તિ કરી વધારાની જવાબદારીઓ પોતે સોંપી દીધેલી. ભૂકૂપમાં જીર્ણ થઈ ગયેલું વડવાળા મંદિરનું પુનઃ : નિર્માણનું કાર્ય કરી બાપુ કણ વર્ષનું આયુષ્ય ભોગવી. વિનિષ્પાત્ર ૨૦૫૮ના ફાગણવદ-૨ના દિવસે સમાધોસ્થ થયા.

## વર્તમાન સંતશ્રી ; કનીરામજી

સંતશ્રી ; કનીરામજીબાપુનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામે તા. ૦૧-૦૬-૧૯૮૨ના દિવસે પિતા વીરાભાઈને સંતાનોમાં રતનભાઈ , દાનાભાઈ , બીજલભાઈ , કરશનભાઈ , રામભાઈ , બાયાબેન , એમ પાંચ પુત્રો અને બે પુત્રીઓ વીરાભાઈના પૂર્વજી પણ પેઢી દર પેઢીથી વડવાળા મંદિરના સેવકો હતા. અને એમાં અપાર શ્રદ્ધા પણ હતી. એટલે પોતાના પુત્રને વડવાળા દેવના ચરણોમાં ધરતાં આનંદ થયો. વીરાભાઈના પાંચમાંથી બે પુત્રો પરિણત હતા. અને ત્રણ પુત્રો સાથે લઈને વડવાળા દેવને ફાગણવદ-૧ને દિવસે ઘજા ચડે છે તે દિવસે આવી પહોંચાં. ઘજાનો પ્રસંગ પૂરો થયા પછી વીરાભગત બાપુ પાસેજર્જ ને બધી વાત કરે છે. અને ત્રણ પુત્રોમાંથી પસંદ કરવાનું કહે છે. ત્યારે બાપુએ કહ્યું કે, આ ત્રણમાં જેવડવાળાનો હોય તે મારી પાસે આવે. ત્રણમાંથી કરશનભાઈ ઉઠીને બાપુ પાસે સ્વેચ્છા એ ગયા. એ સમયે એમનીઉભર ૧૦ કણ ૧૨ વર્ષની હશે. આ રીતે કરશનભાઈનું નામ બદલી કનીરામજી રાખવામાં આવ્યું. અને એ જ મોટાથતાં મંદિરના મહંત બન્યા.

શ્રી કનીરામજીબાપુ મંદિરના ગાદીપતિ થતાં એમણે જગ્યાના વિકાસમાં સારો એવો પ્રયાસ કર્યો. સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ફરીને શિક્ષણ વધે અને દીકરીઓ ભાષાતી થાય એના માટ જહેમત ઉઠાવી રહેયા છે. એમનું ભાવવિશ્વ એક ભક્તજનનું રહેવા છિતાં વહીવટી કુશળતા પણ સારી છે. એટલે એમના દ્વારા સમાજ ઉપયોગી કર્યો અને વિકાસાત્મક કાર્યો થતાં રહે છે. બદલાતાં સમય સંદર્ભે સમાજમાં કયા પરિવર્તનો હોવાં જોઈએ તેના સંદર્ભે પણ બાપુ અવારનવાર પ્રવચનો આપતા રહે છે. એમના દ્વારા રબારી સમાજના વિકાસની નવી નોખી દિશાઓ ઉધશે એવી અભિપ્રાસ સેવીએ.

## દૂધરીની વડવાળા પરંપરાના સંતો.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દૂધરી ગામમાં પણ 'વડવાળા' નું સુંદર મંદિર આવેલું છે. અને તેના મૂળ પણ દૂધરેજની પરંપરા સાથે સંકળાયેલા છે. દૂધરેજની ગાઈએ ઓધવદાસજી હતા. રાજ ખટપટ અને આંતરકલહથી કંટાળીને ઓધવદાસજી દૂધરેજ છોડી તેમના અઢારેક શિષ્યો સાથે વિનિઃસ્વાર્પના રોજ દૂધરેજ છોડી દૂધરી આવી રહ્યા. ત્યારથી દૂધરીમાં વડવાળાદેવની પરંપરા સ્થપાઈ. અને ઓધવદાસજી દૂધરીની જગ્યામાં ભજન, ગૌસેવા અને વિકાસાત્મક કાર્યોનો પ્રારંભ કર્યો. પછી માત્ર બે વર્ષના સમયમાં વિનિઃસ્વાર્પના ઓધવદાસજીનું અવસાન થતાં તેના પછી એમના શિષ્ય મેધસ્વામી દૂધરીની ગાઈએ આવ્યા.

### સંતશ્રી ; મેધસ્વામી

સુરેન્દ્રનગરના ધ્રાંગધા તાલુકાના ભદેચી ગામમાં એક રબારી પરિવારમાં વિનિઃસ્વાર્પના ઓધવદાસજીનોજન થયેલો. બાલ્યકાળથી જ ગૌ સેવા પરત્વે અનહદ પ્રેમ હતો. નાનપણમાં માતા-પિતાના અવસાન બાદ ગાયો ચારવી અને સંત સમાગમ કરવો એ એમના જીવનનો મંત્ર હતો. એક સમયે વડવાળા દૂધરેજ આશ્રમના સંતશ્રી કૃષ્ણદાસજી ત્યાં આવી રહ્યાં. અને મેધરાજનો તેની સાથે પરિચય થતાં કૃષ્ણદાસજી ઓળખી ગયા, કે આબાળકમાં ભક્તિ અને સેવાના ચિન્હો દેખાય છે. એટલે મેધરાજના પરિવાર જનો પાસે તેની માગણી કરી અને આખરે મેધરાજ કૃષ્ણદાસજીનું શિષ્યત્વ સ્વીકારી દૂધરેજ પ્રયાણ કર્યું.

દૂધરેજની જગ્યામાં આવવા છતાં એમણે શાસ્ત્રોક્ત અભ્યાસ કરવાને બદલે ગાયોની સેવા સ્વીકારી એમ ઠત રહેતાં. કૃષ્ણદાસજીના અનેક શિષ્યોમાંથી એમને ઉધવદાસજી સાથે એમને અગાઢ મૈત્રી હતી. એટલે તે ઓ પણ દૂધરી આવી રહ્યા અને ઉધવદાસજી પછી ગાઈપતિ બન્યા.

મેધસ્વામી દૂધરીની ગાઈએ આવતાં ધાંગધાના રાજવી રણમલજી સાથે એમનો સંપર્ક થયો. રણમલજી મેધસ્વામિથી પ્રભાવિત થયા અને એમનું શિષ્યત્વ સ્વીકાર્ય મંદિર અને જગ્યા માટે રાજ તરફથી મદદ મળવાલાગી. મંદિર, કોઠાર, ભંડાર, ધર્મશાળા, અન્નક્ષેત્રો વગેરેનું બાંધકામ થયું. ભોજન અને ભજન થવા માંડયા અને દૂધરીની જ્યારી તારે તરફ ફેલાવા લાગી. લોકસેવા અને પરમાર્થના કામ થવા લાગ્યા.

મેધસ્વામિનો ખડિયો લઈને ચોર ભાગેલા તે પ્રસંગમાં સંતની દ્યાર્દ્દ લાગણી પણ મેધસ્વામિનાસંતપ્ત શાનો ઉત્તમ પુરાવો છે. ઉપરાંત પાણીની ખેંચ માટે તળાવ ગાળાવવાન કાર્ય તેમજ મેધશ્વર મહાદેવનુંમંદિર આજે પણ આ સંતના સત્કાર્યાની પ્રેરણા આપતાં ઉલાં છે. એમનો ગાયો તરફનો પ્રેમ પણ અદ્ભૂત હતો. ગોમતી નામના ગાયે એમને ઢીક મારી એમની તબિયત લથડી પરતુ એમણે કહ્યું મને કંઈ નથી થયું ગોમતીની સંભાળ લ્યો. આ ઘટનાથી સંતની તબિયત લથડી. દૂધરેજ વગેરે સ્થાનકોથી સૌસંતોને બોલાવી લેવામાં આવ્યા. આ સૌસંતોને બંનેજગ્યા ઓ વિનિઃસ્વાર્પના દિવસે દેહ ત્યાગ કર્યો. એમને સમાધી આપવામાં આવી.

### સંતશ્રી ; સેવાદાસ

મેધસ્વામી પછી સેવાદાસજી દૂધરીની ગાઈએ આવ્યા. અને પોતાને માથે આવેલી જવાબદારીએમ શે પૂરી નિષ્ઠાથી નિભાવવાનો પ્રયત્ન કર્યો. તેઓ સીધા, સરળ અને પરોપકારીવૃત્તિના હતા. એમના સમયમારસોડા રાત દિવસે ખુલ્લાં રહેતા. એમણે એમના ગુરુ પાછળ વિનિઃસ્વાર્પના મોટો સંતમેળો કર્યો. એમાંસૌરાષ્ટ્રભર માંથી સાધ, સંતો અને રબારી સમાજના લોકો ઉમતી પડેલાં. એ વખતે ગંજેળાના વતની ભગવાનને એમણે દીક્ષા આપી શિષ્ય પદે સ્થાપ્યા.

સેવાદાસ પછી ભગવાનદાસ ગાદીએ આવ્યા. અમણે પણ લોકસેવા અને સંત સેવાનાંકાર્યો કર્યા. પોતાના ગુરુ પાછળ ઉત્સવ કર્યો અને વિન્સ. સ. ૧૮૮૮ માં તેનું નિધન થયું. તેમના પછી સંત લક્ષ્મીદાસજીના પિતાના ગાદીએ આવ્યા. સંત ભગવાનદાસ પાછળ ૧૮૮૭ માં સંતમેળો કર્યો. અને હાલના મંદિરનો શિલાન્યાસ કર્યો. પોતાના જીવન કાર્ય પૂરું કર્યું. લક્ષ્મીદાસજી પછી દૂધઈની જગ્યાનો વહીવત પુરણદાસજી સંભાળે છે. પુરણદાસજીના રબારી પરિવારમાંથી આવેલા પિતાનું નામ ભજુભાઈ અને માતાનું નામ રામભાઈબા હતું. માત્ર બે અઢી વર્ષની ઉમરથી દૂધઈ માં મૂકવામાં આવ્યા હતાં. એમનો ઉછેર અને જીવન ભક્તિ આ જગતમાં જ પાંગરીપમરાટ પાથરો અને અસ્ત થયાં.

### સંત ; રામબાલકદાસજી

દૂધઈ વડવાળાની જગ્યાના વર્તમાન મંહત સંતશ્રી રામબાલકદાસજી છે. તેઓ યુવાન અને કાંતિકારી છે. એ મણે મોરારીબાપુની રામકથાનું દૂધઈમાં આયોજન કર્યું હતું. અને સમગ્ર સંતાંડળને દૂધઈ જગ્યામાં આમંત્રિતકરેલું. અને સાથે – સાથે સમયના સંદર્ભે શિક્ષણ અને કન્યાકેળવણી ઉપર ખૂબ ભાર મૂકે છે. ભણેલો માણસ સારોવ્યવસાય પણ કરી શકે છે. આ વાત લોકોને ગળે ઉતારવા માટે સમાજમાં તેઓ સતત વ્યાખ્યાનો આપતાં રહે છે. અને લોકોમાં જાગૃતિ થાય, વિકાસ થાય અને સમાજ પ્રગતિ કરે તેના માટે વિચારતા રહે છે. અને એ વિચારધારાસમાજમાં પ્રસરે તેના માટે સતત પ્રયાસો પણ કરતાં રહે છે. શિક્ષણના વિકાસના હેતુસર ચોટીલામાં છાત્રાલયપણ ચલાવે છે. ઉપરાં ત સમગ્ર ગુજરાતના ખૂણો – ખૂણો ફરીને જાગૃતિ અભિયાન દ્વારા લોક શિક્ષણ ફેલાવવાનોઅથાગ પ્રયત્ન પણ કરે છે.

સંતશ્રી; રામબાલકદાસજી સ્વભાવે શાંત વિચારોએ ગણન અને દેખાવે રમણીય છે. એમને મળવાથી એ ક સંતને મળીને શાંતિનો અનુભવ આ લખનારને પણ થયો છે. રામબાલકદાસજી વર્તમાન દૂધઈ મંદિરનાગાદીપિતા છે. જગ્યાનો અને સમાજનો ઉત્તમ વિકાસ કરી દેશ – વિદેશ સુધી નામના ઉભી કરશે એવી અભીપ્સાસહ અટકી એ.

સૌરાષ્ટ્રના રબારી સંતો નિમિતે આપણે અહી દૂધઈ અને દૂધરેજના કેટલાક ગણના પાત્ર સંતોનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તવમાં જીણવટપૂર્વક અભ્યાસ કરી લખવામાં આવેતો એક મહાંથનનું નિર્માણ થાય એટલા સંતોઓ બંને સ્થાનોએ આપ્યા છે. અભ્યાસ કેત્રની મર્યાદાને કેન્દ્રમાં રાખી અહી માત્ર થોડો ઉલ્લેખ કર્યો છે.

### માહિતીદાતા

- (૧) સદ્ગુરુજીવન દર્શન કેશુભાઈ બારોટ
- (૨) દૂધઈ વડ દર્શન—નયનભંડ
- (૩) દૂધઈ વડવાળા ધામનાદૈવી સંતો નિરંજનરાજાગુરુ
- (૪) સંત બાલકદાસજી દૂધઈ રૂબરૂ મુલાકત.

### સંત ; દેવીદાસ અને પરબ પરંપરામાં રબારી સંતો :

બેસાણની બાજુમાં હજારો વર્ષ જૂનો ઘણો ચેતાવનાર સુપ્રસિદ્ધ સંત દેવીદાસબાપુ જગ પ્રસિદ્ધ સંત છે. આ સંત વિશે આપણ રાષ્ટ્રીય શાયર જવેરચંદેઘાણી તેમજ હરસુર ગઢવીએ વિગત પ્રચુર લખાણો લખેલ હોવાંછીતાં દેવી દાસ બાપુના જીવનની કેટલીક વાસ્તવિક વાતો રહી જવા પામી હતી. દેવીદાસબાપુના ભાઈ રૂડાપીરનીાઠમી પેઢી એ વર્તમાન સમયમાં મુંજિયાસર ગામે દેવીદાસબાપુની જન્મભૂમિ સંભાળીને બેઠેલા નારદ બાપુએ 'અલખજ્યોત 'ન મના પુસ્તકમાં સંશોધનાભક્ત દષ્ટિકોણ રાખી કેટલીક હક્કીકતો પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે. જે સાચી જજાતાં એ ને આધારભૂત ગણવાનો પ્રયાસ કર્યો છે.

સંત દેવીદાસબાપુના પૂર્વજો ઉત્તર ગુજરાતમાં આવેલા પેપળુ(પેપળી) ગામના વતની હતા. સંવત ૧૯૦૦ની આસપાસ ભયંકર દુષ્કાળ પડતાં એ સમયે પરમાર શાખના દુદાભાઈએ સૌરાષ્ટ્રમાં આવી વસવાટ કર્યો. એ સમયે મુજિયાસર ભોકાવાળાની રાજધાની હતી. અને મુંજલપુર નગરી તરીકે ઓળખાતી. દુદાભાઈને આશરો મળતાં મુજિયાસર સ્થિર થયા. દુદાભાપાને એક દિકરો હતો એનું નામ બિજલ. આ બિજલભાઈને બે દિકરા હતા. પુંજાભાઈ અને લખમણભાઈ, પુંજાભાઈ ના લગ્ન અજાણા શાખના રબારીની દિકરી સાજણમાં સાથે થયેલાં

પુંજાભાઈના કેટલાક પરિવારો ત્યાંથી જતાં રહેલા. પુંજાભાઈ એમની કુળદેવી મૌખાઈ માતાજીના ભૂવા હતા. પરંતુ એમને કોઈ સંતાન ન હતું. થોડા વર્ષો વિતી ગયા છતાં તેઓ નિઃસંતાન રહ્યા. એટલે પરિવાર તેમજ સગા સંબંધોના આગ્રહને કારણે ભાડકા શાખના રબારીની દિકરી રતન સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ એમને પણ કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. તેના કારણે આ બંને સ્ત્રીઓ અને પુંજાભગતને મહેણા સહન કરવા પડતાં. પુંજાભગત માત્ર ભગવાનમાં શ્રદ્ધા રાખીપાર્થના કર્યા કરતા. હે ભગવાન અમારા મહેણા ભાંગવા તમારે આવવું પડશે! ધાસચારાની ખેંચ ઉભી થઈ. આખરે પુંજાભગતે મુજિયાસર છોડીને ગિરનારના પડધારમાં સોનરેખ નદીપાસે જ્યાં નજીકમાં રામનાથની જગ્યા આવેલ હતી. ત્યાં આવીને વસસાટ કર્યો.

પુંજાભગત રામનાથ પાસે નેસડા બાંધો રહેવા લાગે છે. એ સમયે રામનાથની જગ્યામાં જેરામભારથી નામ ના સંત ધંઢો દ્ખાવીને બેઠા હતા. તો સામેના કુંગર ઉપર નુરસત્તાગર સાંઈ બેઠા હતા. આ બન્ને સ્થિધમહાત્મા ઓનો પુંજાભગતને પરિચય થયો. પુંજાભગત શ્રદ્ધાળું હતાં. અવાર-નવાર આ બંને સંતો પાસે સેવાઅને સત્સંગ માટે જતાં અને પુંજાભગતની પત્તિઓ સાજણમાં અને રતનમાં પણ સંતોને સાંજ-સવાજ દૂધ પાવાજતી. આ રીતે સંત સમાગમ અને સંત સેવા કરતાં રહ્યા. એવામાં વરસાદનો સમય આવ્યો વરસાદ સારાપ્રમાણમાં પડવા લાગ્યો, આખરે પુંજાભગતે પોતાના નેસડા ઉપાડી મુજિયાસર જવાની તૈયારી કરી. તેમની પત્તીઓ જેરામભારથી બાપુને છેલ્લી વખત દૂધ પાવા માટે ગઈ. ત્યારે જેરામભારથી બાપુએ પૂછ્યું તમારે કેટલાદીકરા? ત્યારે બંને સ્ત્રીઓને કહ્યું ઈઆ જગતમાં છે એ બાપુ અમારા જ દિકરા છે. આ વાક્ય સાંભળી જેરામભારથી સમજી ગયા કે આ સ્ત્રી ઓ નિઃસંતાન છે. એટલે જેરામભારથી બોલ્યા : હું તમારો ઋષ્ણી છું. તમે મને દૂધ પાસું છે હું તમને આર્શિવાદ આપું કે, તમારો ત્યાં દિકરા થશે. અને એવા તેજસ્વી થશે કે જગતમાં નામના કમાશે. જેરામભારથી ગુરુદૃત ભગવાનના ઉપાસક હતા. અને ગુરુદૃત એમને પ્રત્યક્ષ પ્રસન્ન હતા. એમણે ગુરુદૃતની આરાધના કરી દત્તભગવાન પ્રસન્ન થતાં જેરામ ભારતીએ બધો વાત કરી. ત્યારે ગુરુદૃતે કહ્યું કે, એમના ભાગ્યમાં દિકરા નથી. પરંતુ હું ત્રણે સ્વરૂપે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણા દિકરા તરીકે પુંજાભગતને ત્યાં અવતરીશ. ત્યારે જેરામભારથી કહે છે, મારા વચન પાલન માટે પ્રલુબ તમારે જરૂરું પડે એ બરાબર નથી. ત્યારે દત્તભગવાને કહ્યું, આ બધો લીલા છે. રામાવતારમાં સરલંગઋષિ અમારી આરાધના કરતાં-કરતાં એમનું શરીર હડમાંસનું પિંજર બની ગયેલું એમાંથી લોહી પરું નિકળ તાં હતાં. ત્યારે અમે દર્શન આપી વચન આપેલું કે, કળયુગમાં રક્તપિતના રોગીઓની સેવા કરવા અમે અહીં આવી શું. એ વચન પાલનનો સમય આવી ગયો છે. એટલે અમે જન્મ ધારણ કરીશું અને તમે અમારા ગુરુ હશો. આ રતે જેરામભારથી સાથે સંવાદ કરી ગુરુદૃતઅદશ્ય થયા.

### સંત ; દેવીદાસબાપુ

॥ સોરઠમાં તો સંત પદ્ધાર્યા પ્રગટ થયા પીર,  
દત સ્વરૂપે દેવાંગી થયા અલખ તણા એ વીર . ॥

પુંજાભગત અને સાજણમાને ત્યાં દેવા, રૂડો અને માંડળ જન્મે છે. અને આ ત્રણ પુન્નો ભવિષ્યમાંમહાન સંત બને છે. દેવો બાલ્યકાળ પિતાના સાંનિધ્યમાં પશુપાલનનો વ્યવસાય કરી પસાર કરે છે. સાથે સાથેબીજાના દુઃખમાં ભાગ લેવો, સેવા પૂજા કરવી વગેરે ભક્તિના સંસ્કારો બાલ્યકાળથી જ આબાબતે નારદ બાપુનોધ છે કે " એક સમયે એવો બનાવ બનેલો ક " દેવાએ કોઈ બીજાનું દુઃખ દૂર કરવા તેની ઉપરની આફતોપોતાના પર લઈ લીધો. ત્યારેમાં મેલડી પ્રગટ થઈ દેવીદાસને દર્શન આપ્યા. અને બધો આફતને દૂર કરી. આદિવસથી મુજિયાસ

૨ ભગત પરિવારમાં કુળદેવીરૂપે મોમાઈમાંની સાથે માં મેલડી પણ પુંજાવા લાગ્યાં. આરીટે બાલ્યકાળથી જ પુંજા ભગતના દિકરા દેવા ભગત ઉર્ફ દેવીદાસ પરોપકારનાં કાર્યોને વરેલા હતા. સમય જતાંઉમર લાયક થયા. ત્યારે તેમના લગ્ન આલ શાખના રબારીની દિકરી હિરબાઈમાં સાથે થયેલાં. દેવીદાસબાપુનાઅન્યત્ર લખાયેલાં ચરિત્રોમાં એમન કોઈ પારિવારિક ઉલ્લેખ મળતો નથી.પરંતુ સંશોધન કરતાં કેટલીક વિગતોપ્રાપ્ત થાય છે તે એ છે કે , તેઓ પરણોલ હતાં હિરબાઈમાં અને દેવીદાસબાપુને એક દિકરો હતો. એનું નામડોસો હતું. અમના વહીવેચાં બારોટના ચોપડે નોંધાયેલું એમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે.

દેવીદાસ → પત્નિ હિરબાઈમાં જીવતાં સમાધા



ડોસા → પત્નિ જશુબેન અજાણા



નારણ → પત્નિ બાંધાબેન ગરચર



દેવાત → પત્નિ માલીબેન લવતુંગા



વાલા → પત્નિ હિરુબેન અજાણા



વાધો → પત્નિ મણીબેન બાર



મેરામ → કાંધા(હાલમાં વેકરીયા ગામે રહે છે.)

( દેવીદાસ બાપુના નામ વિ.સ. ૧૮૧૫માં મોસાળ વાવડી ગામે લખાવેલા.)

ઉપરોક્ત વંશવૃક્ષમાંથી એમનો પરિવાર અત્રતત્ર પશુપાલન વ્યવસાય અર્થે પરિબ્રમણ કરતો રહે છે. કાંધ આજે વેકરીયા ગામે રહે છે. અને પશુપાલનનો વ્યવસાય કરે છે.

દેવીદાસની ઉમર ઉઠ વર્ષની આસપાસ પહોંચી ત્યારે તેમના ધર્મપત્નિ હિરબાઈમાં સમાધી લેવાનો સંકલ પ કરે છે. દેવીદાસ અનુમતિ આપી અને વિ.સ. ૧૮૪૦ની સાલમાં હિરબાઈમાં મુંજિયાસરની જગ્યામાં સૌપ્રથમ જીવતાં સમાધી લે છે.હિરબાઈમાં સમાદિસ્થ થયા પછી દેવીદાસબાપુ પોતાના ઘરનો કારભાર પોતાના પુત્ર ડોસાભ ઈને સોંપી રામનાથની જગ્યામાં આવી પહોંચે છે.અને ગુરુની સેવા પૂજા કરે છે.એક સમયે ગુરુ-જેરામભાઈથી એમને કહે છે કે , દેવીદાસ હવે તું પરબે જઈ ધ્યાં ચેતાવ ! ગુરુની આશ્વાને માન આપી દેવીદાસબાપુ થોડો સમય છોડવડી રોકાઈને પરબે જાય છે. ત્યાં વર્ષોથી ઉજુજુ અને વેરાન પડેલી જગ્યામાં જઈ અને સાફસૂફીકરી.ઝુંપડ બાંધો જગ્યા જાગૃત કરી રહેવા લાગે છે ,ત્યાં આવતાં માલધારીઓ સાથે સત્સંગ કર છે.એવામાં એક માલધારી પોતે જોયેલા એક રક્તપિતના રોગી અંગે વાત કર છે. જે સમાજે ત્યાગી દીઘલી છે.દેવીદાસબાપુને જાણ થતાં એ રક્તપિતનો ભોગ બનેલ માણસને લઈ આવ છે અને તેના રોગની સારવાર કરવાલાગે છે.લોકો જેનાથી દૂર ભાગે છે અને થોડો સમય આશ્રમથી પણ લોકો દૂર ભાગવા લાગ્યાં.પરંતુ દેવીદાસબાપુરક્તપિતના રોગીઓની સારવાર ચાલુ રહે છે. આખરે દેવીદાસબાપુ રક્તપિતના રોગીની સારવાર એ જ સેવાયજી બનાવે છે.

જવેરચંદ મેધાશી ,શીવદાન ગઢવી વગેરે એ દેવીદાસબાપુની રક્તપિતની સારવાર વર્જનાત્મક રીતે એમ ના પુસ્તકોમાં રજૂ કરેલ હોય આપણે માત્ર ઉલ્લેખ જ કરીશું.દેવીદાસબાપુના સંતજીવનની કેટલીક મહત્વનાધટનાઓ માં જીવનભર રક્તપિતનાં દઈની સેવા , અમરમાનું પરબે આવવું. સન્યાસ લેવો , અને સસરાપક્ષનીગેર સમજ , અને દેવીદાસબાપુ પર હુમલો ,શાદૂર્ણ ભગતને શિષ્ય બનાવવો એમનામાં શાદૂર્ણ ભગતના જીવનમાંપરિર્વન લાવવા

નો પ્રયાસ , અમરમાં અને શાહુરી ભગતને ભક્તિતમાર્ગ વાળી લોક સેવા અને લોકકલ્યાણ માટેપરવા અને પરબની જગ્યાને સેવાનું ધામ બનાવવું, ખંબે જોળી લઈ ટૂકડો માગી રોગીને અને ભૂખ્યાને જમાડવાં.આ સિવાય એમણે કોઈ ચંદ્ર વદ્વાતાની વાતો કરી નથી. એમને મનતો નારદબાપુ લખે છે તેમ 'દેવીદાસબાપુ' કહે છે મારે મનતો આની સેવા કરવી જાગતા નરની સેવા કરવી આના રોગને દૂર કરવા તેની સફાઈ કરવી એ જ ભક્તિ છે. હું ભજન કે ભક્તિ જાણ તો નથી. હું ,તો મનુષ્યોની રોગીઓન ભૂખ્યાઓની સેવાને જ ભક્તિ માનું છું.આ સેવા કરવા અર્થાતું આશ્રમ ચલાવવા એની પાસે કોઈ ગામ ગરાસ ન હતો. એટલે લોક કંઠે ગવાયું છે.

"કે 'ને ખેતર વાડિયું , કે ' ને ગામગરાસ  
આકાશી રોળ ઉતરે , નકળંક દેવીદાસ . "

પરબધામમાં આ રીતે સેવાની અલખજ્યોત જગાવી સેવા કરતાં કરતાં આખરે એક દિવસે પોતાન કાર્ય પૂર્ણ થવાની જાણ જતાં સમાધી લેવાનો સંકલ્પ કરે છે. અને જાહેર કરે છે. અનેક સંતો મહંતો સાધારો યોગીઓ અને ભક્તોને બોલાવી અખાઢી બીજના દિવસે દેવીદાસબાપુ સમાધી લે છે.

નોંધ:-

આ સંત વિશે સૌ ને જાણ છે. ગુજરાતી ફિલ્મ પણ બનેલી. ટેલીફિલ્મ પણ બનેલી અને પુસ્તકો પણ લખાયાં દશ વિદેશમાં આજે પરબધામ પ્રઘાત છે. આપણે વધારે વિગતોમાં પડતા નથી.

## સંત માંડણાપીરબાપુ

સંત માંડણાપીર દેવીદાસબાપુના અનુજ હતા. તેઓ પણ સંસારી જીવન જીવતાં હતાં. મુંજિયાસરમાંરહી ને સેવા પૂજા અને ભક્તિ કરતાં હતાં.મુંજિયાસરમાં કાળેશ્વરના મંદિરે પૂજા કરતા અને કાળેશ્વર મહાદેવનીએમના ઉપર કૃપા પણ હતી. હિરબાઈમાંની સમાધાની પૂજા પણ માંડણાપીરબાપુ કરતાં.

સંત દેવીદાસબાપુની સેવાભક્તિની અસર માંડણાપીર બાપુ પર ખૂબ હતી. જો કે બાલ્યકાળથી જ એમણે પર ચો આપીને પીર બનેલા. એક વખત ઠોર ચરાવતાં સૌ ગૌવાળ મિત્રોએ બોજન બનાવવા માટે ચોખાની દેગમૂકેલી તે માંડણાપીર બાપુએ ઉતારીને પરચો આપેલો.

દેવીદાસબાપુએ પરબમાં તો માંડણાપીરબાપુએ મુંજિયાસરમાં સવાની જ્યોત જલાવી હતી. ધીમે-ધીમેમાંડ ણપીર ભૂખ્યાને ટૂકડો અને રોગીઓની સેવાનો પ્રારંભ કરે છે. ચારેબાજુ નામના ફેલાવા લાગી. અને લોકોનો ધસારો પણ વધવા માંડયો.પરંતુમાંડણાપીરબાપુ ધર-ધર જઈ ટૂકડો લઈ આવી.લોકોને જમાડવા લાગ્યા.એમાં એક દિવસે એક નિઃસંતાન ભાઈ આવીને માંડણાપીરબાપુને દિકરો આપવા માટે કહે છે. અને બાપુ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. પેલો સંતાન પ્રાપ્તિનો સતત આગ્રહ રાખે છે.આખરે બાપુ ધણામાંથી ચાપટી ભરવાનું કહે છે.અને તેને ત્યાં સંતાન પ્રાપ્તિ થાય છે.

માંડણાપીર બાપુની સેવાકીય પ્રવૃત્તિઓ વિકસવા માંડે છે. ધીમે-ધીમે તેનો દુખ્યાની સેવા કરે છે.સાથે - સાથે ગૌ - શાળા પણ ઉલ્લી કરે છે. અને તેના આશ્રમની સુવાસ ફેલાવા લાગે છે. એમના જ ગામનાપમાં ભાઈ પાનસુરિયાને કાળો કોઢ નીકળેલો એ પમાભાઈ બાપુના પગે પડી શિષ્ય બનાવી સેવા કરવા માટે વિનંતિ કરે છે. આખરે માંડણાપીરબાપુ પમાભાઈનો શિષ્ય તરીકે સ્વીકાર કરી માથે હાથમૂકે છે.ત્યાંજ એમનો કોઢમટી જાય છે. અને પમાભાઈ આશ્રમમાં રહીને સેવા કરવા લાગે છે.પમાભાઈના કુંઠુંબજન મેઘભાઈને પણ બાપુના આર્શિવાદથી પુત્ર પ્રાપ્તિ થયેલી. તે મહાકળેશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલો એટલે માંડણાપીર બાપુએ તેનુંનામ કાળો રાખવા કહેલું. આ રીતે માંડણાપીરના પરચાથી લોકો જગ્યામાં ઉમટવા લાંગેલાં. એવામાંમાંડણાપીરબાપુ અડછઠ તીર્થની યાત્રાએ એમના સાથીદારો સાધવેલા બાવા , રાણા ભગત અને ઈગારશા સાથેનીકળી જાય છે.

ભારતભમણ કરી માંડણપીર બાપુ વળતાં પાલિતાણા જેન મંદિરોમાં દર્શન માટે જાય છે. ત્યાં ફરતાં – ફરતાં સાંજ પડી જાય છે. દરવાજા બંધ થઈ જતાં એમને નીકળતવા દેવામાં આવતા નથી. એને ચોરસમજીને અંદર પૂરી દેવામાં આવે છે. આ સંત મંડળ સવારે રાજા સમક્ષ રજૂઆત કરે છે. અમે ચોર નથી સંત છીએ. રાજા વાત સ્વીકારતો નથી. આખરે પાલિતાણાના શેંગુજ્ય પર બધા દેવોને પ્રગટ કરી રાજાને દર્શન કરાવે છે. અને તેમને મુક્ત કરવામાં આવે છે. આ ઘટનાથી ઈગારશા પીર કહે છે માટે અહીં જ સમાધી લેવી છે. કારણકે અહીં આપણા ઉપર શંકા થઈ છે. માંડણપીરબાપુની સહમતિથી ઈગારશાપીર પાલિતાણાના દુંગરમાં સમાધી લે છે.

યાત્રા કરી પરત ફરેલાં માંડણપીરબાપુ રૂડાબાપુને કહે છે, હવે આ આશ્રમની જવાબદારી કરમણને સોંપીમારે વિદાય લેવી છે. રૂડાબાપુ આ વાત સમજી જાય છે. અને સહમતપણ થાય છે. અને આખા પંથકમાં જાણકરવામાં આવે છે. કે, મુંજિયાસરમાં માંડણપીરબાપુ અને તેની સાથે રાણાભગત તેમજ પમાબાપા પાનસુરિયાજીવતાં સમાધી લેવા માંગે છે. આ વાત સાંભળી બગસરાના રાજીવી ત્યાં પદારે છે. અને માંડણપીરબાપુને નમન કરીને કહે છે બાપુ તમે તો સંત પુરુષ છો એટલે જીવતાં સમાધી લેવા માટે સક્ષમ છો. પરંતુ આ પમાબાપા પટેલ કઈ રીતે સમાધી લઈ શકે. છે. એમાં મને શંકા છે.

ઉપરોક્ત ઘટના પછી સમાધીનો દિવસ નજીક આવે છે. કરમણને આશ્રમની વ્યવસ્થા અને જવાબદારી સોંપ માંડણપીરબાપુ રાણાભગત અને પમાબાપા પાનસુરિયા ત્રણે જીવતાં મુંજિયાસરમાં સમાધી લે છે. અને સમાધીની બીજા દિવસે બગસરાના દરબારનાં રાણી દામોદરકુંડ સ્નાન કરવા જાય છે. ત્યાં મળે છે અને કહે છે. કે, 'દરબાર ને કહેજો કે, પમાબાઈ મારી સાથે જ છે. આ વાત રાણી બગસરા આવી દરબારને કહે છે. ત્યારે દરબારને ખબર પડે છે કે, મેં ખોટી શંકા વ્યક્ત કરી એ બદલ પસ્તાવો કરે છે. આજે પણ મુંજિયાસર જૂની જગ્યામાં આ ત્રણે સમાધી મોજુદ પુંજાય છે.'

## રૂડાપીર

આપણે આગળ જોઈ ગયા કે, પુંજાભગતને ત્રણ દિક્કરા હતા. દેવીદાસબાપુ, માંડણપીરબાપુ અને રૂડાપીર આ ત્રણમાંથી દેવીદાસબાપુ અને માંડણપીર સમાધી લીધા પછી રૂડાપીર મુંજિયાસરમાં રહી ભજનકરતાં હતા. જગ્યાનો વહીવટ એમના પુત્ર કરમણ સંભાળતા હતાં. રૂડાપીર સત્સંગ, ભજન કરતા—કરતાં પોતાનોસમય પૂરો થવાની રાહ જોતાં હતાં. તેઓ પણ સમર્થ ભક્તિવાન અને ચયત્કારિક સંત પુરુષ હતા. પરંતુ તેઓ પ્રગટ થવામાં માનતા ન હતાં. એક સમયે સાંઈ છેલાણી નામના મુસલમાન છોકરાને શાર્દૂળ ભગતે કંઈ વાંક સંદર્ભ ઠપકો આપતાં તે પરબ છોડી મુંજિયાસર આવતો હતો. એમાં રૂડાપીર એને રોકવા પ્રયત્ન કરે તે પહેલાં એ તેના પગમાં પડી જાય છે. આખરે રૂડાપીર એને કરપણબાપુના શિષ્ય બનીને રહેવા રજા આપે છે.

એક સમયે રૂડાપીરબાપુ ભક્તો સાથે વાતચીત કરતાં બેઠા હતા. ત્યારે કરિયા દૂધણાથી એમના વેવાઈ આવી પહોંચ્યા હતા. રૂડાપીર અને તેના વેવાઈન ખૂબ સારા સંબંધો હતા. એક બીજાને આત્મિય લાગણી પણ હતી. કરમણભગત આવતાં રૂડાપીરબાપુ પોતાનો સમય હવે નજીક આવી ગયો હોય. આ સંસાર જગતમાંથી સાથે વિદાય લેવાના બોલકોલ કરે છે. આ રીતો સુખ:દુખને સંસારમાંથી વિદાય લેવાની વાતો કરી બંને છૂટા પડે છે.

અમુક દિવસ બંને છૂટા પડ્યાને થયા હશે. ત્યા કરિયા દૂધણાથી સમાચાર આવે છે. કે, રૂડાપીરબાપુનાવેવ ઈ કરમણભગત બિમાર છે. આ સમાચાર સાંભળી રૂડાપીર મુંજિયાસરથી નીકળી પરબ જાય છે. ત્યાંદેવીદાસ બાપુના દર્શન કરી નીકળવાની તૈયારી કરે છે. શાર્દૂળભગત તેને રોકાઈને જમીને જવાનું કહે છે. પરંતુ રૂડાપીરબાપુ પોતાના વેવાઈ બિમાર હોય રોકાઈ શક્યા તેમ નથી. એવું કહી ઉતાવળ કરે છે. શાર્દૂળભગત રૂડાપીરને મેણું મારે છે, કે તો તમે વેવાઈને સાજા કરીને આવજો.

પરબથી નીકળીને રૂડાપીર કરિયાદૂધણા પહોંચે તે પહેલાં રસ્તામાં જ એના વેવાઈની નનામી (સ્મશાન યાત્રા) સામે મળે છે. આ જોઈ રૂડાપીરબાપુ સ્મશાન યાત્રાને રોકે છે. અને શબદી પાસે જઈને કહે છે. થોડીવાર ન રોકાઈ શક્યા? આપણે સાથે જવાના બોલા કોલ કરેલા. ઉઠ ભગત! અને એમના વેવાઈ ઉભા થયા. બંને મણ્યા

પછી રૂડાપીર તલવાર મંગાવે છે. અને સાથે આવેલા સાંઈ શલાણીને કહે છે. આ મસ્તક પરબે લઈ જશે. અને મારા ઘડની સમાધો અહી કરિયાદૂધળા આપશે. એવું કહી મસ્તક કાપો નાખે છે. આ મસ્તક લઈને સાંઈશોલાણી પરબ આવે છે. અને શાર્દૂળ ભગતને રૂડાપીરના મસ્તકની ત્યાં સમાધો આપવાનું કહે છે. આ વાતસાંભળી શાર્દૂળ કહે છે. કે, આ મસ્તકની સમાધો અહી ન અપાય દવીદાસબાપુના દરબારમાં લાંગલ નથીભળતા. શાર્દૂળભગત રૂડાપીરના મસ્તકને ગઢ બહાર સમાધો આપે છે. મસ્તક સમાધોમાંથી બહાર આવી દેવીદાસની સમાધોએ પહોંચી જાય છે. આ રીતે સાત વખત સમાધો આપે છે અને મસ્તક સાત વખત બહાર નીકળે છે. આખરે શાર્દૂળભગત મસ્તકને દેવીદાસબાપુની આશ આપે છે. એટલે મસ્તક બહાર આવતું નથી. પરંતુ શાર્દૂળભગત જે ગઢ ચણાવે છે એ મસ્તક પાડી નાખે છે. આખરે શાર્દૂળભગત માફી માંગે છે. ત્યારે મસ્તકને વાચા ફૂટે છે! અને શાર્દૂળભગતે કહે છે 'તારો ગુનો માફીને લાયક નથી. પરંતુ દેવીદાસબાપુએ કહેલું કે, મારા શાર્દૂળનું ધ્યાન રાખજો. એટલે શ્રાપ આપતો નથી. પરંતુ હવે ગઢ એવો બનાવ કે, મને નમન કરીને અંદર જઈ શકાય. અને તું તારા પસ્તાવા માટે તારી સમાધો એવી રીતે લેજુ કે, જેના ઉપર પગ મૂડી દેવીદાસબાપુની સમાધીએ જઈ શકાય. આ રીતે કહી રૂડાપીરનું મસ્તક શાંત થઈ જાય છે. અને આજે દેવીદાસબાપુના વંશજ પરમારશાખના રબારીઓ રૂડાપીરને શરૂઆપરા તરીકે પૂજે છે. અને કરિયાદૂધળા તેમના વંશજો આજે પણ દેગ કરે છે.

## ચરણદાસબાપુ

દુમીયાણી તા. ઉપલેટાના ભારાઈ શાખના રબારીઓમાં પરબની જગ્યાના ઘણા શિષ્યો થયાં. પછીથી પોતાની જગ્યા બાંધી અને લોસેવાના કાર્યોનો પ્રારંભ કરનાર જે સંતો છે. એમાં ચરણદાસબાપુનું નામ પણનોંધપાત્ર ગણાય. ચરણદાસબાપુનો દુમીયાણી ગામે ઓઘડ મેપા ભારાઈને ત્યાં ઈ.સ. ૧૮૫૦માં જન્મ થયેલો. બાલ્યકાળથી જ ગાયોની સેવા કરવાની તમના કુદરતી રીતે જ મનમાં જાગેલો. એટલે આ સેવાના હેતુથીપરબની જગ્યામાં ગયા. થોડા વર્ષો ત્યાં ગાયોની સેવાચાકરી કરી. ત્યાંથી દેવકીગાલોળ ગયા. ત્યાં પરબની વાડીઝીલ્લા તરીકે ઓળખાય છે. તે વાડીમાં ગાયોના ઘાસચારા માટે ખેતી કામમાં જોડાયા. અને પ્રબળ પુરુષાર્થ કર્યો. એ સમયે સીતારામ બાપુ પણ ત્યાં સેવાકીય પ્રવૃત્તિ કરતા. એમના પરિયયમાં આવતા હતા. સીતારામબાપુએ એમને ભગવો બેખ ઘારણ કરવા કહું અને એ વાતને ચરણદાસબાપુએ સ્વીકારી લીધી.

ચરણદાસબાપુની સેવાચાકરી અને નિષ્ઠા પૂર્વકનું ભજન જોઈ સીતારામ બાપુને વિચાર આવ્યો. કે, ઈન્દ્રાની જગ્યા પણ પરબની જુંપડી છે. અને ત્યાં રવિદાસબાપુ ખૂબ બિમાર અવસ્થા બોગવી રહ્યા છે. ત્યાં ચરણદાસબાપુને લઈને ઈન્દ્રા ગયા. અને રવિદાસબાપુની સેવા અને જગ્યાની સંભાળ રાખવા કહું. ઈન્દ્રા ગયા પછી રવિદાસબાપુએ ચરણદાસ બાપુને પોતાના શિષ્ય બનાવી તિલક કર્યું. અને કાળો ઝબ્બો અને સફેદ ઘોતીનો પહેરવેશ ઘારણ કરેછે. રવિદાસબાપુ એ જગ્યા સંભાળે છે. હાલમાં સુંદર જગ્યા બનાવી છે. ચરણદાસબાપુ ભૂતપ્રેત કે અન્ય કોઈઅંધશ્રદ્ધા યુક્ત કારણોમાં માનતા નથી. જુના સ્મશાનને ઉઘેડી નાખી ત્યાં સુંદર જગ્યાનું નિર્માણ કર્યું છે. મંદિર બનાવી રોજ સેવા આરત કરે છે. પરંતુ એના માટે ખરી સેવા તો છે, ગાયો અને કૂતરા ગાયો માટે સુંદરગૌશાળા બનાવી છે. ગૌશાળામાં પાકું મકાન બનાવી પંખા નખાવ્યાં છે. ગાય અને કૂતરાની સેવા જ પ્રભુસેવાએનો મંત્ર છે.

ચરણદાસબાપુ જ્ઞાતિએ રબારી હોવાથી મૂળમાં માતાજીની ભક્તિનાં સંસ્કાર પણ એમનામા પડેલા જ છે. એટલે માતાજીના છેલાણ કળશ જેવા ઉત્સવો પણ પોતાની જગ્યામાં ઉજવે છે. બળેજના ભુવાાસ્તા જેઠા આતાને બોલાવી સવાસો છેલાણ પાયેલાં અને માતાજીની સ્થાપના કરેલી. અને તે સંદર્ભે અખંડ જ્યોત ચાલુ કરેલી જે આજે પણ અવિરત ચાલું જ છે.

શ્રદ્ધાળુઓ પોતાનો સર્પદંશ થયો હોય કે વીછીનો દંશ થયો હોય અથવા કોઈ પશુને તકલીફ હોય તો બાપુ પાસે જાય છે. ચરણદાસબાપુ સાંઈ છેલાણનું નામ લઈ આશીર્વાદ આપતાં સારુ થઈ જાય છે. થોડા સમય પહેલાં તે જ ગામના લીલાભાઈની ગાય વિયાણી તેના આંચળમાંથી દુધના બદલે લોહી નીકળું, બાપુ પાસે જઈને લીલાભાઈએ રજુઆત કરતાં બાપુએ છેલાણી સાંઈનું નામ લઈને રાફ્ફે દુધ રેડવાનું કહું. અને તે પ્રમાણે કરતાં ગાયને

સારું થઈ ગયેલું. ચરણદાસબાપુ સીધુ સાદું અને સરળ વ્યક્તિત્વ ધરાવે છે. જગ્યામાં આવેલાનું પ્રેમથી જોઈ પરબન ઈ જગ્યાના મહંત શ્રીકરશનદાસબાપુ પણ ચરણદાસને' પરબના ઓદિયા 'તરીકે ઓળખે છે. એ જ એમની ખરી ઓળ ખ છે.

### માહિતોદાતા

(૧) રૂબરૂ મુલાકાત ચરણદાસબાપુ ૩.૧.૬૪

## સતિઓ

સૌરાષ્ટ્રની રબારી જ્ઞાતિમાં થયેલ સતિઓ વિશે પરિચાત્મક ઘ્યાલ મેળવતાં પહેલાં આપણે કેટલીક સ્પષ્ટતા કરવી જોઈએ. ભારતમાં રામાયણકાળમાં સતિ તરીકે આપણે સીતાજીનું નામ લઈએ છીએ. પાર્વતી પ્રથમ સતિતરી કે ઓળખાય છે. ભારતમાં મધ્યયુગમાં અને ત્યારે પછી ૨૦મી સદીના ઉપરાધ્યમાં પણ રાજસ્થાનમાં સતિધટના બની હતી. અને દેશભરના સમાચાર માધ્યમોમાં ચર્ચાઓ જાગી હતી. સ્વાલ્ભિમાન ભંગ થતાં અથવા પતિનોવિયોગ થતાં આપણે ત્યાં સતિ થવાની ઘટનાઓ બની છે. પરંતુ આ સતિપ્રથા એક કુરિવાજ તરીકે અસ્તિત્વમાં હતી. પરંતુ રબારી સમાજમાં જે સતિએ થઈ છે. તે આવા કુરિવાજોના ભોગે થયેલી સતિઓ નથી. કારણકે, રબારીસમાજમાં પતેના અવસાન પછી જીવનભર કુવાંરા રહેવું પડે એવો નિયમ ન હતો. આ સમાજમાં વર્ષોથી પુનઃલગ્નની પ્રથા છે. એટલે કે, પોતાનો પતિ અવસાન પામેતો એ પોતાની ઈચ્છાનુસાર પુનઃલગ્ન કરી શકે. એટલે રબારી સમાજમાં થયેલી સતિ ઓ કોઈ સામાજિક દબાણ કે પરંપરાને કારણે થયેલ નથી.

ઉપર્યુક્ત સપ્ષ્ટતા પછી આપણે એવું કહી શકીએ કે, રબારી જ્ઞાતિમાં થયેલી સતિઓ ક્યારેક લગ્ન પહેલાં તો ક્યારેક લગ્ન પછી પોતાનું સ્વમાન લાગણી કે ભક્તિને કારણે થયેલી સતિઓ છે. દા.ત.પુરબાઈ સતિ બે વખત લગ્ન કરે છે. છતાં એના ભાગ્યમાં વૈધબ્ય જ લખાયું હોય અને પોતાનો જીવન સમય સમાપ્ત થયું હોયપોતાના સ્વબ ણે જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરીને થતી સતિ છે. તો ક્યારે પોતાના સંતાનો હોવાં છતાં મોટી ઉમરે સતિ થયેલ હોય દા.ત. જુમા સતિ. તો ક્યારેક પોતાની બાલ્ય ઉમરમાં ભક્તિનો રૂગ લાગે અને પ્રલુભ્ય જીવન જીવતી સખી ઉપર કાકી આળ મૂકે અને પોતાની મિત્ર દૂધી સાથે સતિ થાય છે. એટલે આપણે અહી જોઈ શકીએ છીએ કે, ભારતીય પરંપરામાં જે સતિનો ખરો અર્થ પોતાના સતિત્વની નિતી, ધર્મ અને ચારિત્યની ઉચ્ચતા સિદ્ધ કરવા સ્વબળે સતિ થતી રહીઓ આ પ્રકારમાં આવે છે. જે સતિઓ વિશે મળેલી માહિતીના અનુસંધાને અહી વાત કરવામાં આવી છે.

## સતિપૂરબાઈ

સોરઠીયા રબારી સમાજ જે અરસામાં વિસ્થાપન અને બમણદશામાં હતો. પશુપાલનનો વ્યવસાયહતો. સાલેમાણના કુંગરમાંથી વિસ્થાપન કરીને સૌરાષ્ટ્રના સાગરકંઠ ઘાસચારો અને પાણી. ઉપલબ્ધ હોય ત્યાંનેસ બાંધી અને રહેતા. આ સમયગાળો વિ.સં. એક હજારની આસપાસનો હતો.

ઉછળી ગામમાં પુરબાઈનો જન્મ થયેલ. પરંતુ બાલ્યળથીજ માતા— પિતાનું અવસાન થયેલ એટલે એનોઉછે ૨ એમના મામા ઈડા મોરીને ત્યાં થયેલો. અને લગ્ન પણ એમના મામાએ કુંભા રબારી સાથે કરી આપેલ. લગ્ન પછી ઈડો મોરી યાત્રાએ જતો રહેલો. યાત્રા કરીને પરત ફરતાં રાતીયા ગામે રોકાય ગયેલો. એ વખતે રાતીયામાં

અરજન કોડિયાતરનો નેસ પ્રખ્યાત હતો. આ સમયમાં પુરબાઈનો પતિ કુંભો અવસાન પાંચો.પુરબાઈ નિ : સંત જન હતી. આખરે મામા ઈડા મોરીને શોધતા શોધતા પુરબાઈ રાતયા આવી ચડે છે.ત્યાં રમતાબાળકોને જોતાં જ અણસાર ઉપરથી પુરબાઈને ખ્યાલ આવી ગયો કે,આ બાળકો પોતાના મામાના સંતાનોજ છે.એ બાળકોને પૂછી ઈડા મોરીનો પતો મેળવ્યો અને આખરે પુનઃમામા સાથે રહેવા લાગ્યા.આખરે મામા ઈડા.

મોરીએ પુરબાઈની ઈચ્છા હોય તો પુન : લગ્ન કરવા માટે પૂછ્યું પુરબાઈએ સમ્મતિ આપી.ખમીદાણા ગામનોરબા રી ખીમો ખાંબલોએ વખતે ઝરીયાવાડા ગામનું ઘણ ચારતો. અને અ વખતે ઝરીયાવાડા ગામના,ચાવડા,શામળા અને ઘામા રબારી ખીમાખાંબલાનું માંગુ લઈને ગયા. અને પુરબાઈએ હા પાડતાં એમના પુનઃલગ્ન મુળખમીદા ણા ના ઝરીયાવાડા રહેતા ખીમા ખાંબલા સાથે થયા.પરંતુ એમના જીવનમાં દાંપત્ય સુખ બહુ લખાયુન હતુ. એક દિવ સ ખીમો ખાંબલો ગાયો ચરાવતો હતો.અને આડોડીયા(એ સમયનામાથાભારે તત્ત્વો)ગાયો લઈગયા. અને ખીમા ખાંબલા ની લડતાં લડતાં વીર ગતી થઈ. તેની સાથે લડતાં શાહુણ કાઠીનામનો લુંટારો પણમરાયો.

પોતાના પતિના અવસાન પછી પુરબાઈ એમની અંતિમકિયા માટે પ્રભાસપાટણ ગયાં. ત્યાં જઈ અંતિ મ વીધી કરી.પ્રાંચી ગયાં. ત્યાં પાણી રેડી પ્રભાસપાટણ આવી બ્રહ્મચોર્યાસી કરી.અને સોમપુરા ગોર સ્થાપ્યા.એ પહેલ મ રબારી સમાજમાં ઉનેવાળ ગોર હતા. જે વિધીવિધાનો કરતાં.પતિ ની કિયા વીધી પુરી કરી પુરબાઈઝરીયાવાડા પરત ફર્યો.

પુરબાઈ ઝરીયાવાડા પરત ફર્યો પરંતુ બે વખત રંડાપો આવ્યા પછી એમને જીવનમાં રસ રહ્યો ન હતો. એટ લે એમણે રબારી સમાજ ના લોકો સમક્ષ પોતાના પતિની પાંઘડી લઈને સત્તિ થવાનો નિર્ણય જાહેર કર્યો. પરંતુ અ નિર્ણયની લોકોએ હાંસી ઉડાવી. શામળા શાખાના રબારીઓ ને પુરબાઈ ની વાતમાં શ્રદ્ધા હતી આખરે પતિની પાંઘડી ખોળામાં લઈને પોતાના જમણે પગને અંગૂઠે અચિન પ્રગટ કરી પુરબાઈસતી થયા. વિ.સં. ૧૦૮૮ માં આ ઘટના બની.

સતિપુરબાઈ કહેવાય છે કે,રબારી સમાજના કાંતિકારી મહિલા હતા.રબારી સમાજનું બંધારણ એમના દ્વારા નક્કી નક્કી થયુ. કુરિવાજો ને બંધ કરી નવા નિયમો સ્થાપ્યા. લાજ કાઢવાનો રિવાજ દુર કર્યો.નાતનાવ્યક્તિ ગત ખર્ચાઓ બંધ કરી ભોજન સમારંભ માટે ઉઘરાણું કરી મહેમાનોને જમાડવાની વ્યવસ્થા કરવી.સમગ્ર રબારી વે શલુશા અને અલંકાર એકસરખા નક્કી કર્યો. ઉનેવાળ ગોર ને બદલે વિધી માટે સોમપુરા ગોર નક્કી કર્યો.વંશાવળી રાખવા માટે અવલીયાભાટ(બારોટ) નક્કી કર્યો. વગેરે સુધારાઓ સત્તિ પુરબાઈને આભારી છે.

સતિપુરબાઈનો પાળિયો આજે ઝરીયાવાડા ગામે આવેલો છે. ત્યાં અણાઢી બીજે ઉત્સવ થાય છે.તેની ઉપર દેરી ઉપર આ પ્રમાણે નોંધ થયેલી છે. ‘ ‘ જ્ય શ્રી સત્તિ આઈ પુરબાઈ , મુ.ઝરીયાવાડા બીલડી ના રહીશ રબારી લાઘા અરજણ બઢ ત્થા તેના પુત્રો શ્રી મેરામજાભાઈ ત્થા ખીમાભાઈ ,પુંજાભાઈ એ આ સત્તિ પુરબાઈના ઓટા ઉપર મંદિર બંધાવેલ છે.

સં.૨૦૨૫ માગસરવદ ૧૧ ગુરુવાર

લી.

રબારી રાજા અરજણ બઢ

હ . તેના પુત્રો.

## માહિતીદાતા

- ૧) કરમણભાઈ ચાવડા. મ. શિક્ષણભામણવાડા ઉ.૪૪
- ૨) અલ્લાદભાઈ લીલડીયા ઉફ્ ઈસ્લામભાઈ જરીયાવાડા ઉ.૭૨
- ૩) મીર, ઈશાકાળા બળેજ. ઉ.૮૭

## **જુમા સતી ( સમય અંદાજે અગિયારમી સઠીનો)**

સૌરાષ્ટ્રમા રબારીઓની પરિબમણની પ્રક્રિયા સંપૂર્ણ સ્થગિતતા ઘારણ કરી ન હતી. પરંતુ કરમટા શાખ ના રબારીઓને વાળાંક સુલતાનપુર ગામે ઉના પાસે ગરાસ હતો. ભાવનગર રાજા સાથે ગરાસ બાબતે ધીગાણુ થયુ.આ ધીગાણામાં ઘણા રબારીઓ ખપી ગયા. એમા જુમા સતીનો પતી પણ સહાદત આપી ચુક્યો હતો.

જુમા (ઝાંઝી) સતીના પિતાનું નામ સોમાસીયા હતું. અને પતિનું નામ જેસાભાઈ હતુ. તેમના સંતનોમાં પાલો, રામો, રૂડો, ભોજો, દિકરીઓમાં સુન્દર, જસાઈ, સોઢી, સેણી આઈ સંતાનો હતાં. એટલે જુમા સતી પુખ્ત ઉમરે સતી થઈ હોય એ સંભવછે. ઉપરોક્ત વિગતો સિવાય જુમા સતી વિષયક અન્ય કોઈ સામગ્રી ઉપલબ્ધ થતી નથી. પરંતુ જામકડોરણા તાલુકાના ઈપાદરીયા ગામે પણ્યિમ દિશામાં જુમા સતીનો પાળીયો આવેલ હતો. જે બે ત્રણ વજ પહેલાં ઉપલેટા તાલુકાના ગણોં ગામે લઈ જવાયો છે. અને ત્યાં એની સેવા પુજા થાય છે.

## માહિતીદાતા

- (૧) ભીમભાઈ બારોટ લોએજ ઉ.વ. ૭૫
- (૨) દેવાભાઈ કરમટા સેવા નિવૃત બેંક મેનેજર ઉ.વ. ૭૦  
મહંત સીમરોલી તા. કેશોદ

## **જાસી સતી :વિ.સં.૧૧૨૫ની આસપાસ**

પોરબંદર ના કુછડી ગામમાં જાસીસતીની તેરી આવેલી છે. તેના પિતાનું નામ રાજાભાઈ પતિનું નામ મેરા મણભાઈ હતું. અને પુત્રો માલાભાઈ અને જેતાભાઈ હતા. સતીની જગ્યા 'જાસી ચોરા' તરીકે પ્રખ્યાત છે. પરંતુ સર્ત ના અન્ય જીવન વિશે પ્રકાશ પાડતી કોઈ વિગત સાંપડતી નથી. જો કે લોકો સતીની પુજાકરે છે. પરંતુ તેમની ઐતિ હાસિકતાની કોઈને ખબર નથી. છતાં બટુકભાઈ બારોટ (લોએજ) પાસેથી મળેલી વિગતો આ પ્રમાણે છે. સતીન પાછળ ઊછળી વળાંકમાંથી નાગવીયો આવેલ છે. સં. ૧૧૨૫ની સાલમાં જાસીનું ઘણ સાતબારા ના રાબહારવટીયા વારી ગયા હતા. તે નાગવીયો વારસ કરી પાછ વાળેલ. જાસીના દિકરા માલો તથા જેતોધીગાણામાં મરાયા આ કાર્ણે જાસી સતી થયેલ.

## માહિતીદાતા

(૧) બટુક બારોટ ૩.૭. ૬૫  
લોએજ

## **સખીસતિ બખરલા સમય વિ.સં. ૧૫૫૦**

પોરબંદર જિલ્લાના બખરલા ગામે સખી સતિ થયેલ છે. બખરલા ગામન ઉગમણો જાંપે તેરી આવેલી છે. સખી સતિ ચાવડા રબારીની દિકરી હતી. બાલ્યકાળમાં માતા—પિતાન અવસાન થતાં સખી નો ઉછેર કાકા—કાકી પાસે થયે લો. કાકી નો સ્વભાવ કડક હતી. અને મેણાં ટોણાં મારી માનસિક ત્રાસ આપતાં. પરંતુ સખી નો સ્વભાવ ધાર્મિક હતો. બ્રાહ્મણની દીકરી દુધી એમની બહેનપણો હતી. એમની સાથે સત્સંગ અને પ્રભુ ભજનમાં એ ત્રાસવિસરવાનો પ્રયાસ કરતી.

સખી સતીનો ભાઈ વહેલી સવારે દોર ચરાવવા જતો એમાં એક દિવસ શિયાળા નો સમય અને ઠડી વધારેહતી. એટલે એમણે ધાબળો લીધો. પરંતુ એ ધાબળો ગામ બહાર નીકળી ને ઓઢવાનો પ્રયત્ન કરતાં એમાંથીસખી સંતું કાપડું નીકળતા એમના ભાઈએ સામેથી મળતાં લુણામેર ને કાપડું ધરે આપી દેજે એમ કહીનેકાપડું ધરે મોક લાવેલું લુણામેરે સખીસતિનું કાપડું ધરે આપતાં સખી સતિ ની કાકીએ સખીસતિ પર ચારિયનોશંકા વ્યક્ત કરી. અને સખીસતિને ન કહેવાના વેણ કહ્યાં. આ કારણે સખીસતિના હદ્યમાં અભિની જવાળાઓપ્રગટી ઊઠી ! પોતાના ઉપર ચારિય શંકાના આરોપો અસહ્ય થઈ પડ્યાં આસમય સખીસતિ ની ખાસ બહેનપણીબ્રાહ્મણ કન્યા દુધી બહેન બહાર ગામ હતા. બંને એવી બહેનપણી હતી કે, બન્નેના માત્ર ખોળિયાં જુદાને પ્રાણએકહતો. સખીસતિ પોતાના પર થયેલા આરોપોની જે વેદના વેઠી રખા હતાં. એનો ભાસ દુધી ને થતા એ તરત જપોતાના ગામ આવે છે, અને બંને એક સાથે સતિ થવાનો નિર્જય કરે છે. એમનાં શરીર માંથી અભિન પ્રગટે છે. અને બખરલા ગામેને જાંપે બન્નેના ખોળીયાં સળગી એ રાખ થઈ જાય છે. આબંને સતિઓ ની તેરીઓ પાસે પાસેઆજે બરખલાને જાંપે ઊભી છે. આ સંતતાઓની પુજા દેલવાડીયા પાંખીના ચાવડા પરિવાર કરે છે. બખરલાગામની મહેરકે હરિજનની દિકરીઓ પરણી ને સાસરે જાય અને પ્રથમ પુત્રનો એમને ત્યાં જન્મ થાય ત્યારે આબંને સતિઓને પહેરામણી ધરે છે. આ વિધી ચાવડા પરિવાર પણ કરે છે. આ ગામ માં આજે એકપણ ચાવડાપરિવાર રહેતો નથી. મુજબ આ ગામમાં ચાવડા, શામળા અને મોરિશાખના રબારીઓ રહેતાં હતાં. હાલમાણોડિયાતર, રાડા અને મોરી શાખના કુલ ત૦ પરિવાર રહે છે. આ બધા પરિવારો સતિ ની સેવા પુજાકરે છે. ઉપરાંત મહેર સમાજ પણ સતિની સેવા પુજા કરે છે. સતિના સમય સંદર્ભે બારોટ ના ચોપડે નોંધાયેલી વિગત મુજબ ‘દરબાર રાજાખીમાળું’ રાજછાયાંમા હતુ. જે જેઠવાવવં શના હતા. એ સમયે મહેર પટેલમેરામજા હતા. સતિ સખીએ સં. ૧૫૫૦માં સત લીધું.

## માહિતીદાતા

- ૧) વીરાભાઈ કોડિયાતર તંત્રી રબારી મહિમા બખરલા ૩.૫૦
- ૨) દાસાભાઈ ચાવડા કેશોદ ૩.૫૫
- ૩) કાનજી હરજી બારોટ જૂનાગઢ ૩.૭૫

કુતિયાણા ગામે ભીની સતી થયેલ છે. તેના પિતા નું નામ લુંબા કરમટા હતુ. કુતિયાણા ગામે રામદે વપીરનું મંદિર આવેલું છે. એ સમયે આ મંદિરના પુજારી સાધુ નાગજી મહારાજ હતા. સાધુ સુપાત્ર જણાતાંભીનીએ સાધુને દરરોજ દૂધ આપવા જતાં. આ રીતે દરરોજ ભીની સાધુના પરિચયમાં આવતાં સત્તસંગ વધ્યો. આખરે ભીની એ સાધુ નાગજી મહારાજ ને ગુરુપદે સ્થાપ્યા. અને ભીનીએ સતત બાર વર્ષ સુધી મહારાજને દૂધ પાયુ. અને સત્તસંગ કર્યો. પરમતત્વ ની સુજ જાણે એમના ગુરુમહારાજને પ્રતાપે પુર્ણરૂપે ઘાત થઈ ચૂકી હતી.

સાધુ નાગજી મહારાજ ને દૂધ પાવાનો એમનો (ભીની) ક્રમ ચાલુ હતો. એવામાં એક દિવસ ભીની સાધુને દૂધ આપવા માટે જાય છે. ત્યાં એમને સમાધી ગાળતા જોયા, એટલે ભીનીએ ગુરુમહારાજને પુછ્યું, ગુરજી આ શું કરો છો? ત્યારે ગુરજી એ જણાવેલ કે, આજે મારે સમાધી લેવાની છે. આ વાત સાંભળતાં જ ભીનીના રોમેરોમાં સત્ત પ્રગટ થયું. અને ગુરજીને કસુંચા સમાધી મારી છે, તમારે બીજી સમાધી ગાળવી જોઈએ એમ કદ્યુત્યારે ગુરુમહારા જે પ્રમાણ માગ્યું કે, આ સમાધી તારી હોયતો પ્રમાણ આપ? ત્યારે ભીની સતી એ જણાયું કે, આજીયાએ થોડું વધારે ખોદકામ કરો અને ચુંદરી તથા મોરિયો નિકળેતો માનજો કે આ સમાધી મારી છે. એમ કરતાં મોરિયો અને ચુંદરી ની કણ્યાં. એટલે ગુરજી એ ભીનીસતી ને સમાધી લેવાની છુટ આપી. પરંતુ ભીની સતી એ પોતાની સમાધી કુતિયાણા રબારીની જોકમાં લેવાની ઈચ્છા પ્રગટ કરતાં, આખરે સાધુ નાગજી મહારાજે અનુમતિ આપી. સૌ કુતિયાણા નજી કરબારી જોકમાં એકત્રિત થયા. ત્યારે ભીનીસતીએ સાધુ શ્રી નાગજી મહારાજને એક વચન આપતા કહ્યુંકે, મારીસમાધી ને પ્રથમ સાધુ જુવારે ત્યાર પછી બીજા જુવારી શકે. સાધુશ્રી એ વચનઆપતાં સતી એ માતા ધરતીને પ્રાર્થના કરી અને માતા ધરતી એ જગ્યા આપતાં સમાઈ ગયાં. એ સ્થળ આજે કુતિયાણામાં માતાજીના મંદિરથી પશ્ચિમ દિશામાં છે.

બારોટના ચોપડે નોંધાયેલી વિગત મૂજબ, લુંબા કરમટા ની ડિકરી—મેરામજને જશો બાવલી બે—માજી વીબેન પાંચાકરમટા, મેરામજા આવા, આવાનાપાંચાના બાંયાબેન મા ભીની લુંબા કરમટા, વિક્રમ સંવત ૧૮૭૩ ફાગણ સુદ બીજને મંગળવારે કુતિયાણામાં જીવતા સમાધી લીધી.

### માહિતીદાતા

- ૧) બધા ટીડા મોરી ૩.૫૦ પશુપાલન કુતિયાણા
- ૨) વિજયદાસ બાપુ ૩.૫૫ પુજારી કુતિયાણા
- ૩) બહુકભાઈ બારોટ ૩.૫૫ વહીવંચા લોઅેજ,

### હાંસબાઈ સતી

કુક્સવાડા તા. માળીયા હાટીના ગામે નેસમાં હાંસબાઈ સતી નો ડેરી આવેલી છે. પરંતુ એમના સતી થવાના કોઈ કારણો મળ્યા નથી. માત્ર ચાવડા પરિવાર સતી ની પુજા કરે છે. પરંતુ કોઈ એમના વિશેની માહિતી આપી શકતું નથી. બારોટ પાસેથી મળતી માહિતી મુજબ હાંસબાઈ સતી મેરા ચાવડા ધરમાં હતી. અને તેમના પિતાનું નામ કરમજા ગરચર હતુ. એમના સંતાનોમાં સીયો, જેશા પુત્રો અને જવણી, જાસી, લાખી ત્રણ પુત્રીઓ હતી. આ ઉપરાંત કોઈ માહિતી ઉપલબ્ધ બની શકી નથી.

### માહિતીદાતા

- (૧) પુંજાભગત ઉ. પપ. કુક્સવાડા  
 (૨) કાના મેરામજા ચાવડા ઉ.વ. ૫૦ માંગરોળ

## મીણીસતિ ફટાણા તા.જી.પોરબંદર

ફટાણા ગામમાં સતિમીણીનો પાળિયો આજે પુજાય છે. તેમના પિતાનું નામ રાહાભાઈ નભાભાઈ કોડિ યાતર હતું. એમનું સગપણ કાળા મોરી નામના રબારી જોડે બાલ્યકાળમાંજ થયેલું. કાળો મોરી પશુપાલનનોવ્યવસાય હતો.

કાળો મોરી વગડામાં પોતાના ઘેટા – બકરા ચરાવતો હતો. ત્યાં બે ચારણ કન્યાઓ નીકળી કાળો મોરી સ્વભાવે થોડો આડવિતરો હતો. અટલે એમણે ચારણ કન્યાઓની મશકરી કરી. તેથી આ ચારણ કન્યાઓ ઉગ્ર થઈ ગઈ. અને બોલી ઉઠી ! તને સાવજ ફાડી ખાય ! એમ કહીને બીજા ગામ જતી ચારણ કન્યાઓ જ્યારે પરત ફરી ને એજ સ્થળ ઉપર પહોંચી ત્યારે જોયું તો ખરેખર કાળા મોરીને સાવજે ફાડી ખાયો હતો.

આ દ્રશ્ય જોઈ ચારણ કન્યાઓને પસ્તાવો થયો. અને હદ્ય વિહવળ બની ગયા. અને શાપ બદલ પસ તાવો થયો. અને આખરેએ પસ્તાવાને કારણે બધી ચારણ કન્યાઓ જમીનમાં સમાઈ ગઈ.

આ ઉપરોક્ત ઘટના ના સમાચાર વાયુવેગે આખા પંથક ફેલાઈ ગયા. મીણીને આ વાતની જાણ થઈ તપાસ કરતાં કાળા મોરીની પછેડી હાથમા આવી અને પછેડી લઈને મીણબાઈ સતી થયા.

સતી મીણબાઈ વિશેની બાબુ લીબડીયાએ રચના કરી છે જે આ પ્રમાણે છે.

" મોટી સતી મીણબાઈ, કુળની કોડીયાતર  
 લીલુડી રાણ્યુ લીલુડા આંબા લીલો મીણીનો નેશ  
 મીણી વધાવે નવલે જડે કણાભર્યા કાઠોર,  
 ફઢાણે તારા બેસણા દશે જાણો દેશ  
 ભાઈ તારો સાવજે માર્યો નગો ઠેબો ને કારો,  
 આવી મેણાલ ધરોઘર કુળ ઉજાણ્યુ કોડીતરનુ,  
 મોરી ઘેર વંશ રાખ્યો નથી ગાયો તારો ભાવ ચારણ ભાટ,  
 લીબડીયા બાબુએ ગાયો તારો ભવ રાખ્યા નવ જગ નામ

### માહિતીદાતા

- (૧) ઈશાભાઈ લીબડીયા બળેજ વાળા ઉ.વ. ૮૮  
 (૨) કાનજી હીરજી બારોટ જુનાગઢ ઉ.વ. ૭૫

## સતી વાલબાઈમાં

સાયલા તાલુકાના ગોહળ ગામ જે સાયલા થી ૮ કિ.મી.ના અંતરે આવેલું છે. ત્યા સાસરે હતાં. અને મુજિ પાટીયા પાસે દિગસર ગામમાં મકવાણા રબારી ની દિકરીહતા.

વાલબાઈમાં પોતાના ઘરેથી પાણી ભરવા માટે જતાં ત્યારે કુવામાં પાણી આપમેળે ઉપર આવી જતું. જેથી બીજા બૈરાને પાણી ભરતાં વાર લાગતી, જ્યારે વાલબાઈ માંપાણી ભરીને તરતજ આવી જતાં. જેને કારણેતેના સસરાને શંકા ઉભી થઈ કે, વાલબાઈ માં તરતજ પાણી ભરીને કેમ પાછા આવી જાય છે. એટલે તેના સત્ય ચકાસવાનો પ્રયત્ન કરતાં વાલબાઈ સતી થયેલા હોવાનું અનુમાન છે.

વાલબાઈમાં ભક્તિના સંસ્કારો બાલ્યકાળથીજ હતા. પરંતુ પોતાની ભક્તિને અને શક્તિના ક્યારેય પ્રગટ થવા દીધા ન હતાં. પરંતુ પાણી ભરવાની ઘટનાથી ઉપરોક્ત ઘટના બની.

### માહિતીદાતા

(૧) લક્ષ્મણભાઈ વશરામભાઈ બકારોટ—જામકંડોરણા ૩.૬૬

## ઉપસંહાર

સૌરાષ્ટ્રના રબારી સંતો ભક્તો અને સતીઓ વિશે આ કાર્યો ઘડી ચીવટથી કર્યું હોવા છતા એમાં કયાંક ગુંઠી ઓરણી જવા પામી હશે. એ દરગુજર કરવા વિનંતિ છે પરિભ્રમણ કરવા છતાં કેટલાક સંતો, ભક્તો એ માહિતી આપવામાં સહયોગ ન આપ્યો હોય તેના માત્રા નામોનો ઉલ્લેખ કરીને સંતોષ માનીએ. એવા સંતો છે. જામનગરના બેડગામના મુણાબાપા જ્યાત નામ છે. સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારીયા ગામે વજાભગત તરીકે ઓળખાતા ભગત ટ્રસ્ટ બનાતીને લોકસેવાના કાર્યો કરે છે. પરબની રબારી સંત પરંપરામાં દેવુમાં અનેપ્રેમીલાબેન પણ સંત જીવન જીવે છે. આ બધા સંત સ્થાનકોની મુલાકાત આ લખનારે લીધી છે. પરંતુ કોઈ પણ પ્રકારનું લખાણ એમના વિશે ન થાય માટ માહિતીનો ઈન્કાર કરેલ હોય આપણે વધારે વાત કરતાં નથી.

સૌરાષ્ટ્રની રબારી જ્ઞાતિના આ સંતો ભક્તો અને સતીઓ વિશેના સંશોધન માટેના ક્ષેત્રીય કાર્ય દરમ્યાન કેટલાક શૂરવીર અને દાતારોની માહિતી પણ ઉપલબ્ધ બની હતી. પરંતુ વિષયક્ષેત્રની માર્યાદાને ધ્યાનમાં શાખી એ બાબત અહીં છોડા દેવામાં આવી છે.

બાદશાહની બેગમની સારવાર કરીને ઈનામમાં લોકસેવાના વચન મેળવનાર વકોચાવડો લાખાફુલાણીના લશ્કરને જમાડનાર મેંદરો છેલણો કે, દુષ્કાળ પાર કરાવનાર બોડો છેલણો કે, દિલ્હીની ગાઢી સર કરનાર વેરાવળનો કોડિયતાર રબારી (મલેક ખુશરૂ) માડોહુણ આવતો અનેક શૂરવીર અને દાતારો આ સમાજમાં થયા છે. પરંતુ એ અલગ સંશોધનો વિષય હોય માત્ર ઉલ્લેખ કરી વાત પૂરી કરીએ.